

‘બિષુરત જાયે પ્રાણા.....’

આચાર્ય વશોવિજયભૂસિ

બિષુરત જાયે પ્રાણા.....’ ‘બિષુરત જાયે પ્રાણા.....’ ‘બિષુરત જાયે
બિષુરત જાયે પ્રાણા.....’ ‘બિષુરત જાયે પ્રાણા.....’ ‘બિષુરત જાયે

जीहुकत भये प्राणा.....

पूज्यपाद सिद्धर्षि भगवंत कृत जिन स्तवना पर संवेदना....

आचार्य चशोविजयसूरि

श्री जुनाडीसा जैन संघ

પ્રથમાવૃત્તિ : વિ. ૨૦૫૬

પુનર્મુદ્રણ : વિ. ૨૦૬૧

મૂલ્ય : પચાસ રૂપિયા

પ્રાસિસ્થાન :

- આ. ઊંકારસૂરિ આરાધના ભવન
ગોપીપુરા, સુભાષ ચોક,
સુરત-૩૮૫૦૦૧.
- સરસ્વતી પુસ્તક ભંડાર
હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
- નવ ભારત સાહિત્ય મંદિર
મોટા મહાવીર સ્વામી દહેરાસર પાસે,
ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.

મુદ્રક :

કિંચીટ ગ્રાફિક્સ

૨૦૮, આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ-૧. ફોન : ૨૫૭૫૨૬૦૨

ઃ તારક છાયા :

શ્રી જુનાડીસા મંડન પરમતારક દેવાધિદેવ

શ્રી મહાવીર સ્વામી ભગવાન

શ્રી જુનાડીસા મંડન પરમતારક દેવાધિદેવ

શ્રી ઋષભદેવ ભગવાન

ઃ દિવ્ય આશિષ :

પૂજ્યપાદ, વચનસિદ્ધ યુગપુરુષ આચાર્ય ભગવંત

શ્રીમદ્ વિજય સિદ્ધસૂરીશ્વરજી મહારાજા

પૂજ્યપાદ, નિ:સ્પૃહ શિરોમણિ

મુનિપ્રવર શ્રી વિનયવિજયજી મહારાજા

પૂજ્યપાદ, ભક્તિયોગાચાર્ય, સંયમૈકટટિ આચાર્ય ભગવંત

શ્રીમદ્ વિજય લદ્રસૂરીશ્વરજી મહારાજા

પૂજ્યપાદ, વિદ્વદર્થ મુનિપ્રવર શ્રી જનકવિજયજી મહારાજા

પૂજ્યપાદ, સંયમૈકનિષ મુનિપ્રવર શ્રી હ્રીકારવિજયજી મહારાજા

પૂજ્યપાદ, તપસ્વિરલ મુનિપ્રવર શ્રી વિલાસવિજયજી મહારાજા

પૂજ્યપાદ, શાસનધૂરીણ આચાર્ય ભગવંત

શ્રીમદ્ વિજય ઊંકારસૂરીશ્વરજી મહારાજા

પૂજ્યપાદ, વર્ધમાનતપોનિષિ આચાર્ય ભગવંત

શ્રીમદ્ વિજય લદ્રકારસૂરીશ્વરજી મહારાજા

ઃ આશિષ :

પૂજ્યપાદ, પ્રશાન્તમૂર્તિ આચાર્ય ભગવન્ત

શ્રીમદ્ વિજય અરવિનદસૂરીશ્વરજી મહારાજા

પૂજ્યપાદ, આગમપ્રશ શુતસ્થવિર

પ્રવર્તક મુનિપ્રવર શ્રી જંબૂવિજયજી મહારાજા

પૂજ્યપાદ આરાધનારત મુનિરાજશ્રી જિનયન્દવિજયજી મહારાજ સાહેબ

પૂ. સાધીજી કલ્યાલતાશ્રીજી મહારાજ (માતુશ્રી મહારાજ)

મબ્દ્ય અતીતથી ભજવમાન વર્તમાન ભુધી નોંબી જુનાડીભા

કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા જુનાડીસા
નગરે પધારેલા તે સમયની એક ભક્તિગાથા યાદ આવે છે.

એક ભાવકને પોતે જાતે કાંતેલ ખાદીનું વસ્ત્ર પૂજ્ય ગુરુદેવને
વહોરાવવાનું મન થયું. આશંકા હતી કે આવા મોટા ગુરુજી આવું
સાહું, ઝાડું, બરછટ વસ્ત્ર સ્વીકારશે ?

એના ભાવને પૂજ્યશ્રીએ સ્વીકાર્યો. પાટણમાં પ્રવેશ વખતે ગુરુદેવે
એ જ વસ્ત્ર ઓઢેલું. કુમારપાળે જ્યારે આવું વસ્ત્ર ગુરુદેવના શરીર
પર કેમ આવી પૃથ્ઘા કરી ત્યારે પૂજ્યશ્રીએ પેલા અનામી શ્રાવકની
હદ્યોર્ભિની વાત કરી.

આવી હતી ભક્તિનગરી જુનાડીસા.

● ■ ●

જગદ્ગુરુ હીરવિજ્યસૂરિ મહારાજની સાધનાસ્થળી હતી.
જુનાડીસા. ત્યાંના ઉપાશ્રયમાં તેમણે શાસનદેવીને યાદ કરેલ અને
શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને કહેલ કે તેમના અનુગામી બનશે આચાર્ય
વિજ્ય સેનસૂરિજી.

● ■ ●

ભક્તિ અને સાધનાની આ ભૂમિને આપણા યુગમાં ફરીને નીખારી
પૂજ્યપાદ યુગમહર્ષિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્ય ભક્તસૂરિ મહારાજે.

આ નગરીમાં થયેલા તેઓશ્રીના ચોંડ જેટલા ચાતુર્માસોમાં એવું
તો ધર્મભાવનાનું પૂર વહું કે ૧૦૮થી વધુ મહાનુભાવોની દીક્ષાભૂમિ
બની જુનાડીસા નગરી.

● ■ ●

સાધનાભૂમિને બીજા સાધનાગુરુ મળ્યા પૂજ્યપાદ નિઃસ્પૃહ
શિરોમણિ આચાર્ય ભગવંત શ્રીમતુ કીર્તિસાગરસૂરિજી મહારાજા.

તેમના પદ્ધત્પ્રભાવક, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમતુ
સુબોધસાગરસૂરિજી મહારાજાની જન્મભૂમિ છે આ જુનાડીસા નગરી.

આ ઓલિયા સંતોષે આ નગરને ખૂબ ખૂબ આશીર્વાદો પાઠવી
તેની ધાર્મિકતાને નિખારી છે.

● ■ ●

પૂજ્યપાદ, મધુરભાષી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય
જિનપ્રભસૂરિજી મહારાજાની પણ જન્મભૂમિ છે આ જુનાડીસા નગરી...
તેઓશ્રીની આચારનિષ્ઠા અને ઉદારતા તથા નિઃસ્પૃહતા સ્મરણીય છે.

પૂજ્યપાદ, શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય
અંકારસૂરિજી મહારાજાની કર્મભૂમિ રહી જુનાડીસા નગરી...

પૂજ્ય દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજાની
સાથે તેઓશ્રીનાં પણ અનેક ચાતુર્માસો આ ભૂમિ પર થયા.

● ■ ●

જુનાડીસા નગરી બે ભવ્ય જિનાલયો, ફ ઉપાશ્રયો, પાઠશાળા,
બે શાનમંદિરો, આયંબિલશાળા, ભોજનશાળા, ધર્મશાળાભવન તથા
પાંજરાપોળ આદિથી શોભતી નગરી.

ભીલાદિયાજી તીર્થ અને વાધપુરા ગામે આવેલ શ્રી ભદ્રકીર્તિ વિહાર
ધામ (શ્રી ઉવસગગહરં પાર્વતનાથ તીર્થ) નો સુચારુ વહીવટ શ્રી
જુનાડીસા સંધ્ય દ્વારા થાય છે.

જુનાડીસા નગરીની પાંજરાપોળમાં લગભગ ૪ થી ૫ હજાર
પશુઓની સારી માવજત થાય છે.

● ■ ●

પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમત્ સુબોધસાગરસૂરિ
મહારાજ, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહરકીર્તિસાગરસૂરિ
મહારાજ, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અરવિન્દસૂરિ
મહારાજ, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ યશોવિજયસૂરિ મહારાજ,
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મુનિયાન્દસૂરિ મહારાજ,
પૂ. ઉપાધ્યાય પ્રવર શ્રી મહાયશવિજયજી મહારાજ, પૂ. વિદ્વદર્ય
મુનિરાજ શ્રી કુરંધરવિજયજી મહારાજ, પૂ. મુનિરાજ શ્રી
યુગ્માભવિજયજી મહારાજ આદિની વિચરણ ભૂમિ છે આ જુનાડીસા
નગરી.....

ભક્તિ અને સાધનાની આ નગરી જુનાડીસા... ઐતિહાસિક
નગરી આ જુનાડીસા... અમારી આ નગરી જુનાડીસા... અમારી આ
નગરી પર ધર્માશિષ વરસાવનાર સહુ પૂજ્યોનાં ચરણોમાં વંદના...

- શ્રી જુનાડીસા સંદ્ઘ

૫૧ પૂજયપાદ મહોપાધ્યાય માનવિજ્ય મહારાજે પરમ
તારક શ્રી કુન્યુનાથ ભગવાનની સત્તવનામાં કહ્યું છે : 'મિલિયા
ગુણ કલિયા પછી રે લાલ, બિછુરત જાયે પ્રાણ...'

૫૨ અહીં ભક્તિયોગનાં ત્રણ હદ્યંગમ સતરની વાત થઈ
છે : પરમાત્મ-મિલન, ગુણકલન અને એકાકારતા.

૫૩ પહેલાં થાય છે પરમાત્માનું દર્શન... શી રીતે થયું આ
દર્શન ? આ ભેટવાનું... આ મિલન શી રીતે થયું ? યાદ
આવે એક ભક્તિ સૂત્ર : 'તુમ મિટો તો મિલના હોય...'
અહેંકારનું પાતળું પડવું અને પ્રભુનું મળવું.

૫૪ બીજો તબક્કો છે ગુણકલનનો. પ્રભુ મળ્યા પછી જે
સુખનો ને આનંદનો પ્રદેશ શરૂ થાય છે, તેનો હવે જ
અનુભવ થાય છે. અચછા, તો અત્યાર સુધી જેને સુખનું
નામ આપતા હતા એ તો હતું ઝાંગવાનું નીર...

૫૫ પ્રભુમિલન દ્વારા પોતાને મળતા ગુણોનો ઘ્યાલ આ
તબક્કે ભક્તાને આવે છે.

૫૬ ત્રીજું ચરણ છે : પ્રભુમિલનનો તીવ્ર અનુભવ. 'બિછુરત
જાયે પ્રાણ.' પ્રભુની ઓઝેનો એક ક્ષણનો વિયોગ પણ હવે
સહ્ય નથી. આ ક્ષણોનું જીવંત ચિત્રણ મળે પૂ. આનંદધનજી
મહારાજના શબ્દોમાં : 'આનંદધન બિન પ્રાન ન રહત છિન,
કોટિ જતન કરી લીજે...' પ્રભુ વિના એક ક્ષણ પણ હવે
જાય એમ નથી. કરોડો બીજા પ્રયત્નો કરો, પ્રભુ નહિ તો
કંઈ નહિ.

ભક્ત હદ્યની આ ક્ષણોનું પ્રતિબિંબ પૂજયપાદ સિદ્ધાર્થ
મહારાજના શબ્દોમાં અહીં પ્રસ્તુત છે.

ਜੀਛੁਕਤ
ਮਦੇ ਪਾਣਾ.....

अपारधोरसंसार-
निभग्नजनतारक !
किमेष धोर संसारे
नाथ ! ते विस्मृतो जनः ॥ ९ ॥

प्रभो ! धोर संसारमांहे दूषेला,
जनोने तमे तारता तो'य व्हेला;
मने दूषतो धोर संसारमांहे,
मूकी केम चाल्या गया मोक्षमांहे.

अपार अने धोर-भयंकर संसारमां बूङता ज्वोने
तारनारा हे नाथ ! मने आ धोर संसारमां
केम लूली गया ? मने अहीं मूकीने केम एकला
मोक्षमां चाल्या ?

મને કેમ ભૂલી ગયા તમે, દેવ ! મને અહીં સંસારમાં મૂકીને તમે મોક્ષમાં શી રીતે જઈ શક્યા ? હું અહીં દુઃખથી ભરપૂર સંસારમાં, તમે ત્યાં આનંદધામ મોક્ષમાં..... !

તમારા વિના હું આ ભયંકર સંસારમાં શી રીતે રહી શકું ? એક જબરદસ્ત આશ્ચર્ય, એક મોટી હુંફ સિવાય અહીંની એક એક કણ યુગ જેવી થઈ પડે તેમ છે.

તમારા વિનાની કણો..... એ એક એક કણ વરસોના વરસ જેવી, ખૂટે નહિ તેવી લાગે છે. ‘ખિણ વરસાં સો જાય રે.....’ તારો વિરહ. શી રીતે એને સહી શકાય ? ક્યાં સુધી આ વિરહાજિનિમાં જુલસવાનું ? નહિ, તમારા વિના હું નહિ રહી શકું. કેવી હાલત છે મારી ? સૂરદાસની ભાષામાં કહું તો, ‘નિશ દિન બરસત નૈન હમારે.....’ આંખની નાની સી વાદળીઓ સતત ઝર્યા કરે છે.... ‘સદા રહત બરસા રિતુ હમ પર....’

હું પૂછી શકું કે, ‘અમારી આંખનાં આંસૂ તમે પ્રભુ ! લૂછશો ક્યારે?’ આખરે, તમારા આવા ભક્તની સાથે ચુપ્પી ક્યાં સુધી તમે રાખશો ? આંખો છલછલાઈ રહી છે. કાગળ પરના અક્ષરો ચેરાઈ જશે એમ લાગે છે. પણ મારે બીજા કોને આ વંચાવવાનું છે ? ને તમે તો અન્તર્યામી છો. ફરી મારા પ્રશ્નને તમારા ચરણોમાં મૂકું : જેને આવું સતત સ્મરણ

તમારું રહ્યા કરે છે, તેને તમે કેમ ભૂલી ગયા ? તમારા વિના મને નહિ ચાલે. તો પછી મને અહીં રવડતો, રડતો, એકલો-અટૂલો મૂકી તમે કેમ સિદ્ધશિલા પર જતા રહ્યા ?

‘અપારઘોરસંસારનિમગ્નજનતારક !’ કિનારો જેનો નથી દેખાતો એવા ભયંકર સંસાર સાગરમાં રૂબેલા મનુષ્યોને તારવામાં તમારી નામના પ્રસિદ્ધ છે. તમે અનંત આત્માઓને તાર્યા પણ છે. સજજનોનેય તાર્યા છે. અને અપરાધીઓને પણ તાર્યા છે.... તો પછી મને કેમ ભૂલી ગયા ?

‘ઋષભજિન વિનતિ’ માં પૂજ્ય વિનયવિજ્ય મહારાજ કહે છે : ‘તાર્યા તુમે અનંત રે, સંત સુગુણા વળી, અપરાધી પણ ઉદ્ધર્યા રે, તો એક દીનદયાળ રે, બાળ દ્યામણો, હું શા માટે વીસર્યો એ.....’

‘મને કેમ ભૂલી ગયા ?’ ધૂવપદ છે આખા ગાનનું. વારંવાર એને દોહરાવવું છે. એટલીવાર દોહરાવું કે આખરે મને યાદ કર્યા વિના તમને ન ચાલે. (સાંભળો છો ને, પ્રભુ ?)

થોડું વધુ રૂદન. આંસૂની ગંગોત્રી ગંગામાં પલટાય..... પ્રભુ ! એક વાત પૂછું : તમે કેટલા અશ્વબિન્દુથી રીજો ? મીરાંને કો’કે પૂછેલું : તું આટલી નાનકડી છોકરી. તેં પરમપ્રિયને શી રીતે રીજવ્યા ? મીરાંએ કહેલું : અંસૂઅન સીંચ સીંચ પ્રેમબેલિ બોઈ... ઘડે ઘડા આંસૂના ઠાલવ્યા છે, ત્યારે એ રીજવ્યા છે.

ખબર છે કે આનંદઘનજીએ રાતોની રાતો સંથારાને ભીજવેલો... આસ્થાનો દીપ સહેજ ઓળપાઈ જાય છે. આવા ભક્તોને જો આટલાં બધાં અશ્વબિન્દુ જોઈએ તો મારે કેટલી સરવાણી આંસૂની વહાવવાની ?

કહો ને ! તમે કહેશો તેમ કરવા હું તૈયાર છું. મારે તમને રીજવવા જ છે. જેથી મારી ભક્તિ થોડી વધુ પાકટ બને. ચૌદ રાજલોક દૂર બેઠેલ તમારા સુધી આ આકન્દ પહોંચે.....

પ્રભુ ! આ મારાં દૂસરાં તમને સંભળાય છે ને ? ‘નાથ ! તે વિસ્મૃતો જનઃ’ તમારા દાસને તમે ભૂલી શકો ? જો કે, અન્તસ્તર કહે છે કે તમે મને ભૂલી ન જ શકો. પણ તમે મારાથી દૂર છો એ હકીકતને હું અવગણો પણ કેમ શકું ? તમારાથી હું દૂર છું તે સત્ય કે હું તમારા ખોળામાં છું તે સત્ય ? હું ગપચાઈ જાઉં છું. સચ્ચાઈ ક્યાં છે, પ્રભુ ? મને કંઈ સૂજતું નથી.

પણ લડવા માટે ને રડવા માટે મારે તો એક જ મુદ્દાની વાત જોઈશે : તમે મને ભૂલી ગયા છો. માટે ફરી પ્રશ્નનું ફૂલ તમારા ચરણોમાં : મને કેમ ભૂલી ગયા ?

તમે ત્યાં આનંદધામ મોક્ષમાં, હું દુખમય સંસારે. કેટલી બધી દૂરી?

દૂરીને ઓગાળો, પ્રભુ ! તમારા સાનિધ્યમાં મને રાખો. મીરાનાં શબ્દોમાં કહું : ‘મને ચાકર રાખોજુ !’



સદ્ગાવપ્રતિપત્રસ્ય-
તારણે લોકબાન્ધવ !
ત્વયાજસ્ય ભુવનાનંદ !
ચેનાદ્યાપિ વિલમ્બ્યતે ॥ ૨ ॥

તમારા ગુણે ભાવના શુદ્ધ આવે,
જગદ્ભંધુ ! વંદુ ભલા ભક્તિ ભાવે;
તથાપિ મને તારતાં કોણ વારે ?
તમોને વધુ શું કહેવું અમારે ?

હે જગદ્ભંધુ ! હે વિશ્વને આનંદ આપનારા
નાથ ! આપના પ્રત્યે મને સદ્ગાવ છે. આપને
હું સાચા હદ્યથી ચાહું છું, મને તારવામાં
આપ કેમ વાર કરો છો ? આપને કોણ વારે
છે ? કોણ અટકાવે છે ?

તમે ભુવનાનંદ છો, પ્રભુ ! આખા જગતને આનંદ આપનારા...તો
મને કેમ રડાવો છો ?

અને મને રાજુ કરવો એ કેટલું તો સહેલું છે ! તમારો એક કૃપાકટાક્ષ
મને મળશે ને મારો ચહેરો પ્રસરતાથી છલકાઈ ઊઠશે : ‘મારા નાથે
મારા સામું જોયું !’

હું યુગોના યુગો સુધી અનિમેષ નેણે આપને જોયા જ કરું, જોયા
જ કરું.... બસ, વચ્ચે વચ્ચે તમારો પ્રતિભાવ મને મળતો રહે....એવું
થાય પણ છે. આપને જોઉં છું. હર્ષાશ્રૂઢી આંખો ભરાઈ ઊઠે છે. દર્શન-
સુખ આડે જાણો કે પડદો આવી ગયો હોય તેમ લાગે..... પણ ના, પછી
સમજાય છે કે એ કણો તમારા પ્રતિભાવની કણો હતી.... ચિત્ત અકારણ
આનંદથી સત્તર બને છે. સમજાય કે તમે મારી આ ભક્તિને સ્વીકારી
છે એનો સંકેત તમે આપ્યો’તો....

જો કે એક પ્રશ્ન અંતરને વલોવ્યા કરે : મારી આ ભક્તિ.... શું
આને ભક્તિ કહી શકાય ? નથી ભક્તિના માર્ગની ગમ, નથી
ભક્તિશાસ્ત્રનો એકડો મેં ઘૂંટ્યો; તમને જોઉં ને હરખાઈ ઊહું : આ
ભક્તિ કહેવાય ? હું ગુંચવાઈ જાઉં છું. ઘોર અરણ્યમાં, જનશૂન્ય
બિહુડમાં એકલો અદૂલો ચાલતો હોઉં, ને દીવો ઓલવાઈ જાય. કહો
તો, ગભરાઈ ન જવાય ?

પણ એ અકળામણને એક કાણ વીતી ન વીતી હોય ને કોઈ દીપ મારા માર્ગને આલોકિત કરી દે.... (એ તમે જ હતા ને !) રસ્તો ઝાંહળાં ને પગ ઊપડ્યા કરે જલ્દી જલ્દી. મંજિલ સામે દેખાય. ક્યાં ગઈ પેલી અકળામણા ?

તમે દીપ પેટાવ્યો.... અંધારાનું હવે શું થાય ? તમારી આ અનરાધાર કૃપા ! લાગે કે હર પળ તમે મારી સાથે જ છો.... અંધારામાં હું તમને બૂમ મારું એ પહેલાં પ્રકાશના રૂપમાં તમે હાજર !

તમે માત્ર ભુવનાનાનંદ નથી.... ભક્તાનંદ છો... મને આનંદ આપનાર છો એટલો જ અર્થ મને અહીં અભિપ્રેત નથી. મારા માટે આનંદની દિશા માત્ર એક જ ખુલ્લી છે : તમારા તરફ ખૂલતી. ને એટલે જ તમારું દ્વાર સહેજ બંધ થતું કલ્પું છું ને પ્રૂજ ઊં છું.

ક્યારેક અકળામણ વધી જાય છે. ક્યારેક જ. પણ હું પૂછીશ કે ક્યારેક પણ શા માટે તમે મને મૂંજવો છે ? લગભગ તો અશુભ નિમિત્ત મળે ને અશુભ ધારામાં વહેવાનું શરૂ થાય ત્યાં જ તમારી કૃપાનો હાથ મને એ વહેણમાંથી ઊચ્કીને બહાર મૂકી દે છે.

પરંતુ ક્યારેક એવું બને છે કે થોડી કાણો અશુભ ભાવનું સાતત્ય ચાલી જાય છે. પાછળથી હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડું છું : હાય ! કેવી કાજળઘરી આ કાણો હતી, જ્યાં પરમના પ્રકાશની એક નાની સી ટિમટિમાહટ પણ નહોતી... પછી ગુર્સો આવે તમારા પર કે તમે એ કાણોમાં પ્રકાર થઈ કેમ ન આવ્યા?

જરૂર, તમે કહેશો કે તેં દ્વાર એટલું સજજડ બંધ કર્યું હતું કે પ્રકાશની રેખ શ્રી રીતે ભીતર આવે ? તો હું તમને કહીશ કે તમે દીપક રૂપ જ માત્ર થોડા છો ? તમે તો બધા રૂપમાં વિલસી શકો છો. ઘણના ઘા જીકી મારા એ દ્વારને તમે તોડી-ફોડી કેમ ન નાખ્યું ?

દેવ ! આવી ક્ષણોમાં તમે વિલંબ કરો એ કેમ ચાલે ? શું હું તમારો નથી ? હું પરાયો છું કે તમે આટલો વિલંબ કરો ? 'યેનાદ્યાપિ વિલમ્બ્યતે ?' તત્કષણ સહાય માટે હું હક્કદાર નથી ?

● ● ●

હું અધિકારી છું એવું હું સમજું છું. મારી લાયકાત બીજી તો કોઈ છે જ નહિ. લાયકાત એટલી જ કે તમને મેં નાથ તરીકે સ્વીકાર્યાં છે... 'સદ્ભાવપ્રતિપત્રસ્ય...' મારી સેવામાં જરૂર ખામી છે, પણ મારી ભાવના, હું સમજું છું ત્યાં સુધી પરિપૂર્ણ છે... સામી બાજુ, તમે જ તારશો અને તમે તારી રહ્યા છો એ પણ હકીકત છે. સવાલ એટલો જ કે આમાં વિલંબ કેમ કરો છો ?

તત્કષણ પ્રતિસાદ આપો ને ! અશુભમાં ઝૂબું-ઝૂબું થવાની ક્ષણ આવે ન આવે ને તમે આવી જાવ...

ને, તમારો કોમળ હાથ જ મને રક્ષે એવું પણ હું ક્યાં કહું છું ? થપાટ/તમાચ પણ તમારી મીઠી લાગશે... એ રીતેય તમારા સ્પર્શને હું પામીશ.

ખ્યાલ છે કે ગુરુદેવને તમે જ મોકલેલા. ને પેલા દિવસે અશુભ નિમિત્ત તરફ હું ધસવા જાઉં એ પહેલાં તો ગુરુમાતાની આંખ લાલ-લાલ થઈ ઊઠેલી. એ દિવસે જ તારો પુણ્ય પ્રકોપ મેં જોયો.... પણ, તારો પુણ્ય-સ્પર્શ હવે જોઈએ ને !

અચ્છા, તું એમ કહે છે કે ગુરુની તમાચમાં મારે તારા સ્પર્શને અનુભવવાનો એમને ! તો એમ તમે કહો તેમ. તમે મારા ગુરુ. હું તમારો ચેલો. હું નથી કહેતો આમ. પૂજ્ય રામ વિજ્ય મહારાજ કહે છે : 'ધરમ જિણાંદ ! તુમે લાયક સ્વામી, મુજ સેવકમાં પણ નહિ ખામી; જુગતે જોડી મળી છે સારી..... !'

● ● ●

લોકભાન્ધવ ! પૂરા લોકના મિત્ર તમે.... બધાનું ઈચ્છિત પરિપૂર્ણ
કરનાર તમે.... હા, બધાનું. મારું નહિ. મારી વાત આવશે ત્યારે તમારી
કુટપણી જુદી જ રહેવાની.

બધાનું કામ ફટાફટ પૂરું થઈ જાય. મારી વાત ટલ્યે ચડવાની.

સાચું કહેજો : તમને મારી યાદ આવે છે ખરી ? તમારા નિર્મળ
જ્ઞાનમાં સદાય મારું પ્રતિબિંબ પડ્યા કરે છે એવું તમે કહેશો એ મને
ખબર છે. પણ મને એનાથી સંતોષ નહિ થાય. એવું પ્રતિબિંબ તો
બધાનું પડે છે. મારા માટે કોઈ વિશેષ ખૂણો તમારા અન્તસ્તરમાં છે ?

તો પછી, મને કેમ ભૂલી ગયા ? મને મૂકીને મોક્ષે કેમ ચાલ્યા ગયા ?
ને જવું પડ્યું તો સર્વશક્તિમાન એવા તમે મારી ખબર-અંતર કેમ રાખતા
નથી ?

‘યેનાદ્યાપિ વિલામ્બ્યતે...’ હવે વિલંબ ન કરો ! મને તમારા સાન્નિધ્યમાં
જ રાખો, દેવ !



આપન્નશરળે દીને-
 કરુણામૃતસાગર !
 ન ચુક્ખમીદ્વશં કર્તું
 જને નાથ ! ભવાદ્વશામ્ ॥ ૩ ॥

દ્યાના સુધાસિન્ધુ આવ્યો તમારે,
 અતિદીન ને હીન હું શરણ ત્યારે;
 ન શોભે તમોને પ્રભો! મૌન રાખ્યું,
 કરો કાંઈ પણ એહ મેં સત્ય ભાખ્યું.

હે દ્યાનિધાન ! દીન અને હીન એવો હું
 આપને શરણ આવ્યો છું. ત્યારે આપ મૌન
 રહો; કાંઈ પણ ન કરો એ આપને શોભતું
 નથી. મારો વિચાર કરો, મને આપની પાસે
 લઈ લ્યો, આ હું ખરેખર સાચું કહું, હવે તો
 કાંઈને કાંઈ કરો. ને કરો જ.

હું તમારી પ્રતીક્ષામાં યુગોના યુગો સુધી બેસી રહું, પલકો બિછાવીને:
ક્યારે તમે આવો ? અને તમે આંખો ઊંચી કરી મને જુઓ પણ નહિ,
એ કેમ ચાલે ?

તમારી વીતરાગતા ખરી. પણ એ બીજા વ્યક્તિત્વો માટે. મારા પર
તો તમારે સ્નેહ જ વરસાવવો પડશે.

ગૌતમસ્વામીમહારાજની જેમ હું ય કહીશ કે, મારે જોઈએ મહાવીર.
મોક્ષ વિના મને ચાલશે; પરમાત્મા વિના નહિ. ને સામી બાજુ
ગૌતમસ્વામી પર તમારો પ્રેમ કેવો હતો એય મારી જાણ બહાર નથી
જ. ‘ગોયમા !’ ના કેવા ઘ્યારા સંબોધનથી તમે એમને સંબોધતા હતા....
એ એક સંબોધનમાં કેટલી તો મીઠાશ તમે ભેળવેલી હતી કે ગૌતમસ્વામી
ઓળઘોળ થઈ જતા તમારા પર.

અચ્છા, તમે કહેશો કે એની પાસે તો સમર્પિતતાની પૃષ્ઠભૂ હતી....
તારી પાસે એ ક્યાં છે ? હું તો દરેક પર એક સરખો જ વરસું છું,
ફરક ભોમકાનો છે.

મારા નાથ ! આ તો મેઘની ભાષા છે. મેઘ કહી શકે કે હું તો
વરસી જાઉં; ભૂમિ ગ્રહણશીલ હોય તો પકડે... નહિતર કાંઈ નહિ....
આ તમારી ભાષા ન હોઈ શકે. ને તમે પણ કદાચ બીજા માટે આ
જવાબ આપો. મારા માટે તો આ જવાબ તમારો ન જ હોય ને !

‘न युक्तमीदृशं कर्तुं जने....’ तમे मारा तરफ आ रीते न ज वर्ती शકो. भराभर ने ! बીજा કદાચ તમારા હશે. પણ હું તમારો જ છું. ને આ ફરકનું પ્રતિબિંબ તમારા પ્રતિભાવમાં પણ પડશે જ ને ?

‘આપનશરણે દીને....’ હું શરણાગત, તું શરણ્ય. હું દીન, તું દીનોદ્વારક.. હવે ઢીલ શેની છે ? મેં જોળી પસારી છે. ને તારે જ એને ભરવાની છે. તું કરુણામૃતસાગર છે. તારા સાગરમાંથી બે બુંદ તો હું માગું છું. શું હું તારી પાસેથી તરસ્યો પાછો જઈશ ? ને તો તારી પ્રતિષ્ઠાનું શું ?

નહિ, મારી વાત સીધી ને સટ છે. બીજાઓ માટે તમારા જે નિયમો હોય તે મારા માટે નહિ રાખતા. હું વિશેષ, તો મારા માટેના નિયમો પણ વિશેષ !



भीमेऽहं भवकान्तरे
 मृगशावकसन्निभः ।
 विमुक्तो भवता नाथ !
 किमेकाकी दयालुना ॥४॥

मने केम संसार कांतार मांहे,
 भयोथी भर्या हुष्ट दावाभि दाहे;
 दयाणु ! तमे एकलो केम मूळ्यो,
 लघु बाण सारंग शो साथ चूक्यो.

भयोथी भरेला, दावानलथी सणगता आ
 संसाररुपी जंगलमां मृगना बाण समा मने
 एकलो मूळीने हे दयाणु प्रभु ! आप केम
 शिवनगरमां चाल्या गया छो ? अहीं मारूं कोण्ठ ?
 आपना सिवाय मारी संबाण कोण्ठ करे ? आप
 ज मारा रक्षक छो.

इतश्चेतश्च निक्षिप्त-
चक्षुस्तरलतारकः ।
निरालप्यो भयेनैव
विनश्येहं त्वया विना ॥ ५ ॥

अહिं ने तहिं यपण चक्षुथी जोतो,
बणेलो जणेलो निराधार रोतो;
विना आप ना कोई आधार मारे,
प्रभो! नाथ! तारो मने व्यो किनारे.

आम तेम चारे तरक चंचण नजर फेरवतो,
निराधार, बणेलो जणेलो हुं हरण समो भुवनमां
भमुं छुं, आप सिवाय मारे बीजो कोई आधार
नथी, मने तारो-पार उतारो, किनारे व्यो. बचावी
व्यो. हुं आपने शरणे छुं.

રૌદ્ર સંસાર વનમાં, મૃગશિશુ સો અટૂલો હું.

નાનકડું હરણનું બચ્યું. મા સાથે જ છે, પાસે જ ચરી રહી છે મા એ આશ્વસ્તતાથી ધાસમાં બેસી રહ્યું છે મૃગબાળ. પણ થોડીવાર પછી આંખ ઊંચી કરી જુએ તો..... અરે, મા ક્યાં ? ક્યાય એ દેખાતી નથી. ક્યાં હશે એ ? કેવી તો કાતરતા ડોકાય છે તેની આંખોમાં ! વ્યાકુળતા, બેબાકળાપણું, શૂન્યતા.... આ જ શૂન્યતા આજે મારી આંખોમાં નથી દેખાતી તમને ?

ભયંકર આ સંસારનું જંગલ. બીહડ, ઘન. દિવસે પણ જ્યાં સૂર્યના કિરણો પ્રવેશી શકતા નથી. તમે આવા નિર્જન બીહડમાં મને એકલો, અટૂલો છોડીને ક્યાં ચાલ્યા ગયા ?

‘ઇતશ્રેતશ્ર નિક્ષિસચક્ષુસ્તરલતારક:’... મા વિના આથડતા અને આમ તેમ, ચકળવકળ આંખો ફેરવતા મૃગશિશુની પેઠે હું પણ તમારા વિના મૃતપ્રાય થઈ જઈશ, પ્રભુ ! તમારા વિના, તમારા કૃપા કટાક્ષના અવલંબન વિના આ સંસાર વનમાં શેં રહી શકાય ? ‘એ જન જીવેરે જિનજી ! જાણજો રે, આનંદધન મત અંબ.....’ ‘નિરાલાઙ્ગો ભયેનૈક વિનશ્યેહમ.....’ આધાર એક માત્ર તારો છે મને. જેને આધારે મારે આ ભવાટવી પસાર કરવી છે, એ તારી કૃપાધારા જો મને દેખાતી બંધ થઈ જાય તો ભયથી હું ફફડી જ ઊંઠું.

મારી આ વેદના....વ્યથા....બીજું હોય પણ શું મારા નિવેદનમાં ?
હતાશા, બળતરા, નીસાસા, દૂમા...

રમેશ પારેખનું ગીત યાદ આવે :

‘મીરાં કહે પ્રભુ અરજી થઈને ઉભાં છીએ,
લ્યો વાંચો !

પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,
આજુ બાજુ લખી બળતરા, વર્ષે લખિયો થાક;
ચપટીક દૂમો લખતાં જીવ પડી ગયો કાચો.....’

હું તો લખ્યા જ કરીશ પત્ર. પણ તમારો પ્રતિભાવ જોઈએ. હવે
કેવી દશા થઈ ગઈ છે ! તમારા વિના બીજે કશે ગમે નહિ. ને તમે
મારા ભણી જૂઓ નહિ.

બીજાં પત્રો. બીજાનાં મારા પર આવેલ પત્રો. ખોલવાનું ય મન ન
થાય.

‘એ પરબીઠિયું શું ખોલું, જેની વાટ ન હો આંખને....
મીરાં કે પ્રભુ, ધાસ અમારો કેવળ ટપાલી,
નિશાદિન આવે જાય, લઈને થેલો ખાલી ખાલી.....’

(રમેશ પારેખ : ‘મીરાં સામે પાર....’)

બીજાનાં પત્રોનો અર્થ નહિ... માત્ર તમારા પ્રત્યુત્તરની પ્રતીક્ષામાં
બેઠો છું.

* * *

અનન્તવીર્યસમ્�ભાર !
જગદાલમ્બદાયક !
વિધેહિ નિર્ભયં નાથ !
મામુત્તાર્થ ભવાટવીમ ॥ ૬ ॥

અનન્તું મહાવીર્ય છે આપ પાસે,
જગજજીવ જીવે પ્રભુ આપ આશે;
મને પાર સંસાર વનથી કરો તો,
બનું મુક્ત ભયથી સદા હું પનોતો.

હે અનન્તવીર્યને ધરનારા, અને વિશ્વને
આલંબન આપનારા, નાથ! મને ભવ અરણ્યથી
પાર ઉતારો અને નિર્ભય કરો ! આપ અભય
દેનારા છો, આપ જ મને અભય આપશો. એ
આપી ધો એટલે બસ.

મને ભવાટવીને પેલે પાર મૂકી દેવો એ આપના માટે તો બહુ સરળ છે, પ્રભુ ! અનંત આત્માઓને આપે ભવાટવી પાર ઉતાર્યા છે. તો મને એકને પાર ઉતારતાં આપને શો સમય લાગવાનો ?

આપ અનંત શક્તિના માલિક છો. અને હું આપને શરણે આવ્યો છું, હવે મને તારવામાં કેમ વિલંબ કરો છો ? પૂરા બ્રહ્માન્ડના આપ સ્વામી છો. આપ અખિલેશ્વર છો. બધાને અવલંબન રૂપ આપ છો. બસ, એક મારી વાત આવે છે ત્યારે આપ નજર ફેરવી લ્યો છો. મારી અરજી પર આપની દસ્તિ પડતી નથી.

મારો શું વાંક ?

મારો શું ગુનો ?

આપ કહો તો મને ઘ્યાલ આવે.

ગૌતમસ્વામી મહારાજે કહ્યું તું : ‘ખામી કદ્ય ખીદમત મેં કીની, તાકી યાહી કમાની.....’ મારીય ખામી તો ઘણી છે ખીદમતમાં. પણ એ ખામીવાળી ખીદમત / સેવા પણ આપ સ્વીકારો !

મારવાડી ગૃહસ્� યાત્રાએ ગયેલ. વચ્ચે પૈસા ખૂટચા. એક શહેરની પ્રતિષ્ઠિત પેઢી પર જઈ એમણે કહ્યું, મને પાંચ હજાર રૂપિયા આપો. હું

ઘરે જઈ તમને પહોંચાડી આપીશ. એમના મુખ પરની શાલીનતા જોઈ તેમને પૈસા આપવા તૈયાર થયેલ પેલા શ્રેષ્ઠીએ થોડી વધુ ખાતરી કરવા કહ્યું : તમે તમારી એવી કોઈ વસ્તુ આપો. જે પર અમે રૂપિયા ધીરી શકીએ.

શું આપવું ? અલંકારો વગેરે હોત તો પૈસા માગતે શા સારુ ? મારવાડી સજજને પોતાની દાઢીમાંથી એક વાળ કાઢી આપ્યો અને કહ્યું, લ્યો ! શ્રેષ્ઠીએ પરીક્ષા કરવા કહ્યું : આ વાળ તો વાંકો છે. બીજો આપોને !” અને તરત જ પેલા સદ્ગૃહસ્થ બગડ્યા : ‘વાંકો પણ મારો છે ને !’

વાળ સ્વીકારાયો. પૈસા અપાયા.

એમ મારી સેવા છે ને ! એને સ્વીકારો ! ભલે તુટિપૂર્ણ. તુટિમય... થીગડાંથી ભરેલાં વસ્ત્રમાં મૂળ કપડાનો રંગ ઘ્યાલ ન આવે એવી મારી આ સેવા. એમાં તુટિ જ તુટિ છે. પણ હું તો કહી શકું ને કે, ‘પ્રભુ! મોહે અવગુણ ચિત્ત ન ધરો ! સમદર્શી હે નામ તિહારો, ચાહે તો પાર કરો !’ તમે સમદર્શી. સેવાને ને એમાં રહેલી ખામીને એક કરી જોનારા...

મારી સેવા સ્વીકારો. ને મને ભવાટવીને પેલે પાર લઈ જાવ !

મને ઘ્યાલ નથી આવતો કે ક્યાં આપ..... આપની શક્તિનો ઓરાંછોર નહિ; બીજાને આલંબન આપનાર આપ. મારું ઉપાધિપૂર્ણ આ સંસારમાં રહેવું એ આપના આ બેઉ વિશેષણોને પડકાર રૂપ નથી શું ?

હા, હવે થોડો ઘ્યાલ આવ્યો. આપનો હાથ મારા તરફ ઘણી વાર લંબાયેલો. મેં ક્યારેક એને ક્ષાળાર્ધ માટે પકડેલ પણ ખરો. ને મેં એને છોડી દીધેલ. જરૂર, મારી આ ભૂલ હતી. પણ એ વિવશતામાં થયેલી ભૂલ ન હતી? હું મોહના કેફમાં, સારાસારના ભાનથી પર. અચ્છા, તો તમારે એ વખતે મને ઊચ્કી નહોતો લેવો જોઈતો ?

ચાલો, હવે....તમે અનજી શક્તિના ભંડાર. મારા જેવા સામાન્ય વ્યક્તિત્વને પેલે પાર લઈ જવો એ આપના માટે ડાબા હથનો ખેલ. ‘વિધેહિ નિર્ભયં નાથ !’ મને ભવાટવીને પેલે પાર લઈ જાવ.

ભવાટવી.... બહુ જ બિહામણી.... ખાસ તો એ સંદર્ભમાં કે તમે ત્યાં નથી. તમે ભવાટવીને પેલે પાર તો હું ભવાટવીમાં કેમ ? મારે રહેવું છે તમારા સાત્ત્બિધ્યમાં જ, દેવ !

ગમે તેવું દુઃખ પણ મને સહ્ય છે; જો એ દુખની કાળોમાં તમારું સાત્ત્બિધ્ય હોય. રવીન્દ્રનાથ ટાગોર કહે છે :

‘હુખ જ્યારે મર્મની અંદર પ્રવેશો,
ત્યારે તે તારા હસ્તાક્ષર લઈને આવો,
કઠોર વચનો ગમે તેટલા આઘાતો કરે,
સર્વ આઘાતોમાં તારો સૂર જાગી ઉઠો....
પ્રાણના સેંકડો વિશ્વાસ જ્યારે તૂટી જાય
ત્યારે એક વિશ્વાસમાં મન વળગેલું રહો....

• • •

સંસારમાં તેં મને જે ઘરમાં રાખ્યો છે,
તે ઘરમાં બધાં દુઃખ ભૂલીને હું રહીશ.
કરુણા કરીને તારે પોતાના હાથે
તેનું એક બારણું નિશાદિન ખુલ્લું રાખજે.
મારા બધાં કાર્યોમાં અને બધી કુરસદમાં
એ દ્વાર તારા પ્રવેશ માટે રહેશે.
તેમાંથી તારા ચરણની રજ લઈને
વાયુ મારા હદ્ય પર વાશે.....’

(‘પરમ સમીપે’, પૃ.૩૭)

* * *

ન ભાસ્કરાદ્વતે નાથ !
 કહમલાકરબોધનમુ ।
 યથા તથા જગન્નાન્નેત્ર !
 ત્વદૃતે નાસ્તિ નિર્વીતિ : ॥૭ ॥

પડે સૂર્યના અંશુઓ પદ્મખંડે,
 ખીલે પદ્મ સૌરભ ભરે ખંડખંડે;
 જગન્નાન્નેત્ર સ્વામી ! રહો જો હજૂરે,
 મળે શાન્તિ પૂરી પરિતાપ દૂરે.

હે ભગવન્ ! પદ્મોથી ભરપૂર સરોવરમાં સૂર્ય
 ઉગતાની સાથે જ કમળો વિકસવા લાગે છે.
 ચારે કોર સુગન્ધ પ્રસરે છે. એ જ પ્રમાણે આપ
 સમીપે રહો છો ત્યારે અપૂર્વ શાન્તિ મળે છે
 સંકટ સર્વ શમી જાય છે.

ખીદમતમાં રહેલ ખામીઓની હું વાત કરતો હતો. અને એ ખામીઓ તરફ આપ ધ્યાન ન દેશો તેમ હું આપને વિનવતો'તો.

પણ, હવે લાગે છે કે, હું કશું જ કરી શકું તેમ નથી. ખીદમત હું કરું તો કરું શી રીતે, નાથ ?

જ્યાં તમને જોઉં છું ત્યાં બધું ભૂલી જાઉં છું.

તમને જ્યારે નથી જોતો ત્યારે બેબાકળો, શૂન્ય-મનસ્ક બની જાઉં છું.

હું શું કરું દેવ ?

તમને જોઉં છું, તમારી કૃપાધારાને અનુભવું છું. ત્યાં હું નાચી ઊંઠું છું. પ્રકુલ્પ બની જાઉં છું. (શ્લોક ૧૫ : મચ્ચિતં પવ્યવત્ત્રાથ ! દૃષ્ટે ભુવનભાસ્કરે...) એ પ્રકુલ્પતામાં / એ હર્ષોત્કુલ્પતામાં હું બીજું બધું ભૂલી જાઉં છું. તમને જોઈ રહું છું. તમારી કૃપાધારામાં નહાઈ રહું છું. બીજું કાંઈ સૂઝતું નથી. આને જો આપ સેવા ગણતા હો તો મારી આ સેવા છે....

અને બીજું છે મારી પાસે અશ્રૂપૂર. તમારા વિરહમાં આંખો જરી રહે છે. દિનરાત અનરાધાર વરસી રહે છે. નાનકડી વાદળીઓ.

આને આપ સેવા કહો છો.....? ગણો છો.....?

મેં તો મારી જીવન કિતાબ ખુલ્લી મૂકી દીધી છે. મારી પાસે તો આ જ છે. બીજું કશું નથી.

આટલું જ મારું તો નિવેદન છે: 'ત્વદ્તતે નાસ્તિ નિર્વચિતઃ.....' સૂર્યના ઉગમ વિના કમળોનાં સમૂહને ચેન નથી પડતું એમ તમારા વિના મને ક્યાંય ચેન નથી પડતું. હું બેચેન - બેચેન રહું છું. ક્યાંય મન ઠરતું નથી. હા, તમારું નામ કોઈ સંભળાવે છે તો આનંદ - આનંદ થઈ જાય છે. ખારા રણમાં મીઠી વીરડી સમાન છે તારું નામ, તારી સ્તવના. તારી સ્તવના રહું છું અને આનંદ આનંદ થઈ ઉઠે છે. પેલી પીડા બધી શમી જાય છે. તૂંહિ તૂંહિ ના રણકારે નવો જ ઝંકાર ઉઠે છે.

તારા વિના બધે સૂનકાર... તું મળે એટલે આનંદ જ આનંદ.....

તારી અવેજીમાં બીજા કશાથી ચાલે તેમ નથી. માની અવેજીમાં બાળકને બીજા શેનાથી ચાલી શકે ?

સંત તુકારામને રાજ્યગુરુની પદવી આપવાનું છત્રપતિ શિવાજીએ નક્કી કર્યું. પોતાના દીવાનને તુકારામને ઘરે મોકલ્યો. દીવાને વિનંતી કરી : આપ રાજસભામાં પધારો. મહારાજ આપને રાજ્યગુરુ બનાવવા ચાહે છે. દીવાનને ના પાડી. ને પછી તુકારામ ઘરે બિરાજેલ પરમાત્માની મૂર્તિ પાસે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે.... 'ભગવાન ! તું જ મારી પરીક્ષા કરવા આવેલ ને ? પણ ના, પ્રભુ ! આ તુકારામ કાચા ગુરુનો ચેલો નથી. મને જોઈએ માત્ર તું. તારી અવેજીમાં બીજું કશું ચાલી ન શકે.

'ત્વદ્તતે નાસ્તિ નિર્વચિતઃ.....' તમારા વિના મને ક્યાંય ચેન પડે નહિ, દેવ ! તમારા ચરણોમાં મને રાખો !

રવીન્દ્રનાથ ટાગોર (અનુ: નગીનદાસ પારેખ) નું ગીત યાદ આવે :

કાણ ભર બેસું હું તવ પાસે,

કામ પડ્યાં છે બાકી જે તે પાછળથી થઈ જશે.....

નીરખ્યા વિણ તારા મુખ સામે,
અંતર મુજ આરામ ન પામે.....
આજે કેવળ સ્થિર બેસીને, તવ નયને નયનો રોપીને,
જીવન-અર્પણનાં ગાવાં છે ગીત અરવ અવકાશો.



किमेष कर्मणां दोषः
 किं भैव दुरात्मनः ।
 किंवाऽस्य हतकालस्य
 किंवा मे नास्ति भव्यता ॥८॥

શું આ કર્મનો દોષ છે દુષ ખોટો,
 અભાગી અરે! હું જ શું છેક ખોટો;
 કળિકાળ કાં કૂરતાથી ડરાવે,
 નથી મારી શું ભવ્યતા ભવ્ય આવે.

આટઆટલો કાળ વીત્યો છતાં આપ મારું કાંઈ
 પણ કરતા નથી. તો શું એમાં આ કુટિલકર્મ
 આડા આવે છે, કે શું દુરાત્મા એવો હું જ
 કાંઈ ખામીવાળો છું, અથવા શું કળિકાળનો કાંઈ
 વાંક છે, કે મારામાં જોઈએ એવી ભવ્યતા જ
 નથી ?

किंवा सद्बक्तिनिर्गाह्य !
 सद्बक्तिस्त्वयि तादशी !
 निश्चलाऽद्यापि सम्पत्रा
 न मे भुवनभूषण ! ॥ ९ ॥

ખરી ભક્તિથી આપ આધીન થાઓ,
 નથી એવી શું ભક્તિ મારી બતાવો;
 અને વિશ્વ શાણગાર અણગાર ! ક્યારે,
 તમારે વિષે એ થશે અચલ મારે.

ભગવાન ભક્તને વશ થાય છે. ભક્તિની શક્તિ
 એવી તો અજબ છે, તે ધાર્યું કરાવી શકે છે. હે
 ભુવનભૂષણ ! મારું ધાર્યું હજુ બર આવતું નથી
 તો શું મારામાં તેવા પ્રકારની અચલ ભક્તિ
 નથી શું ? કારણ બરાબર હોય તો કાર્યમાં
 ખામી આવે જ નહીં, માટે કારણ ક્યારે પ્રબળ
 થશે, તે તો મને કહો.

लीलादलितनिःशेष-
 कर्मजाल ! कृपापर !
 मुक्तिमर्थयते नाथ !
 येनाद्यापि न दीयते ॥ १० ॥

કૃપાળુ ! તમે સહજમાં જાળ તોડી,
 કુકર્માની વંદુ વિભો ! હાથ જોડી;
 મને મુક્તિ ધો પ્રાર્થના નાથ ! મારી,
 ન રહેવું અહિં લ્યો મને ઝટ ઉગારી.

હે કૃપાનિધાન ! આપે રમત-રમતમાં સકલ
 કર્મની જાળ તોડી નાંખી છે. કર્મનાં બંધનોથી
 મને મુક્ત કરવાનું કાર્ય આપને માટે સહેલું
 છે. હું મુક્તિનો અર્થી છું, આપની પાસે મુક્તિ
 માગું છું. એવું શું આહું આવે છે કે હજુ પણ
 મને મુક્તિ આપતા નથી. મને હવે અહીં નથી
 ગમતું, મને ઉગારી લ્યો, મુક્તિમાં આપની પાસે
 લઈ લ્યો.

હું આવ્યો છું તારે દ્વારે યાચક થઈને.

યાચના મારી શી છે, તને ખબર છે. તું અન્તર્યામી છે ને ! ખરેખર તો મારે આટલી લાંબી ચોડી પ્રાર્થના કરવી પડે તે બરોબર છે, પ્રભુ ? તું મારા અન્તસ્તરના ભાવોને પ્રીણીને તારું સાનિધ્ય કેમ ન આપી દે ?

ચાલો, પ્રાર્થના કરીએ.... (ખરેખર તો કૃત્ય રૂપે હવે બીજું રહ્યું જ છે શું?) તને પ્રાર્થીએ, વીનવીએ.... તું ન આપે સાનિધ્ય તોય સમજ્યા. આજે નહિ તો કાલે આપીશ. તારો છૂટકારો ક્યાં છે ?

પણ હું આટલી આશા ન રાખું, પ્રભુ ! કે તું મારી પ્રાર્થનાનો પ્રતિસાદ આપે. ચાલો, તમે મૌન રહેશો ને તો તમારા એ મૌનથીય મારા હદયને હું ભરી લઈશ.

તમે જે આપો તે મારે સ્વીકારવું જ રહ્યું. તમે મૌન રૂપે વરસી રહ્યા છો, દેવ ! તો મારે એ વર્ધાને જીલવી રહી.

પણ મને મૌન રહેવું ફાવશે નહિ, હો ! હા, જગત સાથે મારું મૌનપ્રત જ છે. પણ તમારી સાથે - ભલે એક પક્ષીય - સંવાદ તો ચાલુ જ રહેશે.

● ● ●

તેં ઘણું બધું મને આપ્યું છે. પણ આજે તો તારી સાથે લડવું જ છે: પૂરી તૈયારી કરીને આજે આવ્યો છું.

મારાં કર્માની વિપુલતા, મારી દુરાત્મતા, કાળની વિષમતા, મારી ભવિતવ્યતાની અપાકટતા કે મારી ભક્તિની ઓછાશ : આ પાંચમાંથી ક્યા કારણે તું મને તારું સાત્ત્વિધ નથી આપતો ? લડવા જ બેઠો છું. ને તેથી એક એક કારણની વીગતવાર ચર્ચા કરું. (તને ગમે છે ને, નાથ ! મારું આ બોલવું? તું મૌન રહે તે સહ્ય છે, પણ તું સાંભળે નહિ તો ચાલે નહિ.) .

મારાં કર્મા ઘણાં છે. ને તેથી તું મને મુક્તિ નથી આપતો? ચાલો, હું ઘણાં કર્માથી યુક્ત છું. પણ હું એક પ્રેરણ ન પૂછી શકું કે આખરે મારાં કર્માને દૂર કોણા કરશો ? —સિવાય કે તમે. છેવટે તમારે જો એ દૂર કરવાનાં જ છે તો આજે આ કાર્ય કેમ ન કરો ? ‘કર્મ અમારાં આજે રે જગપતિ ! વારવા, વળી કોણ બીજો આવશે એ?’ (ઝષ્ણ જિન વિનતિ: વિનય વિ. મ.)

મહો. યશોવિજયજીએ સરસ વાત કરી છે : ‘મત કહેશો તુજ કર્મ નથી...’ મારા કર્મમાં / ભાગ્યમાં કંઈ નથી એમ ન કહેતા, દેવ ! ‘કર્મ છે તો તું પામ્યો રે !’ મારું ભાગ્ય સશક્ત ન હોત તો હું તમને શી રીતે પામત ?

રવીન્દ્રનાથ ટાગોર યાદ આવે :

પ્રબળ બનીને કર્મ જ્યારે,

મુજથી જગ ઢાંકી હુંકારે,

ત્યારે નીરવ નાથ ! હદયને પ્રાંતે શાન્ત ચરણથી આવો !

● ● ●

‘કિં મમૈવ દુરાત્મનઃ ?’

હું દુરાત્મનું છું માટે તમે મને ઈચ્છિત નથી આપતા ? દુરાત્મનું એ અર્થમાં કે તમારા વિસ્મરણમાંય હું જીવી શકું છું. સમજું છું કે, આ મારો જબરદસ્ત અપરાધ છે. સૂરદાસના શબ્દો યાદ આવે :

‘મોં સમ કૌન કુટિલ ખલ કામી ? જિન તનું દિયો સો હી બિસરાયો, એસો નિમક હરામી....’

નાનો સૂનો અપરાધ નથી આ.....

હદ્ય ભરાઈ આવે છે. છાતી ફાટી જાય છે. તમારાં વિસ્મરણમાં મારું અસ્તિત્વ કેમ સંભવી શકે ? શો અર્થ એનો ? કૃપા કરો. તમારું સતત સંસ્મરણ બની રહે એવું કંઈક કરો.

● ● ●

‘કિંવાડસ્ય હતકાલસ્ય..... કિં વા મે નાસ્તિ ભવ્યતા....’ ?

અથવા તો, કાળનો દોષ છે, કે આપ મને તારવામાં હજુ વિલંબ કરો છો ? મહોપાધ્યાયજીએ કહું છે :

‘કાળલબ્ધિ મુજ મત ગણો, ભાવલબ્ધિ તુમ હાથે રે....’

કાળલબ્ધિ / કાળશક્તિ આપની શક્તિ / ભાવલબ્ધિ આગળ શું વિસતમાં ?

‘કાળ-સ્વભાવ-ભવિતવ્યતા એ સઘણાં તુજ દાસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજનો સબળ વિદ્યાસો રે....’ નથી મને કાળની ચિંતા, નથી ભવિતવ્યતા (કિં વા મે નાસ્તિ ભવ્યતા?) ની ચિંતા. તમે છો પછી શેની ચિંતા ?

હું તો એટલા માટે પૂછી રહ્યો છું કે, તમે આંગળી ચીંધીને મારો દોષ બતાવશો તો મને આનંદ થશે.

કોઈ પણ રીતે આપની સાથે વાતચીત કરવા મળતી હોય તો હું તક જરૂરી લેવા તૈયાર હોઉં છું. અને તેથી જ આ લાંબી પ્રશ્નોની હારમાણ લઈ હું આપની સમક્ષ હાજર થયો છું.

‘કિં વા સદ્ગતિનિર્ગાહ્ય !.....’ આપના પર મારી સુદૃઢ ભક્તિ જામી નથી એ કારણે આપ મને મોક્ષ આપવામાં વિલંબ કરો છો ?

‘નિશ્ચલતા....’ ખરેખર અચળ ભક્તિ તારા પરની મારી પાસે નથી. પણ શું માત્ર હું એક જ એ માટે અપરાધી છું ? તે મને નિશ્ચળ ભક્તિ કેમ ન આપી ? કેવી ભક્તિ મને ખપે તે કહું ?

સુરેશ દલાલની કવિતા યાદ આવે :

‘મનના મેવાડમાં એક રાણો વસે છે,
એ રાણાને અહીંથી ઉથાપો કોઈ,
મને મીરાંનું પાગલપન આપો કોઈ.....’

કેવું પાગલપન ? ‘ભક્તિની પ્રત્યેક ક્ષણને જીવતાં આવડવું જોઈએ. મિલન અને વિરહ તો પ્રેમના આકાશમાં સૂર્ય અને ચન્દ્ર જેવાં છે. મહત્વ આકાશનું છે. લગનનો અભિન એવો છે કે જે બાળે છે પણ દાઝતો નથી. એટલે આ અભિન નહિ પણ પાવક કહેવાય છે.’
(‘ગાંગ પ્રયાગ.’)

મારે જોઈએ એ પાવક.... હકીકતમાં મારે શું શું જોઈએ એની સૂચિ જ અહીં છે. તું કેટલું આપીશ એ કહીશ ?

જરા સુધારો કરું : સૂચિ લાંબી નથી. હકીકતમાં એને સૂચિ કહી શકાય પણ નહિ. મારે તો જોઈએ એક જ ચીજ : ભક્તિ. ના, મુક્તિ પણ નહિ. ‘મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહસું સબળ પ્રતિબંધ લાગ્યો; ચમક પાણાણ જિમ લોહને ખીંચશો, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો (મહો. પશોવિજયજ).

સંત રાખિયાના શબ્દો યાદ આવે :

‘હું જો તારી પ્રામિ માટે જ
તારી ભક્તિ કરતી હોઉં તો,
તું મને તારા અપાર સુન્દર સ્વરૂપથી
વંચિત ન રાખીશ.....’

ભક્તિ તારા પ્રતિની છે એટલે જ આસ્થા જન્મે છે કે એમાં પ્રાણ
તું પ્રગટાવીશ. નહિતર લલ્યેશ્વરી કહે છે તેમ મારી ભક્તિ કાચા તાંત્રણાથી
વધુ બળ ક્યાં ધરાવે છે ? ‘સમુદ્રમાં કાચા તાંત્રણ વડે નાવ ખેંચી રહી
છું. મારા પરમ પ્રિયતમ પ્રભુ સાંભળશે તો મને પાર ઉતારશે.’
(લલ્યેશ્વરી : ‘પરમ સમીપે’, ૧૮)

હું પ્રશ્ન કરીશ : તું મને ક્યારે પાર ઉતારીશ ? ક્યારે..... ?

તું કેવો તો સમર્થ ! ‘લીલાદલિત....’ કર્મસમૂહને લીલામાત્રમાં તમે
દૂર કરી શકો છો... આટલી તમારી શક્તિ ને છતાં હું ટળવળું કાં ?
મારો આ તરફરાટ..... મારી આ વેદના.... મને તમારું સાહચર્ય આપો!

* * *

स्फुटं च जगदालभ् !
 नाथेदं ते निवेद्यते ।
 नास्तीह शरणं लोके
 भगवन्तं विमुच्य मे ॥ ११ ॥

प्रभो! स्पष्ट विश्वावलंबन! तमोने,
 निवेदन करुं सांभणोने अमोने ;
 तमारा विना नाथ! नहीं अन्य मारे,
 जगत् शरण ! छे शरण अहीं कोई क्यारे?

હે જગજજીવને આલંબન સ્વરૂપ, સ્વામી !
 આપને એક વાત મારે કહેવી છે. આપ એ
 વાત ધ્યાન પૂર્વક સાંભળજો, એના પ્રત્યે દુર્લક્ષ્ય
 કરતા નહીં. વાત તો એ છે કે વિશ્વમાં મારે
 આપના સિવાય બીજું કોઈ શરણ નથી. મારે
 જે કાંઈ છો તે આપ જ છો. હવે આપને જે
 કરવું હોય તે કરો.

त्वं भाता त्वं पिता बन्धु-
स्त्वं स्वामी त्वं च मे गुरुः।
त्वभेद जगदानन्द!
जीवितं जीवितेश्वर ॥ १२ ॥

तमे मात ने तात बन्धु उदारा,
वणी स्वामी छो, छो गुरुराज न्यारा;
जगद् उर्धदायी प्रभो! प्राण घारा,
अहो! ज्ञवज्ञवन ज्ञवितेश मारा.

अहो जगदानन्द, नाथ! आप मारे माता छो,
मारा पिता आप छो, मारा भ्राता आप छो,
मारा स्वामी आप छो, मारा गुरु आप छो,
आप ज मारा ज्ञवन छो, ने ज्ञवनना मालिक
पाण आप ज छो.

આપને હું નાનકનું નિવેદન કરવા ચાહું છું : આપના સિવાય કોઈનો
મને આધાર નથી.

જગતના શરણ્યરૂપ આપ છો જ. પણ હું એ કહેવા માંગું છું કે
આપ મારા શરણ્ય બનો !

ઘણા બધાને આપે ઉજ્ઝર્યા છે એ તો હું જાણું છું, પણ મને કાં નથી
તારતા? હું આપને જ શરણો છું, બીજા કોઈનું મને શરણ મળે તેમ નથી.

અને મેળવવા હું જાઉં પણ કેમ ? ‘ધીંગ ધણી માથે કીયો રે !’
તમારા જેવો સ્વામી મને મળ્યો હોય તો પછી હું બીજા પાસે જાઉં કેમ?

હા, રીસમાં આવીશ ત્યારે જરૂર કહીશ કે, આટ-આટલી વિનંતી
કરવા છતાં જો તમને મારી જરાય પડી ન હોય તો હું તો આ ચાલ્યો !
બચકું ઉપાડીને.....‘તું નહીં તો ઓર સહી.....’ પણ તકલીફ ત્યાં જ છે
ને કે તને તો હું છોડી શકું તેમ જ નથી.

મારી આ ચુભ, દુવિધા આપ ગ્રીછો છો ને ? આપને જોયા ત્યારથી
'તૂંહિ તૂંહિ'ની એવી રઢ લાગી છે કે બીજે ક્યાંય દિલ ઠરે તેમ નથી.

બીજે ક્યાંય હૈયું ઠરે નહિ, ને તમે દર્શન આપો નહિ; કહો તો
ખરા, મારું શું થાય ?

મારી પાસે ઈલાજ છે. જો કે એ તમે જ આપ્યો છે ને ! વિરહવ્યથાને વિરહસક્તિમાં મેં ફેરવી છે. નારદઋષિ તો ‘પરમ વિરહસક્તિ’ કહે છે. પરમવિરહશક્તિ શબ્દ પરની એક સશક્ત વ્યાખ્યા વાંચેલી.... વ્યાખ્યાકારે પૂછ્યું : પરમવિરહસક્તિ શબ્દને કઈ રીતે છોડીશું ? દેખીતી રીતે, પરમના / એ ઘારાના વિરહમાં પણ આસક્ત હોવું એવો અર્થ કો’ક કાઢે પણ આ વ્યાખ્યાકારે સામું પૂછ્યું : અચ્છા, તો શું બીજાના વિરહમાં તમે હોઈ શકો ખરા ? ન વિરહવ્યથા પરની હોય, ન વિરહસક્તિ પરની હોય. તો, પરમની વિરહસક્તિ આવો અર્થ નહિ કાઢી શકાય. અર્થ થશે : પરમ / સર્વોચ્ચ વિરહા-સક્તિ.....

આ અર્થ એ વ્યાખ્યાકારે મને આપ્યો કે તમે આપ્યો ? વ્યાખ્યાકારને આ અર્થ તમારી કૃપાથી જ સૂજ્યો એ અર્થમાં નહિ પણ તમે જ એ પુસ્તક મને વાંચવા આપેલું ને..... !

આ અનુભવમાંથી ઘણી વાર પસાર થયો છું. મારી સાધનાયાત્રાના સંદર્ભમાં તે મને ગ્રંથો આપ્યા જ કર્યા છે. ખ્યાલ પણ ન હોય કે હવે કઈ રીતે સાધનાને આગળ લઈ જવી ? ત્યાં કોઈ મહાપુરુષનો ભેટો તું કરાવી દે. કોઈ ગ્રંથ વાંચવાનું સૂચન એમના દ્વારા મળે. એ ગ્રંથ વાંચ્યો. સાધનાયાત્રા આગળ વધે. ને ત્યારે કદમ કદમ પર તારા પર ઓવાર્યા કરું.

અને એટલે જ બિલકુલ નિશ્ચિન્ત થઈને બેઠો છું. જે ક્ષણે જેની જરૂર પડવાની છે, તે તું આપ્યા જ કરવાનો છે.

મમ્મી સાથે પ્રવાસમાં ગયેલ બાળકને શેની તૈયારી કરવાની હોય ? મમ્મીને ખ્યાલ છે કે બાળક સાથે છે ને એ ક્યારે ભૂઘ્યું થાય ને ક્યારે ખાવાનું માગે. ભાતાનો ડબ્બો, પાણીનો કુંજો બધું તૈયાર.... બપોરે ત્રણ વાગ્યે દીકરો ચાલતી ટ્રેઇને કહેશે : મમ્મી, ભૂખ લાગી છે... મમ્મી તરત થેપલાં ને સુખડી કાઢી આપશે. ‘મમ્મી, પાણી...’ ! હાજર....

તારી આ કૃપાના બોજમાંથી હું શી રીતે ઉર્જણ થઈ શકું, પ્રભુ ?

મને તો આ જ રસ્તો સૂજે છે (તે જ સૂજાદેલો એમ કહું ને ?) કે
તારી પ્રાર્થના કર્યા કરું.

અને પ્રાર્થનામાં પછી વૈવિધ્ય લાવવા માટે રું, લડું, જઘું.... તો
જ તમને હું ગમું ને ? ('પણ બાળક જો બોલી ન જાણો, તો કિમ
વહાલો લાગો? : રામ વિજય મહારાજ.)

● ● ●

તમને સ્પષ્ટ કહી દઉં કે તમારા વિના મારે કોઈ આધાર છે નહિ.
ન કોઈની પાસે હું જવાનો પણ છું. હા, તું કહે તોય નહિ હો ! એટલી
બાબતમાં તારી આજા નહિ માનું.

અર્થા, તમને એમ લાગશે કે આ છોકરો તો ભારે જિદ્દી, ભાઈ !
પણ ચાલો, મોટા ભક્તોએ પણ આ લયમાં તમારી જોડે વાતો નથી કરી
? (જઘડા માટેનો એક સરસ પોઈન્ટ આ નોંધી લઉં કે મોટા
ભક્તિયોગાચાર્યો જે વાત કહે તે તમને ગમે. ને એ જ વાત હું કહું
એટલે તમને ન ગમે. ચાલો, અત્યારે નહિ, ભવિષ્યમાં આ મુદ્દા પર
મોટી લડાઈ તમારી જોડે કરી નાખીશ ! હા, હું તમારો છું ને ! ના,
તમારો જ છું....) પૂ. જ્ઞાનવિમલસૂરિ મહારાજ કહે છે: 'જો તુમ ધ્યાન
વિના શિવ લઈએ, એહી જ દાવ બતાવો....!' પૂ. આનંદ વર્ધન મહારાજ
કહે છે : 'તુમ સરીખો કોઈ દાખવો, તો કીજે તેહની સેવ હો !'

● ● ●

'ત્વं માતા ત્વं પિતા બન્ધુ:.....'

વાત્સલ્ય ઝરાવનાર માતા તમે છો. પૂરા જીવનને છત્ર પૂરું પાડનાર
પિતા પણ આપ છો. સ્નેહથી નવડાવી દેનાર બન્ધુ પણ તમે છો.

મારા પૂરા જીવનના માલિક પણ તમે છો. મને પ્રકાશમાર્ગ દોરી જનાર ગુરુ પણ તમે છો. 'ત્વમેવ જીવિતમ्....' મારું જીવન પણ તમે જ છો. જીવન પણ તમે, જીવનના માલિક પણ તમે. દ્વૈત અને અદ્વૈતની અહીં મજાની ગુંથણી છે.

જીવિતેશ્વર એટલે પ્રાણેશ્વર. જીવનના સ્વામી. અહીં દ્વૈતભાવ છે. એક બાજુ જીવન છે. બીજુ બાજુ તેના સ્વામી રૂપે પરમાત્મા છે.

'ત્વમેવ....જીવિતમ्....' કહેતી વખતે ભક્તનો પગ અદ્વૈતમાં ઉપડ્યો છે. તમે મારા જીવનના સ્વામી એમ નહિ, તમે જ જીવન.....

* * *

त्वयाऽवधीरितो नाथ !
भीनवज्जलवर्जिते ।
निराशो दैन्यमालम्ब्य,
प्रियेहं जगतीतले ॥ १३ ॥

तमे જો તિરસ્કાર મારો કરો તો,
વિના નીરમાં ભીન શો જન્મ ખોતો;
બધી આશ મારી મરી જાય સ્વામી,
અતિ દીન છું ભૂતલે હું અનામી.

હે મારા માલિક ! જો તમે જ મારો તિરસ્કાર
કરો તો બીજો તો કોણ મારો બચાવ કરે ?
આ પૃથ્વી પર મારું કોઈ નથી. પાણીથી વિછોયું
માછલું જેમ તરફડીને મરી જાય તેમ હું પણ
હતાશ થઈને દીનતાને ધારણ કરીને આપ
વગર મરણ પામું. મારે તો આપ જ જે છો તે
છો.

જો તમે મારી ઉપેક્ષા કરશો તો હું ક્યાંયનો નહિ રહું, દેવ !

બધાની ઉપેક્ષા હું સહી શકીશા, સંસાર આખાની; જો તમારું પીઠબળ
મને હશે. આપના વાતસલ્યની હુંક પર બીજા બધા વિના ચલાવી શકીશા.

પણ, જો આપ મને તરછોડશો તો.....? શી મારી દશા થશે ?

મને નહિ તરછોડો ને.....?

કોલ આપો !

દેવ ! જો તમે તરછોડશો તો હું એકદમ હતાશ થઈ જઈશ.

મારી દીનતાનો કોઈ આરો ઓવારો નહિ રહે.

‘મૈં જગવાસી, સહી દુઃખરાશિ, સો તો તુમસે ન છાને.....’ મેં જે
દુઃખો સહ્યા છે તમારા વિના, તે આપનાથી અજાણ્યા છે ? મારો તરફડાટ,
મારી વ્યાકુળતા, મારી આ વિરહાતુરતા.....

આંખો રડી રડીને થાકી ગઈ છે. લાલચોળ થઈ ગઈ છે. સૂજી
ગઈ છે. છતાં હજુ આશા છે : તમારું દર્શન મળશે....

અને એ આશાને સહારે તો જીવી રહ્યો છું.

પણ તમે એ આશાની પૂર્તિ કરવાને બદલે મારી ઉપેક્ષા કાં કરો ?
ઘણીવાર તો એટલી હતાશા ભેખરાઈ જાય છે... થાય છે કે હું આ

કોને કહી રહ્યો છું ? જે મારી વાત સાંભળવા તૈયાર ન હોય તેમની આગળ જઈ આ વેદના શા માટે અભિવ્યક્ત કરવી ?

શા માટે ?

અમૃતવિજયમહારાજના શબ્દોમાં : ‘ઈન કારન ક્યા તુમસેં કહેવો?’ તમને શું કહેવું ? અને કદાચ કહું છું તો— ‘કહીએ તો ન સુને કાને....’ તમે મારી વાત સાંભળવાય તૈયાર નથી.

● ● ●

કથનમાં થોડીક ઉગ્રતા આવી ગઈ, નહિ ? પણ એય જરૂરી હતી. મન એટલું ભરાઈ આવ્યું હતું કે આવું કશુંક ન બોલ્યો હોત તો સ્વસ્થ ન બની શક્યો હોત.

મારી અસ્વસ્થતાનું કારણ છે મારી શરણાગતિની ભૂમિકા. મને એમ લાગ્યા કરે છે કે, તમારો શરણાગત બનવાની પાત્રતા મારામાં આવી છે. હું કંઈક અંશે આપનો ભક્ત બન્યો છું.

આટલો બધો ફાસલો કાપીને, શાનવિમલસૂરિમહારાજ કહે છે તેમ,- ‘આશ કરીને ઉમાંહ્ય ધરીને અળગેથી અમો આવ્યા....’ અને તોય તમે દિલભર દિલથી સામું ન જુઓ’ તો થોડો ઉશ્કેરાટ ન પેદા થાય ?

સેંકડો માઈલની ખેપ કરીને પ્રિયજન પાસે ગયેલ વ્યક્તિને પ્રિયજન જો હસીને બોલાવે તો એનો બધો થાક દૂર થઈ જાય. પણ જો પ્રિયજન સામુંય ન જુએ તો....? કેટલું તો દુઃખ લાગે તેને તે વખતે? ‘આશ કરીને, ઉમાંહ્ય ધરીને... અળગેથી અમો આવ્યા....’

‘આશ કરીને....’ કેટલી આશાઓ હતી. સેંકડો કિલોમીટરની ખેપ કરીને, કષ્ટો વેઠીને ભદ્રેશ્વર કે સુંથરી જઈશ અને ભગવાનનાં દર્શન કરીશ. એવો તો પ્રતિભાવ મળશે કે મારો બધો શ્રમ હવામાં ઊરી જશે. તારું દર્શનસુખ બધી પીડાને હરી લેશે.

પણ એ દર્શનસુખ ન મળે તો.....?

‘ઉમાંખ ધરીને.....’ આશ હતી, ઉમંગો હતા. ઉમંગો હતા માટે તો નાચતો ફૂદતો આવ્યો’તો.

‘અગેથી અમો આવ્યા.’ દૂર દૂરથી હું આવ્યો છું. તારી પાસે આવવું કંઈ સરળ તો નથી. ‘તારી પાસે આવવું રે લાલ, પહેલાં ન આવતું દાયરે..’ વીતરાગના રાગની ભૂમિકાએ આવવું સરળ નહોતું. છતાંય હું આવી ગયો....

અને તમે ભક્ત પર રાગ/વાત્સલ્ય/સ્નેહ ન ધરો તો કેમ ચાલે ?

મારી ભક્તિની સામે તમારો સ્નેહ વરસવો જ જોઈએ.

* * *

स्वसंवेदनसिद्धं मे,
 निश्चलं त्वयि मानसम् ।
 साक्षादभूतान्यभावस्य,
 यद्वा किं ते निवेद्यताम् ॥ १४ ॥

मने सिद्ध छे स्वानुभवथी खरे आ,
 प्रभो! तुं विषे चित निश्चल रहे आ;
 बीजा सर्व संबंध जोया तपासी,
 वधु शुं कहुं हुं रह्यो छुं उदासी.

हे जिनवर! हुं आ मारा अनुभवथी कहुं छुं,
 जगतना बधा संबंधोनी-बीजा बधा भावोनी में
 परीक्षा करी लीधी छे. ऐमां कांઈ कहेवापछुं नथी.
 ऐके कामना नथी. हवे तो आपनामां मारं मन
 निश्चल में कर्युं छे. आप ऐक ज स्वार्थ वगरना
 छो ए मने स्पष्ट समजाई गयुं छे.

મારું મન તારા પર નિશ્ચળ/સુદૃઢ થયું છે એવું મને લાગે છે.

ભાવોનો આ ઉછાળો... તમને જોતાંવેંત વહેતી આંસૂની આ સરવાણી... આ પ્રસંગતા... ભક્તિ વિના, આન્તરિક ભક્તિ વિના આ બધું કેમ બની શકે ?

ચન્દ્રને જોતાં સાગર ઊંચો થઈ થઈને ઉછળે તેમ હું તમને જોતાં નાચી ઉહું છું. હર્ષાવેશમાં મારું હદ્ય ધબકવાનું ચૂકી જાય છે. આ ભાવાવેશ મને પ્રતીતિ કરાવે છે કે તમારા પરની ભક્તિ મારામાં છે.

આપ અન્તર્યામી છો. મારા મનના ભાવોને જુઓ છો. એટલે આ નિવેદન કરવાની આવશ્યકતા ન હોવા છતાં હું એટલા માટે આ વાત કરું છું કે આ વાત કરતાં મને ગાઢ આનંદ ઉપજે છે.

ભાવાવેશ પ્રગટાવવાનું એક પ્રબળ માધ્યમ મારા માટે આ છે : તારી સાથેની વાતો. સ્તવના ગાઉં છું, રામવિજય મહારાજ કે મોહનવિજય મહારાજ જેવા ભક્ત કવિઓના સશક્ત શબ્દો બોલું છું; થોડો પ્રારંભ કરું છું અને ત્યાં તો એવો ભાવાવેશ છલકાય છે કે સ્તવના ક્યારે સમામ થઈ જાય છે અને અશ્વધારા ક્યારે શરૂ થઈ જાય છે એનો મને ઘ્યાલજ નથી રહેતો.

કેટલો તો આનંદ આવે છે આ ભાવાવેશની ક્ષણોમાં ! હું તારામય બની ગયો હોઉં છું ને એ ક્ષણોમાં !

'કિં તે નિવેદ્યતામ् ?' તમને શું કહેવું બીજું ? તમે મારા ભાવોને જાણો છો. જાણો છો એટલું જ કેમ કહું ? તમે જ મારા ભાવના ઉત્પાદક છો.

તમે જ..... તમે જ... પણ, આ 'હું' ને 'મારું' વચ્ચે ક્યાંથી ટપકી પડે છે? જરૂર, તમારી જોતે વાતો કરવા માટે મારું અલગ વ્યક્તિત્વ હોવું જરૂરી છે. ને રડવા માટે તમારાથી કૃત્રિમ દૂરી પણ મારે ઊભી કરવી પડે છે... તમે ઠેઠ સિદ્ધશિલા પર ને હું અહીં..... તમારા વિનાનો એકલો-અટૂલો હું શી રીતે રહું ?

એવું એક વરદાન આપો ને, દેવ ! કે રડવા માટે કે લડવા માટે કે વાતો કરવા માટે તમારાથી ભિન્ન મારું વ્યક્તિત્વ ઉપસાવું. બાકી સતત લાગ્યા કરે કે તમારામય જ હું છું. તમારા સમુદ્રની એક માત્ર લહેર !

મને ખબર છે, તમે દીક્ષા આપતી વખતે આ જ કરો છો. ગુરુદેવ પાસે ઓઘો અપાવી તમે મારા વ્યક્તિત્વને જાડી જ નાખતા હો છો, પણ હું ભિખારીના ચખણિયાની જેમ મારા વ્યક્તિત્વને વળગી રહેતો હોઉં છું.... ત્યારે કઠોર બનીને તમે આવો, કરુણાધન ! ને મને મારાથી વિખૂટો પાડી નાખો... મારા વિનાનો હું તમારો હોઈશ. તમારા વિનાના મારા વ્યક્તિત્વનો કોઈ અર્થ નથી.

'કિં તે નિવેદ્યતામ्.....' ને સામે છેતે અત્યારે બેઠો છું.... તારા સિવાય બીજા કોને મનની વાત કહી શકાય ? એટલી બધી વાતો ઊભરાય છે... પણ, મારા નાથ ! તું એને સાંભળો તો છે ને ?

* * *

મચ્ચિત્તં પદ્મવત્રાથ !
દૃષ્ટે ભુવનભાસકરે ।
ત્વયીહ વિકસત્યેવ,
વિદલત્કર્મકોશકમ् ॥ ૧૫ ॥

પ્રભો ! વિશ્વભાનુ તમે જો પ્રકાશો,
વિલોકી તમોને પૂરી થાય આશો;
કુકર્મા તણાં કોશ સહુ સધ તૂટે,
ખીલે પદ્મ શું ચિત્ત સંકલેશ છૂટે.

હુ અહીંત ! ભુવનભાસકર ! આપં અભિલ
બ્રહ્માંડને પ્રકાશિત કરો છો, આપને જોવાની સાથે
મારા કર્મ- કોશ ફૂટી જાય છે, બંધન તૂટી જાય
છે ને ચિત્તરૂપી કમળ ખીલી ઉઠે છે.

સૂર્યને જોઈને કમળ ખીલવા માંડે છે. કોશમાં બીડાયેલ/ બંધ
થયેલ એ નાજુક પુષ્પ વિકસિત થાય છે. તેમ તમને જોતાંજ કર્મોના
કોચલામાં કેદ થયેલ / મૂરજાયેલ મારું વ્યક્તિત્વ બહાર આવે છે.

હું પ્રસત્ર, પ્રસત્ર થઈ જાઉ છું તમને જોતાં!

તમે સૂર્ય. હું કમળ.

તમારું દર્શન થાય અને હું વિકસું / જૂમું. તમારું દર્શન ન મળે
ત્યારે મૂરજાઈ જાઉં.

તમે જ મારા જીવનના આધાર. પણ, સૂર્ય તો આખો દિવસ
કુમલિનીને દર્શન સુખ આપે છે. દિવસ-રાતના આ ચકમાં, કમ સે કમ,
પચાસ ટકા સમય તો એ દર્શન દે છે.

ને તમે.....

કેટલાં કાલાવાલાં કરીએ, ખોળાં પાથરીએ, આજીજ કરીએ. ત્યારે
પાંચ મિનીટ દર્શન આપો.....

દર્શન-અદર્શનની, તડકાં-છાયાની/ધૂપ-છાંવની આ રમત શા માટે?

શા માટે મને તલસાવો છો? તડપાવો છો ?

કદાચ તલસાટ અને તડપન, વિરહકુળતા જ એ દ્વાર છે, જેના દ્વારા તમે આવી શકો.

અને જ્યારે એ દ્વાર ખૂલ્લું થયું છે; તમે આવ્યા જ છો.

આ આગમન બદલ તમારો હું ઓસિંગણ છું. ખૂબ ખૂબ આભારી છું.

ભલે, પાંચ મિનીટ, દશ મિનીટ.....

ભાવાવેશમાં આટલીય ક્ષણો વહી ગઈ હોય છે. ત્યારે દિવસ આખો કેવો મજાનો હોય છે. હળવો ફૂલ હું હોઉં છું.

અદર્શનને કારણે આવેલી વિરુદ્ધતા, અશ્રુધારા.....ને એ આંસૂને આસોપાલવે તમારું આગમન.

મોંઘેરા મહેમાન આવવાના હોય ત્યારે આસોપાલવ તો બાંધવા જ પડે ને !

કેવી છે આ અશ્રુધારા ? કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં :

‘જગત ભરી દઈને લખ ધારે,

‘તું છે, તું છે -’ પૂર વહી જાયે,

‘ક્યાં તું ક્યાં ?’ ના રુદન તણા આંસુ કેરા ઝરણામાં.....’

(ગીતાંજલી અને બીજાં કાવ્યો : ન.પા.૧૦)

* * *

अनन्तजन्मुसन्नान -
 व्यापाराक्षणिकस्य ते
 भयोपरि जगन्नाथ !
 न जाने कीदृशी दया ॥ १६ ॥

अनन्ता छवोनां समूहोनी वातो,
 बधी आप जाणो कथं हुं भूलातो;
 करो सर्वनी शुद्ध रक्षा स्वभावे,
 दया केम मारे विषे नाथ! नावे.

હે જગદીશર! જગતના અનંતા છવો શું કરે
 છે તે આપ સ્પષ્ટપણે સર્વ જાણો છો, તેમાં
 મારી પડા શું સ્થિતિ છે તે કંઈ આપથી
 અજાણ્યું નથી. મને એ નથી સમજાતું કે આપની
 મારા પર કેવી દયા છે ! આપની કૃપા મારા
 પર બરાબર ઉતરે તો હું કેવો બનું એ આપ
 જ કહો.

દેવ ! હું નથી જાણતો કે, તારું મારા પર કેટલું વાત્સલ્ય છે.

મારા હૃદયમાં તારા પ્રત્યે જે ભક્તિ ઊછળી રહી છે, તેને હું અનુભવી શકું છું અને તું જોઈ શકે છે.

પણ, તમને મારા પ્રત્યે કેટલી દયા છે, તે હું નથી જાણતો.

દયાસાગર! તારે તો મારા પર વરસી રહેવું જોઈએ, અનરાધાર, નવલખધાર..... તારી પ્રચંડ ધારાઓમાં મને નવડાવી નાખવો જોઈએ તારે..... છતાં તું એટલું ન કરે તોય, મારી ભક્તિ જેટલી છે તેટલું વાત્સલ્ય તો તું મને આપ.

મારી ભક્તિ,

તારો સ્નેહ.

તારા સ્નેહથી મારી ભક્તિ ચાર્જડ/આવેશિત બનશે.

પ્રભુ ! એવી કોઈ નિશાની તું મને આપ, જેથી તારા સ્નેહની પ્રતીતિ થાય.

ભાષાવિજય મહારાજ કહે છે :

‘પ્રીત પ્રતીત જિમ ઉપજે રે, તિમ અવિહડ પ્રીત કરોને !’

‘મને પ્રતીતિ થાય એ રીતે અવિહડ/ગાઢ સ્નેહની ધારા તમે મારા પર વરસાવો.’ ભાષા વિજય મહારાજે એક કરીમાં તો કેટલું બધું માણી લીધું !

અંધ વણિક પર દેવ રીજ્યા. અને એક વરદાન માંગવા કહ્યું. વણિક ચતુર હતો. એણે વિચાર્યુ કે, શું માંગવું? પહેલું તો આ આંધળા-પણુ જવું જોઈએ. પણ દેખતાં થયા પછીય ધન ન હોય તો કરવાનું શું? અને ધન કદાચ મળી જાય પણ આયુષ્ય ન હોય તો.....?

એણે કહ્યું, દેવ! હું મારા પોતરાની વહુને સાતમા માળની અટારીએથી સોનાની માટલીમાં વલોણું કરતી જોઉં ! બસ, આટલું વરદાન મને આપો.

આયુષ્ય માગી લીધું. સમૃદ્ધ માગી લીધી. આંખો માગી લીધી. પરિવાર માગી લીધો.

‘પ્રીત પ્રતીત જિમ ઉપજેરે, તિમ અવિહડ પ્રીત કરો ને!’ મને તમારી સ્નેહ ધારાનો અનુભવ કરાવો! મને ભીજવી નાખો એ ધારામાં.

ભક્તો વર્ણાન જ્યારે કરે છે તમારી સ્નેહધારાનું, એવી તો અસૂયા જન્મે છે એ વખતે.....મને એ સ્નેહધારાની અનુભૂતિ કરાવો.

આપ તો સર્વજ્ઞ છો. અનંતા પ્રાણીઓના વિચારોને આપ એક ક્ષણમાં નીહાળી શકો છો. તો શું આપ મારી આ ભાવધારાને અત્યારે નથી જોઈ રહ્યા ?

અને જોઈ રહ્યા છો, તો પછી હવે વિલંબ શા માટે? ‘મોડા વહેલા તુમહિ જ તારક.....હવે વિલંબ શા કારણો એ ?’

समुन्ते जगनाथ !
त्वयि सद्गर्भनीरदे ।
नृत्यत्येष मयुराभो,
मद्दोर्दण्डशिखण्डकः ॥ १७ ॥

प्रभो! आप छो पुष्करार्वत घारा,
उंचे गरजता वरसता धर्मधारा;
करी बाहु बने उंचा हुं कलापी,
बनी भोर नाची रहुं कर्म कापी.

हे नाथ ! सत्यधर्म रूप जगने वरसावनार आप
मेघ छो, आप उंचे रहीने गर्जारव करो छो, ते
सांभणीने मयूर जेवो हुं बने बाहु उंचा करीने
कलापने धारण करतो नाची उहुं छुं.

तदस्य किमियं भक्तिः
किमुभादोयभीदृशः ।
दीयतां वचनं नाथ !
कृपया मे निवेद्यताम् ॥ १८ ॥

શું આ ભક્તિ કે છેક ઉન્માદ છે આ,
બતાવો તમે સ્પષ્ટ દેવાધિદેવા;
દ્યા લાવીને વચન ધો નાથ એવું,
કહો હોય જેવું મને સત્ય તેવું.

મારું આ વર્તન એ ભક્તિ છે, કે ઉન્માદ છે,
એ આપ મારી ઉપર દ્યા કરીને બતાવો. મને
કાંઈક કહો, વચન ધો, ઉત્તર આપો. હે નાથ!
આપ વચન આપો-તો મને શાંતિ મળો.

મારા ભાવાવેશની થોડી વાતો કરું એ આપને ગમશે ? હું આ વાત એટલા માટે કરું છું કે મારે આપનો આ વિષયમાં, અંગત અભિપ્રાય જોઈએ છે.

દર્દી ડોક્ટરને કહેતો હોય છે ઘણીવાર : ખાવાનું ભાવેય છે, ખાઠ પણ લઉં છું. પરંતુ.....એટલે, આ ભૂખ ખરેખરી છે કે ખોટી-ખોટી ?

'સમુન્નતે જગત્તાથ!....'

તમને જોઉં છું દેવ ! અને મારો માંહલો હરખાઈ ઉઠે છે. મેધને જોઈ મોરલો નાચી ઉઠે તેમ આપને જોતાં ઉછળી પડું છું. ભાવાવેશની આ કષણોમાં, આપની સાથેના વાર્તાલાપના આ સમયમાં મારો હાથ કેવી કેવી ભંગિમાઓ રચે છે ! ભીતર ઉછળી રહેલા ભાવ-સમંદરના મોટાં મોજાંઓની કિનારે આવેલી એક નાની સરખી લહેર સમો આ હાથનો લય કેટલા સમાચાર આપી જાય છે !

તમને જોતાં વહેતાં આ આંસૂ, તમને જોતાં થતો આ રોમાંચ.....શું ખરેખર આ ભક્તિ છે કે પછી છલના/ભ્રમણા ?

'કૃપયા મે નિવેદ્યતામ्'. કૃપા કરીને મને કહો.

જો ખરેખર આ મારી ભક્તિ છે તો તમે કેમ મારા પર રીજતા નથી? અને જો આ ભક્તિ ન હોય તો ભક્તિ શું છે એ બતાવતા કેમ નથી ?

‘કૃપયા મે નિવેદ્યતામ्.’

મને બતાવો, મને કહો.

‘તન મન ચિત્ત વળગ્યું તુમસું, હવે અંતર કિમ રાખો અમશું?’
ભાણવિજ્ય મહારાજ સરસ પ્રશ્ન પૂછે છે. તન તમને સમર્થું. મન
તમને સાંઘ્યું. ચિત્ત તમને આપ્યું.....છતાં તમે મારાથી અંતર/દૂરી કેમ
રાખો છો? મોહનવિજ્ય મહારાજ કહે છે: મારી બાજુથી આટલાં પગલાં
ભરાયા છતાં, એક પગલું ભરતાં, સ્નેહનું દાન કરતાં તમે કેમ વિમાસો
છો? સ્નેહ ન વરસાવવો હોય તો કારણ બતાવો. ‘ચૂકું હોવે જો કોઈ
સુખે મુજને કહો.’

મેં આગળ કહ્યું તેમ, મારો આ ભાવાવેશ ભક્તિ છે કે નથી એ તો
મને કહી બતાવો, નાથ !

ભક્તિ શાસ્ત્રોનું થોડું ધાણું જે અવગાહન કર્યું છે. તે કહે છે કે
આ ભાવાવેશ ભક્તિનો છે. પણ આપ પ્રમાણિત કરો ત્યારે ને !



મજુરીરાજિતે નાથ !
સચ્ચૂતે કલકોકિલઃ ।
યથા દૃષ્ટે ભવત્યેવ
લસત્કલકલાકુલઃ ॥ ૧૯ ॥

ખીલે મંજરી આપ્રવૃક્ષે વસંતે,
મહાવાયુ સૌરભ ભરે ત્યાં દિગંતે;
મદોન્મત થૈ કોકિલા અંગભંગે;
મધુરે સ્વરે કૂજતી રાગરંગે.

હે નાથ! આપ્રવૃક્ષ મંજરીથી પિંજરીત થાય છે.
ને કુહુકુહુ કરીને પંચમ સ્વરે કૂજતી કોયલ વનને
મધુર અવાજે ભરી દે છે. એ મુંગી રહી શકતી
નથી. એનું કૂજન અવિરત ચાલુ રહે છે.

તथैष सरसानन्द-
 बिन्दु सन्दोहदायक!
 त्वयि दृष्टे भवत्येव
 मूर्खोपि मुखरो जनः ॥ २० ॥

तथा सर्वने आप आनंद आपो,
 अनादि महा मोहना मूण कापो;
 विभो! आपने ज्ञेयने हर्ष पामी,
 अति मूर्ख पणा हुं बनुं मुखर स्वामी!

ते प्रमाणे हुं अमन्द आनंदने आपनारा आपने
 निरभीने मूळ रही शक्तो नथी. हुं मूर्ख छुं,
 मने कांઈपण बोलता आवडतुं नथी छतां पणा
 मुखरित-वाचाल बनी जाउं छुं.

મરલ્લભૂમિમાં કાળજાળ બપોરે રખડતા મનુષ્યને લીલી કુંજાર જાડી કે ઠંકું, મીઠું જળ મળતાં કેવી 'હાશ' થાય છે.

તમને જોતાં મને જે આનંદ થાય છે એને હું કયા શબ્દોમાં વર્ણાવું ?

કોયલને આંબો મળે ને એ મધુર કંઠે 'કુહુ - કુહુ' કરી આખા વનને ગૂંજતું કરી દે છે. તેમ આપને જોતાં મને થયેલ આનંદ મારી આજુભાજુના આખા પરિસરને આનંદમય બનાવી મૂકે છે.

ભક્ત પોતે જ નાચે છે એટલું નથી હોતું, એનું નૃત્ય જોનારને પણ એમાં સહભાગી થવું પડે એવું એમાં બળ હોય છે. એને પગલે પગલે આનંદની સરવાહી જમ-જમ કરતીકને ફૂટી નીકળે છે.

• • •

તમને જોતાં આટલો આનંદ થાય છે તો તમારામાં સંપૂર્ણતયા નિમજજનનો આનંદ કેવો ગાઢ હશે. 'મુખ દીઠે સુખ ઉપજે.' સહેજ જલક મળે અને ભીતર આનંદનું પૂર ઉમટી પડે છે તો તમને પામવાનું સુખ કેવું હશે ?

આવું નિરવધિ સુખ મેં ક્યાંય ન જોયું, ન માણ્યું. અને એટલે જ તો હું એને જ વારંવાર અનુભવવા ચાહુ છું.

તું મને ભૂલવવા માગે છે. થાપ આપી અદેશય થવા ચાહે છે. પણ હું એ કેમ થવા દઈશ ? ‘ગુણા દેખાડીને હેળવ્યા, તે કિમ કેડો છાડે; જિહાં જલધર તિહાં બપૈયો, પિઉ પિઉ કરી સુખ માંડે.....’

● ● ●

હંસરત મહારાજે દર્શનના નિરવધિ સુખ પછીની આ અદર્શનની કાણોનું માર્મિક વર્ણન કર્યું : ‘આગળથી મન માહરું રે, તે કીધું નિજ હાથ, હવે અળગો થઈને રહ્યો, તે દાવો છે તુમ સાથ.....’

તેં કેવું ચતુરાઈભર્યું કામ કર્યું છે ! પહેલાં મારા મનને કબજે કરી લીધું. મને બીજે ક્યાંય ન ગમે તેવી ભૂમિકા તમે સરજુ. અને હવે અળગા થઈ બેઠા.

હું શું કરું હવે ?

તમારા વિના બીજે ક્યાંય ગમે નહિ. અને તમે દર્શન આપવામાં સો ગરણો ગળી પાણી પીવાની વાત કરો.

● ● ●

ભક્તનો ભાવાવેશ. ભક્તોનો આવેશ / પુષ્યપ્રકોપ.

હંસરત મહારાજે નમિનાથ ભગવાનના સત્ત્વનમાં આ આવેશની પૃષ્ઠભૂમિ પહેલાં ચર્ચી પછી સરસ ઊભરો ઠાલવ્યો છે.

પાણી પહેલાં પાણ બાંધતાં એમણે કહ્યું : ‘એટલા દિન મેં ત્રેવડી રે પ્રભુ! તાહરી લાજ, આજથી જઘડો માંડશું રે, જો નહિ સરે મુજ કાજ.....’ અલ્ટીમેટમ : હવે જો મારું કામ નહિ થાય તો હું સ્પષ્ટ શાંદોમાં મારો ઊભરો ઠાલવી દઈશ. હવે ભીનું ભીનું નહિ સંકેલું.

શા માટે જઘડો માંડવો છે ?

આધારશિલા જઘડાની છે શરણાગતિ.

‘શ્રી નમિજિન ! તુજસું સહી રે, મેં કરી અવિહડ પ્રીતિ, તું નિઃસ્નેહી થઈ રહ્યો પ્રભુ! એ નહિ ઉત્તમ રીત...’

મેં તારા પર અવિહડ પ્રેમ કર્યો. અને તું મારા પર સ્નેહ ન ધરે તો આ તો કંઈ સારી વાત નથી, ભગવાન!

અને એ પછી ભક્ત વરસી પડે છે. ‘કઠિન હદ્ય સહી તાહરુંરે, વજ થકી પણ બેજ; નિગુણ ગુણ રાચે નહિ રે, તિલ માત્ર નહિ તુજ હેજ રે...!’

હું આટાટલું વીનવું. તલસાટ વ્યક્ત કરું, અને છતાં તમે મારી સામેય ન જુઓ! મને લાગે છે કે તમારું હૈયું વજથી પણ વધુ કઠણ છે.

કેટલું હું રહ્યો.

વજ પીગળી જાય એટલું. પથ્યર ઓગળી જાય એટલું...

છતાં તમે ન રીજો...?

તમને મારા પર સહેજે હેત નથી. ‘તિલ માત્ર નહિ તુજ હેજ રે.’

પણ તમે એમ કોરા રહી શકશો નહિ. ‘છોડતાં કિમ છૂટશો? આવી પાલવ વળગ્યો જેહ રે..’ ગૌતમ સ્વામી ભગવાને તો વિલાપમાં કહી દીધું હતું : ‘રહેત ન છોડો તાણી! પણ આ ભક્ત ખરેખર છોડો પકડો એવો છે.

કદાચ પકડી લીધો છે તમારા ગુણ રૂપી વસ્ત્રનો છોડો. એ સિવાય નિરવધિ આનંદના ક્ષેત્રમાં મારો પ્રવેશ કેમ થયેલો હોય?

તમને જોઉં છું ને આનંદ આનંદ થઈ જાય છે. ‘ત્વયિ દૃષ્ટે...’

‘મુખરો જનઃ’ હા, મારી આ વાચાળતા પણ તમારામાંથીજ ઉદ્ભવેલી છે. શબ્દોનો પ્રવાહ - જોરદાર પ્રવાહ વહી રહ્યો છે; જેમાં મારું પૂરું વ્યક્તિત્વ તણાઈ રહ્યું છે - તારા ભણી.

બીજુ કઈ રીતે હું તારા ભણી વહી શકું? ન પ્રીતની રીત જાણું, ન
ભક્તિની વિધિ જાણું... માત્ર આ અસંખ્ય વાર્તાલાપ તારા તરફ ચલાવ્યા
કરું છું. આ જ મારું જીવનધન. આ જ મારું સુખ.



તदेनं माऽवमन्येथाः
नाथासम्बद्धभाषिणम्।
मत्वा जनं जगञ्चेष्ठ!
सन्तो हि नतवत्सलाः ॥ २१ ॥

મને જેમ ને તેમ વદતો વિચારી,
અવજા ન કરજો દીનાનાથ મારી;
જગત્પૂજ્ય છો આપ ને મૂર્ખ છું હું,
કૃપા સર્વ પર સંત કરતા પરંતુ.

હે નાથ! અસમદ્ભ-જેમને તેમ હું આપની પાસે
બોલ્યા કરું છું તેથી આપ મારા પર ચીડાઈ જતા
નહીં, મારો તિરસ્કાર કરતા નહીં. હે વિશ્વોત્તમ,
મારા માલિક! મને મૂર્ખ ને જડ માનીને હડસેલતા
નહીં. સત્પુરુષો તો નમ્ર-ભક્ત પ્રત્યે પ્રેમ જ કરે
છે.

કિં બાલોજલીકવાચાલ
આલજાલં લપનપિ।
ન જાયતે જગન્નાથ!
પિતુરાનન્દવર્ધક: ॥ ૨૨ ॥

વદે જેવું તેવું અહીં બાળ નાનો,
અરે કલબલે સહજ પણ રહે ન છાનો;
પિતા હર્ષ પામી કહે ટેવદાનો,
ખરેખર પ્રભુ ! આપ માનો ન માનો.

હે જગદીશ્વર ! સાચું જુહું-મનમાં આવે એવું,
અસ્પષ્ટ અને અવ્યક્ત બોલતો બાળક શું પિતાને
હર્ષ નથી પમાડતો ? પમાડે જ છે.

તथાઽશ્લીલાક્ષરોલ્લાપ-
જલ્પાકોઽયં જનસ્તવો
કિંચિત્ત્રદ્વાર્થ્યને નાથ!
તોષં કિં નેતિ કથ્યતામ् ॥ ૨૩ ॥

ગમે તેમ હું આપ પાસે કહું છું,
ગમે કે ગમે ના, તમોને ચહું છું;
હું છું આપનો, આપ મારે શિરે છો,
મને હાથ જાલી પ્રભુ તારી લેજો.

હે નાથ! નાના બાળકના જેમ હું પણ આપની
પાસે ગમે તેમ-ગમતું ને ન ગમતું બોલે જ રાખું
છું, આપ જ કહો કે એ આપને ગમે છે કે નથી
ગમતું ? આપના આનંદમાં એથી વધારો થાય
છે કે નહીં ? આપ કહો એટલે બસ.

હું જે નિવેદન કરી રહ્યો છું..... મને ઘ્યાલ છે કે, એમાં વાગ્ધારા બહુ ઉલટી-સૂલટી વહી રહી છે. ઘડીમાં શું બોલું છું. ઘડીમાં વળી બીજી જ વાત શરૂ કરું છું. મને જ સૂઝ નથી.. પણ, તમે મારી અવગાણના ન કરશો.

તારી દુનિયામાં પ્રવેશવા માટે ભક્તિનો જ પ્રવેશપત્ર ચાલે છે.
 'વિશૃદ્ધલાભપિ વાગ્વૃત્તિ: શ્રદ્ધાનસ્ય શોભતે' એ કલિકાલ સર્વજા
 હેમચન્દ્રાચાર્ય મહારાજની ઉક્તિ મને આશ્વાસન આપે છે.

તું ભક્તિને જ જુએ છે, શબ્દોને નહિ, એ મારા માટે નાનું-સૂનું
આલંબન નથી.

શબ્દો મારી પાસે છે, પણ તારા મહિમાને બધ્ય કરી શકે એવા શબ્દો ક્યાં છે? ‘શબ્દમાં સમાય નહિ એવો તું મહાન, કેમ કરી ગાવા મારે તારાં ગુણગાન...?’

પૂ. હેમચન્દ્રાચાર્ય જેવા વિદ્વાન સિદ્ધસેનાચાર્યની સ્તુતિઓને યાદ કરતાં કહે છે : ‘કૃ સિદ્ધસેનસ્તુતયો મહાર્થા: અશિક્ષિતાલાપકલા કૃ ચૈષા...’ કયાં સિદ્ધસેનાચાર્યની અર્થ ગંભીર સ્તવના અને વિશૃંખલ શબ્દોની રૂચનાવાળી આ મારી સ્તવના ક્યાં ?

હેમચન્દ્રસૂરી મહારાજાના આ નિવેદન પછી મારે તો કહેવાનું જ શું રહે?

શબ્દોના સ્વામી, મહાન વૈયાકરણ આચાર્ય હેમચન્દ્રસૂરિ મહારાજા જ્યારે પરમાત્માની સ્તુતિ કરતાં પોતાના પુરોગામીઓને યાદ કરી પોતાની અશક્તિ જાહેર કરે છે તો પછી પ્રાકૃત મનુષ્યની તો આમાં હેસિયત જ શું હોઈ શકે ?

પૂજ્ય હેમચન્દ્રાચાર્યને ફરીથી યાદ કરું તો, આ કામ, ' લહેમ જહ્વાલતયા સમુદ્ર, વહેમ ચન્દ્રદ્વાતિપાનતૃષ્ણામ् - ' જેવું છે. પગ વડે સમુદ્ર કેમ ઓળંગાય? ચન્દ્રના કિરણોને કઈ રીતે પીવાય?

છતાં તમારી સ્તવના કરીશ. તૂટ્યા-કૂટ્યા શબ્દોમાં... આવડે તેવી રીતે.

કારણ કે, મારે તમને રીજવવા છે, સ્વામી!

અને તમને જ પૂછું ને કે, "કેસે રીજાઉં મૈં તુમ્હે હો સ્વામિન્!" શી રીતે? તમે કહેશો તે બધું જ કરવા હું તૈયાર છું. શું કરું, બોલો !

હમણાં જ મેં કહ્યું હતું : 'ત્વं ચ મે ગુરુः'... મારા ગુરુ પણ તમે જ છો. તમારે જ મને સાધનામાર્ગનો ને ભક્તિમાર્ગનો એકડો ઘૂંટાવવાનો છે.

હા, તમે જગદ્ગુરુ. તમે વિશ્વનિયતા... પણ એ બધા વિશેષણોને કારણે તમે બહુ દૂર થઈ જાવ છો. 'મારા ગુરુ...' કેટલી હળવાશ લાગે...

ભાર 'મારા' પર વધુ છે મારો... પ્રોફેસર બહુ મોટા હોય. નામાંકિત. મોટી સભાઓને ગજવનાર. પણ એય પોતાના બાળકને એબીસીડી શીખવાડે. આત્મીયતાનો નાતો છે ને !

હું પણ તમારી પાસે જ શીખવાનો... તો હવે બોલો, તમને રીજવવાનો માર્ગ કયો?

'તદેન માર્ગમન્યેથા:.....'

મારી અવગણના ન કરશો.

તમને રીજવવા તમારે દ્વારે આવ્યો છું અને તમે મારી સામે જોશો પણ નહિ? મારી અવમાનના કરશો?

હું એને શી રીતે સહી શકીશ?

તમે નતવત્સલ છો. જે તમારે શરણો આવે તેના પર વાત્સલ્ય વહાવો છો તો મારા પર કાં નહિ?

નરક અને નિગોદમાંથી તમે મને અહીં શા માટે લાવ્યા? જો તમારે
આમ અધવચ્ચે હાથ છોડી દેવો હતો! તમારી કૃપાના આધારે હું ઠેઠ
નીચેથી અહીં સુધી આવ્યો અને આજે જો તમારી કૃપાનો જરો મને
વહેતો ન દેખાય તો મને કેટલું દુઃખ થાય તેનો તો આપ વિચાર કરો.
[‘કૃપા કરી મુજ દેવ! રે ઈહાં લગી આણીયો, નરક નિગોદાદિક થકી
રે... આવ્યો હવે હજૂર રે, ઉભો થઈ રહ્યો, સામું શેં જુઓ નહિ એ...’]
- ઋષભજિન વિનતિ]

• • •

‘મારી અવગાણના ન કરશો’ નો વિધેયાત્મક અનુવાદ આવો થશે:
 મારા પર કૃપાધારા વહાવો. અથવા તો એકદમ વાસ્તવિક રીતે કહેવું
 હોય તો કહેવાય કે તમારી કૃપાધારા મારા પર વરસી રહી છે એની
 મને પ્રતીતિ કરાવો.

સ્પષ્ટ પ્રતીતિથી ઓછું કંઈ ચાલે તેમ નથી. એથી ઓછે હું રાજુ
થાઉં તેમ નથી.

ભાગવિજ્ય મહારાજના શબ્દો છે. ‘હસિત વદને બોલાવીને રે,
આજ મુજને રાજુ કરો ને...’ મને આજ રાજુ રાજુ કરી દો, પ્રભુ !

• • •

મારું નિવેદન લંબાતું જતું રહ્યું છે પણ મને ઘ્યાલ છે કે, આપને એ ગમે છે. ‘બાળક તે જિમ તિમ બોલતો, કરે લાડ તે તાતની આગે રે, તે તેહશું વાંછિત પૂરવે, બની આવે સધણું રાગે રે...’

પ્રોફેસર પિતા પુત્રના શબ્દોને શબ્દશાસ્કોની અદાથી જોતો નથી. વાત્સલ્યની નજરે એ શબ્દોનું મૂલ્યાંકન થાય છે. આત્મીયતાનો પુટ એ શબ્દોને નવું મૂલ્ય આપે છે.

પ્રેરણ આ થશે હવે આ સંદર્ભમાં...? હું તમારો આત્મીય છું ? ને છું તો કેટલા અંશે ?

● ● ●

કો'ક વાર આ સંદર્ભ નિરાશાની ખીણમાં મને લઈ જાય છે. ‘વીતરાગ શું રે, રાગ તે એકપખો, કીજે કવણ પ્રકાર ?’ જો તમે મને આત્મીય માનવા તૈયાર ન હો, મારી ભક્તિનો સહેજ પણ પ્રતિભાવ તમે ન બતાવો તો એકપક્ષીય પ્રેમ હું ક્યાં સુધી કર્યા કરીશ ?

ઉદાસીનતા તીવ્ર માત્રાએ પહોંચશે ત્યારે આ એકપક્ષીય રાગનો થાક નહિ લાગે મને?

તમે જો કોઈ રીતે તમારો હાથ મને પકડવા ન દો તો હું ક્યાં સુધી ઝૂદકા લગાવ્યા કરીશ ?

મહોપાધ્યાયજી આ એકપક્ષીય સ્નેહને દુઃખદાયી બતાવતાં કહે છે: ‘જેહનું મિલવું રે દોહિલું તેહશું, નેહ તે આપ કિલેશોજુ..’

પ્રાર્થના કરીએ, વીનવીએ છતાં તમે દૂરના દૂર રહો તો પછી હાથમાં શું આવવાનું ?- સિવાય કે કલેશ.

જો કે અત્યારે તો હું ઉલ્લાસમાં છું. અને ઉલ્લાસમાં હોઉં ત્યારે ઘણીવાર આ પંક્તિ ગળાગળું છું: ‘એક પખો જે નેહ નિરવહદ્વો તે માંકી (મારી) સાબાશી.’ આ એકપક્ષીય સ્નેહ એ મારી વિશિષ્ટ મૂડી છે.

મહોપાધ્યાયજી કહે છે: ‘લલચાવો લખ લોકને સાથી સહજ ન થાવ..’ તમે તમારી ઝાંખી બતાવી લાખોને લલચાવો છો. પણ લલચાવીને પછી ઝૂરાવો છો. એટલે કોકવાર થઈ આવે છે : ‘એવા શું ચિત્ત મેળવ્યું?’

આવા વ્યક્તિવને સ્નેહ સમર્પિત કરીને મને શું મળ્યું? પણ, ના, હું હાર નહિ સ્વીકારું. ‘નિરાગી સું રે કિમ મીલે, પણ મળવાનો એકંત, વાચક યશ કહે મુજ મળ્યા, ભક્તે કામણા તંત...’

‘મેં માર્ગ ખોજી લીધો છે વીતરાગને રીજવવાનો’, મહોપાધ્યાયજી કહે છે, ‘ભક્તિના કામણથી હું એમને રીજવીશ.’

તમે ભલે વીતરાગ રહ્યા, મારા હૈયામાં તો વીતરાગનો રાગ જ રાગ ભરેલો છે. અને રાગથી જ હું ઊચકાઈશ. (‘તું તો નિરાગી છે પ્રભુ પણ વાલ- હો મુજ જોર’..)

તારા પ્રત્યેના આ રાગને વિકસિત કરવો બહુ કઠણ છે. કારણ કે તારા પ્રતિભાવને સમજવો સરળ નથી. બહુ ગણન છે પ્રતિભાવના તારા સંકેતોનો મારી ભાષામાં અનુવાદ કરવો એ. રામવિજય મહારાજ આ અવસ્થા ભણી ઈશારો કરે છે: ‘તુજ સાથે જે પ્રીતિ. અતિ વિષમ ખાંડા ધાર...’

પણ એ તલવારની ધાર પર ચાલતાં આવડે તો આગળ સુખ જ સુખ છે. આનંદની એક નવી દુનિયા આ તલવારની ધાર પરના ચંકમણ સાથે ખૂલતી જાય છે. ‘પણ તેહના આદર થકી, તસ ફળ તણો નહિ પાર...’

હું તો એટલું જ કહું છું કે, કો’કવાર મારી પ્રીતિ લડખડાતી દેખાય ત્યારે તમે એને ટેકવજો. ‘થાંસુ પ્રેમ બન્યો છે રાજ, નિરવહણો તો દેખે...’

પ્રેમ તો થયો છે. હવે એને નિરવહણો !

● ● ●

રવીન્દ્રનાથ ટાગોર યાદ આવ્યા વિના કેમ રહે ? :

હું તો ચાહું, તમને ચાહું, ચાહું કેવળ તમને,

એ જ વાત કહેવા દો સ્વામી, નિશ દિન મારા મનને.

બીજુ જે ઈચ્છાઓ વાંસે,
ભટકું છું દિવસે કે રાતે,
મિથ્યા તે સૌ મિથ્યા, હું તો ચાહું કેવળ તમને.



अनाद्यभ्यासयोगेन
 विषयाशुचिकर्दमे।
 गर्ते शुकरसडकाशं
 याति मे चटुलं मनः ॥ २४ ॥

અરે, શબ્દને રૂપ રસ ગંધ સ્પર્શો,
 અતિ ચપલ મન મારું યાચે સહર્ષે;
 અશુચિભર્યા ગર્તમાં ભૂંડ જેવું,
 રમે છે ભરે છે ખરે ચિત કેવું.

હે અહીન! આપને શું કહું ? હું આ મારા
 મનથી હવે થાક્યો છું. લટુડા પટુડા કરતું એ
 ભૂંડ જેવું અનાદિ અનંતકળના સંસ્કારને કારણો
 ગંદા ને ગંધાતા, વિષય-કાદવથી ભરેલા
 ખાબોચીયામાં જાય છે ને મને ખેંચી જાય છે.
 એને ઉત્તમ ભાવો તો ભાવતા જ નથી.

તમારા પ્રેમને સમાજનું એક બીજુ ધારા પણ વહ્યા કરે છે ભીતર.
અને એ જ તો બધી ખાનાખરાબીનું મૂળ છે.

આપના પ્રેમમાં તરબતર થઈ ગયો હોઉં છું. સ્વર્ગીય આનંદની
લહેરોમાં ઝૂબાડુબ થઈ ગયો હોઉં છું. ત્યાં જ પેલી ધારા આ ધારાને તોડી
ફેરી નાખે છે.

અનાદિની અત્યસ્તતાને કારણે વિજાતીય રૂપનું આકર્ષણ તારા રૂપમાં
ખોવાયેલી મારી આંખોને ત્યાં ઠેરવે છે.

હું શું કરું ?

આ મનની ચપળતાને શી રીતે હું નાથું ?

રામવિજય મહારાજ અને મોહનવિજય મહારાજની આંગળી પકડી
તારી નજીક હું આવું છું. તારી નજીક આવવાનો આનંદ.. કેવો તો દિવ્ય
હોય છે એ ! પણ પેલી આસક્તિ. સત્તવનાકારોની આંગળી છૂટી જાય
છે. હું એકલો એકલો પડી જાઉં છું. તું આંખોથી ઓળખ થઈ જાય છે.

પછી જ્યારે ખ્યાલ આવે છે ત્યારે બેબાકળો થઈ હું તને પુકારું છું:
દેવ ! તમે ક્યાં છો ? મને દર્શન આપો !

તારી બાજુ ડગ માંનું છું. થોડોક નજીદીક આવુંય છું.. અને આ વાસનાનો વાયરો મને પાછળ હડસેલી મૂકે છે.

પૂજ્ય જિનવિજ્ય મહારાજ મહામહિમ અનંતવીર્ય ભગવાનના સ્તવનમાં આ દર્દ ઘૂંઠી રહ્યા છે: ‘કામરાજે અણનાથ્યા સાંઠ પરે ધસ્યો, સ્નેહરાગની રાચે ભવપિંજર વસ્યો; દષ્ટિરાગ રુચિ કાચ પાચ સમક્ષિત ગણું, આગમ રીતે નાથ ન નીરખું નિજપણું...’

સ્પર્શ-સુખની લાલસાએ મને ક્યાંયનો ન રાખ્યો, ભગવાન! રૂપ જોયું, આંખો સળવળી, આંખોએ સ્પર્શનેન્દ્રિયને બહેકાવી. કુલાચાર ભૂલ્યો, મર્યાદા ભૂલ્યો. લોકલાજને નેવે મૂકી.

હવે મારે મારી ઈન્દ્રિયોને તારામાં સમેટી / સંકોરી લેવી પડે છે.

હવે એક જ સ્પર્શ રહે : તારો. એક જ રૂપ જોવાનું : તારું. એક જ શબ્દ સાંભળવાનો : તારા નામનો.

ન રહે મૂલ્ય બીજા સ્પર્શાનું, ન રહે મૂલ્ય બીજા શબ્દાનું.

કેવળ તારો સ્પર્શ.

કેવળ તારો શબ્દ.

કેવળ તારું રૂપ.

તમારામય ક્યારે હું બનીશ, દેવ!

● ● ●

કામ થોડો સ્થૂળ. એ કદાચ થોડો ઓસરે. ઓગળે. પણ સ્નેહના તાણાવાળાને કેમ વીખેરવા ? આર્યકુમારે પુત્રે વીંટાળેલ સૂતરના દોરડાના બંધનને જોઈ માર્મિક ટિયણી કરેલીઃ આ બંધનને તોડી શકાય. પણ પ્રેમના બંધનને કેમ તોડી શકાય ?

સ્નેહરાગ એ જ સંસારનું પાંજરું. ‘ભવપિંજર.’ સરસ વ્યાખ્યા કરી સ્નેહરાગની. સ્નેહ એવું સુંવાળું પાંજરું છે કે એને બંધન સમજનાર પણ એમાં સપડાયા વગર રહેતો નથી.

કામરાગ :- સ્પર્શની સપાટી.

સ્નેહરાગ :- મનની સપાટી.

દષ્ટિરાગ :- અહંકારની સપાટી.

મારે આ ત્રણે સપાટીઓને પાર કરી ચેતનાની સપાટી પર તમારો સ્નેહ પામવો છે.

સ્નેહને / મારા આખાય વિકિતત્વને મારે તમારામાં સમેટવું છે.

ખૂબ પ્રીતિ કરી: પર-જન સાથે, પર-પદાર્થ સાથે. પણ એમાં કશો સાર ન નીકળ્યો. સ્તવનકાર કહે છે તેમ, ‘પ્રીતિ અનાદિની દુઃખભરી, મેં કીની હો પરપુદ્ગલ સંગ; જગત ભમ્યો તિણે કારણે, સ્વાંગધારી હો નાચ્યો નવ નવ રંગ.’ થાકી ગયો, દેવ! પ્રીતિ કરતો ગયો. દુઃખ મેળવતો ગયો. ‘ભવપિંજર’ માં પાંખો ફક્દાવતો રહ્યો.

હવે મુક્ત ગગનમાં ઊડવું છે. તારા પ્રેમમાં ખોવાવું છે. ‘મેરા ન કોઈ જગતમેં, તુમ વિના હો જિનવર જગદીશ, પ્રીત કરું અબ કોન સું, તુમ ત્રાતા હો મોહે વીસવાવીસ.’

બીજા કોની સાથે હવે પ્રીત કરું ? ને બીજા કોની સાથે બોલું?

● ● ●

ગૌતમ સ્વામી મહારાજના વિલાપની એક સ્તવનાની ધૂવ પંક્તિ યાદ આવે છે: ‘તારા વિના વીર કોની સાથે બોલવું ?’ તમારા શષ્ઠો સાંભળવાનીય મજા અને તમારી સાથે બોલવાનીય મજા.

હવે જો તમે મને કંઈ સંભળાવો નહિ તો હું શું સાંભળું? અને તમે જો બોલાવો નહિ તો કોણી સાથે બોલું?

જો કે ભક્ત બહુ પહોંચેલ બૂધી છે. એ હાર નહિ સ્વીકારે કદ્દી.

‘તું ન બોલાવે તો બીજા કોઈની સાથે ન બોલું’ એ વાત નક્કી. પણ ‘તમે મારી સાથે કેમ નથી બોલતા? આ વિષય પર, ધારાપ્રવાહ બોલવાની એની હોંશિયારી અજોડ છે.

અને કંઈ નહિ તો, જઘડો કરવામાં કે રીસ કરવામાં કોઈ કારણની જરૂર હોતી નથી. જો કે રીસાઈને ‘ચાલો! કિંડા!’ કરીને મૂંગો નહિ બેસું.. શબ્દયુદ્ધ ખેલી નાખીશ મસ મોટું : ‘કેમ નથી બોલતા?’ કરીને!

કામરાગ, સ્નેહરાગ અને દષ્ટિરાગ; ત્રણ ત્રણ જાતના રાગના આ ઘેરાવમાં ઘેરાયેલું મારું વ્યક્તિત્વ. આ ભૂમિકા પર રહેલો હું તારી ભક્તિ કરવા ધારું તોય શી રીતે કરું? પૂજ્ય માનવિજ્ય મહારાજે નજાકતથી આ પ્રશ્ન છેઝ્યો છે: ‘કયું કર ભક્તિ કરું પ્રભુ ! તેરી ?’

ભક્તિનો રસ મીઠો લાગે છે પણ.... ‘કોધ લોભ મદ માન વિષયરસ, છાંડત ગેલ ન મેરી..’ આ બધા રસો(?) માંથી હું છૂટું ત્યારે ને ! ‘અનાદ્યાભ્યાસયોગેન..’ વિષયોની આસક્તિ ખરાબ છે એ જાણવા છતાં અનાદિની અભ્યસ્તતાને લીધે પગ એ બાજુ ઉપડે છે. મન એ લપસણી ભૂમિ પર ફસડાઈ પડે છે.

હું શું કરું, દેવ ?

તમે ઉપેક્ષાથી કાં જોઈ રહો ? મને ટેકો કેમ ન આપો ? મારો હાથ પકડી મને ઊભો કેમ ન કરો ? મારી આ વિવશતા આપ નથી જોઈ શકતા? ‘દષ્ટિ રાગ દઢ બંધન બાંધ્યો, નિકસન ન રહી શેરી..’ કામરાગ, સ્નેહરાગ અને આ ભયંકર દષ્ટિરાગ.. આ દઢ બંધનથી હું બંધાયો છું. જકડાયો છું. તારી ભક્તિ હું શી રીતે કરું ?

‘દાસ્તિરાગ રૂચિ કાચ પાચ, સમકિત્ત ગણું..’ દાસ્તિરાગથી માનેલ સત્ય કાચ જેવું હોવા છતાં એને મહિં માનીને હું ચાલ્યો, દેવ! દાસ્તિરાગને જ સમકિત્ત માની લીધું.

‘અનાદ્યાસયોગેન..’ વિષયોમાં શું છે જકડી રાખનારું મને? માત્ર અનાદિનો અભ્યાસ... એક વળગણ... એક ધારા...

તારી ભક્તિ. રાજમહેલ જેવી.. મારી ઝૂંપડી : અંધારધેરી. ને છતાં આ ઝૂંપડી કાં ન છૂટે ?



ન ચાહં નાથ શક્નોમિ
તનિવારધિતું ચલમુ ।
અતઃ પ્રસીદ તદેવ-
દેવ ! વારય વારય ॥ ૨૫ ॥

નિવારી શકું ના ચપલ ચિત કેમે,
ન રાખી શકું સ્વસ્થ એ નાથ ! કેમે;
અશક્તિ અતિ તો ય આસક્ત એમાં,
કરો જો કૃપા, થાય દૂરે અરે આ.

હે નાથ ! મારા એ ચંચલ મનને હું રોકી
શકતો નથી, મારા પર દયા લાવો ને મને
બતાવો કે મારે શું કરવું ? હે દેવના દેવ ! ગમે
તેમ કરીને તે મનને વારો ! દૂર કરો ! એથી
મને બચાવો.

વિજ્ઞાતીય રૂપ અને સ્પર્શને જોવા/માણવાની, વિવિધ ખાદ્ય પદાર્થોના રસને આસ્ત્વાદવાની, મનોહર શબ્દો સાંભળવાની લાલસાને હું રોકી શકતો નથી. સમજું હું કે આ બધામાં અટવાઈ ગયો તો હું મહામૂલા જનમને હારી જઈશ.

આંખને બીજે જતી અટકાવવા માટે તો તારું દર્શન હું વારંવાર કર્યા કરું છું. મન બીજે ન ભટકે એ માટે. ભક્તિયોગાચાર્ય માનતુંગસૂરિ મહારાજ તો કહે છે કે દેવ! તારું રૂપ જોયા પછી બીજું કંઈ જોવાનું ગમતું નથી. આટલા મોટા ભક્તિયોગના આચાર્ય સાખ પૂરે છે એ વાતમાં મારું મન સાખ ન પૂરે ત્યાં સુધી હું શું કરું, દેવ?

शुं में तमारुं दर्शन नथी कर्यु ?

કર્યું હોય તો, થયું હોય તો, ‘નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ’ ને
સામે છેઠે મારું વર્તન કેમ ?

કો'ક કો'ક વખત, ઉદ્યરણ મહારાજ કહે છે તેમ, તારા દર્શનમાં એકાગ્ર થઈ જાઉ છું ત્યારે બધું ભૂલી જાઉ છું ('તુજ મુખ જોવાની રઢ લાગી. તેને ન ગમે ઘરનો ધંધો..'), પણ આ કષણો થોડીક જ હોય છે તે મને નથી ગમતું.

મારે તો સદા-સર્વદા એક અનુભૂતિથી લીંપાવું છે. બીજે ક્યાંય આંખ ઠરે જ નહિ.



રૂપની છેલ્લી ક્ષિતિજ તમે. ("જગ સધળો નીરખીને જોતાં, તારી હોડે કો
નહિ આયો રે..") તમને જોતાં ચિત્ત સ્તબ્ધ થઈ જાય. આંખો અંજાઈ જાય.

"સમવસરણમાં એ રૂપને જોયું'તું," સિદ્ધસેનદિવાકર સૂરિજી કહે
છે, "પણ એ રૂપને જોવાની આંખો નહોતી એ વખતે." (નિરીક્ષિતોર્પિ
નૂં ન ચેતસિ મયા વિધૃતોસિ ભક્ત્યા).

આને સામે છેઠેનો અનુભવ મને નહિ પ્રગટ્યો હોય, પ્રભુ? કે
સમવસરણમાં તમને જોયા. એ વિશ્વમોહન રૂપને જોતાં આંખો બે જ છે
એનો તીવ્ર અસંતોષ પ્રગટ્યો. પછી કાન, જીબ, તમામ ઈન્દ્રિયો-પૂરું
અસ્તિત્વ તમને જોવામાં લાગ્યું. ને છતાં એને ક્યાં જોઈ શકાય તેમ
હતું ? 'નીરખત તૃપ્તિ ન હોય..' ની લાગણી ચાલ્યા કરેલી... આવું
નહિ બનેલું, પ્રભુ? પ્લીજ, કહો તો ખરા !

તમારું રૂપ જોવું ગમે છે. એકીટસે નીરખ્યાય કરું છું ઘણીવાર. પણ
એ હેઠે રૂપ નથી ગમ્યું કે બીજું બધું કદ્રૂપ, કુરૂપ લાગે.

સૂરદાસ યાદ આવે : 'જીન આંખિન મેં નવિ રૂપ વસ્યો, ઉન
આંખિન સેં અબ દેખિયો ક્યા?' માત્ર રૂપ શબ્દ વાપરે છે સૂરદાસ..
તારું રૂપ તે જ રૂપ.. બીજું કુરૂપ, અરૂપ.

સૂરદાસની પેલી જીવન ઘટનાને તે દિવસે આંખોમાં ભરેલ આંસૂ
સાથે મેં કેવી રીતે સાંભળેલી તે તો તમને ખ્યાલ છે ને?

સૂરદાસે નક્કી કર્યું: આંખો રૂપ (પરમ-રૂપ) જોવા માટે જ. પર-રૂપ
માટે નહિ જ. અને છતાં આંખો આમ તેમ ગઈ. સૂરદાસે તરત છરી
કાઢી આંખોની રોશની સમામ કરી દીધી. કેવી સજણ મારી આંખો બની
ગયેલી આ સાંભળતી વખતે ? આવું સામર્થ્ય મારામાં નથી... પણ તું
મારી આંખોને કાં બંધ ન કરી દે ?

મારી ઈન્દ્રિયોને અને મારા ચાપળ મનને હું રોકી નથી શકતો,
પ્રભુ! તું મારા પર કૃપા કર અને એમને નાથ...



કિં મમાપિ વિકલ્પોર્જસ્ત
નાથ! તાવકશાસને।
યેનૈવં લપતોડધીશ!
નોજરં મમ દીયતે ॥ ૨૬ ॥

મને શું વિકલ્પો તમારે વિષે છે,
ગમે શું ન શાસન તમારું વિશેષે;
તમે કેમ ના સાંભળો નાથ! મારું,
વિલાપો કરું તોય વદતા ન વારું.

હે નાથ! આપના શાસનમાં મને વિકલ્પ છે,
મને શંકા છે, શું મને એ ગમતું નથી ? આપ
મારામાં પૂરો વિશ્વાસ જોતા નથી ? કે આમ હું
લવ્યા કરું છું છતા મને આપ ઉત્તર આપતા
નથી ?

પૂજ્યપાદ જ્ઞાનવિમલ સૂરિ મહારાજ કહે છે : ‘અનુભવ શીલે લોચન લીલે, ખલક પલક મેં તારી; તો એવડી શી ઢીલ કરો છો, આજ અમારી વારી ?’

આખી પૃથ્વીને તે પલકમાં તારી, પ્રભુ! તારી શક્તિનો કોઈ પાર નથી. પણ, મને તારવામાં આટલી બધી ઢીલ કેમ કરો છો?

સિદ્ધર્ષિજીનો પ્રક્રિયાનુસાર ધારદાર છે. મારા માટે કેમ અપવાદ રખાયો છે, પ્રભુ! બધા માટે નિયમો જુદા. અને મારા માટે નિયમો જુદા. કારણ શું ?

હું ભક્ત નથી એથી મારી પરીક્ષા લેવાઈ રહી છે ?

લ્યો પરીક્ષા! મને તાવો... તો જ હું કુન્દન બનીને બહાર આવીશ ને! પણ આ તાવણી અઘરી પડી રહી છે. અઘરી એટલા માટે કે, હું તમારો શબ્દ મેળવવા લાલાયિત બન્યો છું, ઉત્સુક બન્યો છું. અને આપ મૌન ધરી બેઠા છો.

‘નોત્તરં મમ દીયતે’.... મારા આટલા બધા લાંબા વક્તવ્યનો કોઈ પ્રત્યુત્તર જ ન મળે આપના દ્વારા એ કેમ ચાલે ?

ભાણવિજ્ય મહારાજે સરસ કહું છે: ‘લલચાવશો દિન કેટલા રે, ઈમ મુજને દિલાસો દેઈને; હા-ના મુખથી ભાખીએ રે, બેસી શું રહ્યા મૌન લઈને?’

આમ ક્યાં સુધી મને લલચાવ્યા કરશો ? તલસાવ્યા કરશો ? કોઈ જવાબ જ નહિ, હું આપનો ઉત્તર સાંભળવા કેવો તો તલસી રહ્યો છું.

‘હા-ના મુખથી ભાખીયે રે,’ હું ‘હા’ સાંભળવા જ ઉત્સુક બેઠો છું. આપ કહો કે, ‘હું દર્શન-સુખ આપીશા. પણ આ મૌન રહેવા કરતાં તો બહેતર છે કે આપ ‘ના’ પણ પાડો.’

કમ સે કમ, મૌનમાંથી શબ્દની ભૂમિકાએ તો આપ આવ્યા! નકારને હંકારમાં બદલવાનું જ બાકી રહ્યું.

● ● ●

‘નોત્તરં મમ દીયતે-’ ની એક બીજી આધારરૂપ ભૂમિકા આ છે, જે મહા-મહોપાધ્યાય શ્રીમદ્ભગવિજ્ય મહારાજાએ સવાસો ગાથાના સ્તવન (૧૧મી ઢાળ) માં બતાવી છે, ‘ઓલિયા ઓલ જે તે ગણું સફળ, જો છે તુજ સાખ રે..’ મારા વચ્ચેનોનું મૂલ્ય ત્યારે જ છે, ભગવાન! જ્યારે તમે એ પર તમારી મહોર મારો.. આપની મહોર વિનાના/સમૃતિ વગરના મારા શબ્દનોનું શું મૂલ્ય હોઈ શકે?

હું વીનવ્યા કરું. મને દર્શન-સુખ આપો. આપો.. અને આપ એને સાંભળો જ નહિ તો ?

તમારો જવાબ કમ સે કમ મને એટલી હુંક તો આપે ને કે, મારી વાત સંભળાઈ છે. ભલે જવાબ ઈનકારમાં અપાય.

મારે જવાબ જોઈએ આપનો.

ક્યારે આપો છો ?

અબોલડાં ક્યારે તોડશો ?

● ● ●

દીપવિજ્ય મહારાજે એકદમ મજાનો પ્રશ્ન પૂછ્યો છે : ‘અબોલડાં શાનાં લીધાં છે રાજ’ ?

અબોલડાં ક્યારે તોડશો એ પ્રશ્ન નથી. થોડાક ડગ આગળ ભરીને (થોડા દૂરના અતીતમાં ડોકિયું કરીને) તેઓ પ્રશ્ન પૂછે છે: આ અબોલાની આખરે જરૂરિયાત શી? અને એ કેમ શરૂ થવાં છે?

દીપવિજય મહારાજ સંબંધોની સશક્ત આધારશિલા પર ઊભીને આ પ્રશ્ન પૂછી રહ્યા છે. ‘તમે અમારા. અમે તમારા..’ સંબંધોની આટલી ગાઢતા પછી આ મોં ફેરવવાની વાત ક્યારે શરૂ થઈ?

એમણે એમની આ પ્રસિદ્ધ સ્તવના દ્વારા પરમાત્મા સાથેના અતીતના સંબંધોની ઝક્કોર સ્મૃતિઓ જે જગાવી છે, એ અજોડ છે.

‘કાળ અનંત સ્નેહી ઘારા, કદીય ન અંતર કરતા...’ નિગોદમાં અનંત કાળ સુધી આપણે કઈ રીતે રહ્યા’તા પ્રભુ! સાથે ધબકતા, સાથે શ્વસતા; જીવન-મૃત્યુની ત્યાંની જટિલ અને વેગવતી પ્રક્રિયામાં સાથે જ સફર કરતા.

અને આજે ?

એ વખતે બિલકુલ અંતર/દૂરી ન હતી. ‘હવે અંતર કિમ કીધું પ્રભુજ?’

અને આ સહજીવન કેટલું બધું લાંબું વિસ્તર્યું હતું !

દીપવિજય મહારાજ આપણાને સમવસરણમાં લઈ જાય છે. સમવસરણાની યાત્રા ઘણા સ્તવનકારોએ કરાવી છે. પણ આ યાત્રા બિલકુલ નોંધી ભાત પાડી જાય છે.

બીજા સ્તવનકારોની એ યાત્રાઓમાં આપણે શ્રોતા બની પરમાત્માની દેશનાનું શ્રવણ સુખ માણી રહ્યા હોઈએ છીએ. દીપવિજય મહારાજ નવીનતા એ ઉમેરે છે કે આપણે પરમાત્માની વાણી સાંભળી રહ્યા છીએ અને આપણી બાજુમાંય પરમાત્મા (તે વખતની દણિએ ભવિષ્યના) બેઠા છે.

અંખો બંધ કરી આ સુખદ અનુભૂતિમાં છલાંગવું ગમશે. અંતર એકદમ ઓગળી જાય છે. દેશના આપતા પરમાત્મા તો બહુ મહાન કહેવાય.. આપણે એક નાદાન સેવક. પણ આ બાજુમાં બેઠા છે એ તો..?

અને તે વખતે જે બાજુમાં બેઠા'તા તે જ આજે સામે બેઠા છે.
હવે શો વાંધો?

• • •

આ આધાર શિલા પર ખરેખર અબોલડાં લે તો ભક્ત લે. હું લઉં.
તમે શી રીતે લઈ શકો, ભગવાન?

અનંતા જન્મોનાં આપણાં સ્નેહને વિસારી તમે એકલા એકલા, ચૂપકે
ચૂપકે, મોક્ષમાં જતા રહ્યા - મને અહીં રડતો મૂકીને. 'કાળ અનંતનો
સ્નેહ વિસારી, કામ કીધાં મનગમતાં...' એટલે પ્રભુ ! ખરેખર 'કિંદ્રા'
કરવાનો અધિકાર તો મને છે કે મને મૂકીને તમે કેમ ચાલ્યા ગયા, કે
મારી સાર તમે કેમ નથી કરતા. અને બદલે, આ તો ઊંધી વહી ગંગાઃ
તમે મારી સાથે ન બોલવાનું પણ લીધું.

કેમ આમ?

• • •

સમવસરણમાં જે પાસે બેઠા'તા. એ દેવશાયામાંય બાજુમાં હતા.
દેવતાઈ નૃત્ય દેખવામાં અને દિવ્ય સંગીત સાંભળવામાંય સાથે હતા.
'એકણ પાસે દેવ શાયામાં, થેઈ થેઈ નાટક સૂણતાં, તિહાં પણ તમે અને
અમે બેઉ સાથે, જિન જન્મ મહોત્સવ કરતા...'

માત્ર નૃત્ય જોવામાં જ નહિ, જિનેશ્વર દેવોના જન્મ મહોત્સવમાંય
આપણે સાથે હતા, ભગવાન !

આજે કેમ આ સથવારો છોડી દીધો ?

• • •

સથવારો છોડ્યો તો છોડ્યો, હવે કદી મારી ભાળ પણ ન લો.
બોલાવીએ તો ઉત્તર પણ ન આપો....

સિદ્ધર્થિજી પૂછે છે : શું મારા માટે કોઈ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે? કે બધાને તમે પ્રત્યુત્તર આપો અને મને જ ન આપો !

હા, મારી ખામી જરૂર છે. પણ એટલે તો મેં કહ્યું કે આખરે નનો તો ભણો ! ભક્તિ જ્યારે ખરેખર નીખરશે ત્યારે તો તમારે હા પાડવી જ પડવાની છે ને !

આંસૂની ધારાથી મારે પ્રેમની/ભક્તિની આ વેલડી વિકસાવવાની છે. એને વિકસાવવાનો બીજો કોઈ માર્ગ નથી..

આંસૂ થોડા ઓછા પડે છે માટે જ તો વિરહીની ભૂમિકામાં વારંવાર જઈ પડું છું ને ! - પૂરવઠો બરોબર થઈ જાય !



આરુદમિયતીં કોટિં
તવ કિઙ્કરતાં ગતમ્ ।
મામણેતેજનુધાવન્તિ
કિમદ્યાપિ પરિષહા: ॥ ૨૭ ॥

પરિપાક ભવ્યત્વનો થાય જયારે,
ચે ભૂમિકા આટલી સહજ ત્યારે;
પ્રભો! આપનો દાસ છું તો ય મારી,
પડ્યા કેમ પૂંઠે પરિષહ અપારી.

હે લગવન્! આટલી ભૂમિકા સુધી હું પહોંચો
ને આપનો સેવક બન્યો. છતાં હજુ પણ આ
પરિષહો મારી પાછળ કેમ પડ્યા છે? આપે
તો તેને મારીને જેર કરી નાખ્યાં છે. છતાં તે
મને કેમ સતાવે છે?

કિંચ્ચામી પ્રણતાશોષ-
 જનવીર્યવિધાયક!
 ઉપ્સર્ગ ભમાદ્યાપિ
 પ્રિષ્ઠિં મુચ્છન્તિ નો ખલા: ॥ ૨૮ ॥

ત્રિધા ભક્તિથી આપને શીષ નામે,
 અહો વીર્ય તેનું પરિણામ પામે;
 મને તોય શાને સતાવે નઠારી,
 ઉપાધિ બધી પૂંઠ છોડે ન મારી.

હે પરમાત્મન! આપને જેઓ નમે છે, તેનામાં
 આપ અપૂર્વ વીર્ય પૂરો છો, હું પણ આપને
 ભાવપૂર્વક નસું છું, ઇતાં આ દુષ્ટ ઉપ્સર્ગો હજ
 મારી પાછળ કેમ પડ્યા છે મારાથી એ ડરતા
 નથી. હું નિર્બળ કેમ છું? એ મારાથી દૂર થાય
 એવું કાંઈક કરો.

કુતીની એક વિષ્યાત પ્રાર્થનામાં એણીએ પરમાત્મા પાસે દુખો માગ્યા છે. ભક્ત દુખ એટલા માટે માગે છે કે એથી પોતાની ભૂમિકા ચકાસી શકાય. ભક્તિના સઘન માર્ગ ભક્તનો પગ ઉપરે છે ત્યારે એને બીજાં બધાં જ દુખો નગણ્ય લાગે છે. દુખ દુખરૂપ લાગતાં જ નથી. દુખ રહે છે માત્ર એક: પરમાત્મા ન મળ્યાનું. વિરહના ઊંડા દુખમાં બધાં દુખોનો છે ઊડી જાય છે. એના ગાઢ રંગમાં બીજા રંગો ભણી જાય છે.

દુખ ઘણાં.... પણ એ બધાં જ તમે ન મળ્યા હોવાનાં કારણો સર્જાયેલાં. વિરહનું દુખ તો હોયજ. એમાં ઈર્ધા ભેગી ભણે. ‘બીજાને તમે દર્શન આપ્યું, ને મને કેમ નહિ?’ રીસ ઈર્ધાની આગને વધુ ઉગ્ર-બહારથી ઠંડી પણ ભીતરથી ધધકતી બનાવે. કેટકેટલાં દુખ હું પામ્યો, પ્રભુ! તમારા વિના...

તમે મળો છો, ને બધાં દુખ છૂ થઈ જાય છે! મેઘઘટા વિના અકળાતો મોહ ઉપર જામેલ વાદળાઓના સમૂહને જોતાં જ કેવો નાચી ઊઠે છે ! હું તમને જોતાં જ કેવો નાચી ઊઠું છું? તમને ન જોતાં અકળાઈ ઊઠું છું. મારા હોવા-ન હોવાનું, મારા ઝીલવા-ખરવાનું તમારા પર નિર્ભર છે, પ્રભુ! મારા ચિત્તાકાશમાં તમે હો છો ને હું પ્રસત્ત થઈ ઊઠું છું...

‘કિમદ્યાપિ પરિષહા:’ ? દુખો મારી પાછળ કેમ દોડે, પ્રભુ! તમારા અદર્શનનું દુખ જો મારી પાસે હોય તો એમાં બધી જ વેદના સંકાન્ત

થયેલી/ ઓગળી ગયેલ હોય... તો પરિષહો કેમ? વેદનાઓ કેમ? દુખો કેમ? (પ્રશ્ન બહુવચનનો છે, મારા નાથ!)

પ્રશ્નચિહ્ન ખરેખર બહુ જ ચુભનારું છે. તમે મારા નાથ, હું તમારો સેવક.. 'તવ કિઙ્કરતાં ગતમ.' આટલી ઊંચી પદવી પામ્યો હું... પણ હવે આ વેદનાઓની ઝડી કેમ?

'આરૂઢમિયતી કોટિમ' નો યશોવિજયીય અનુવાદ મને ગમશે: 'ઈતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો.' તમે જ મને આ પદ સુધી લઈ આવ્યા. બાકી મારી તો કઈ તાકાત હતી ?

એક વાત પૂછું, મારા નાથ! નરક અને નિગોદના દુખોમાંથી તમે મને અહીં સુધી ઊચકીને લાવ્યા. એ વખતે હું કેવો તો અસહાય હતો ! તમને પોકારી શકું એવી સુધ-બુધ પણ ક્યાં હતી? છતાં તમે મને ઊચક્યો. અહીં સુધી લઈને આવ્યા. તો હવે તમારી એ કરુણાનું મને દર્શન કાં ન થાય ?

કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય યાદ આવે: 'ભવત્રસાદેનૈવાહમિયતીં
પ્રાપિતો ભુવમ્; ઔદાસીન્યેન નેદાનીં તવ યુક્તમુપેક્ષિતુમ'. (વીતરાગસ્તોત્ર.)
તમારી કૃપાથી અહીં સુધી આવ્યો.. ને હવે તમે ઉદાસીન બની જાવ! શી
રીતે હું સહન કરી શકું આ ઉદાસીનતા, તમારી આ ઉપેક્ષા ?

આખી દુનિયાની ઉપેક્ષા હું સહી લઈશ, મારા નાથ! તું મને તારાથી
સહેજ પણ અળગો ન રાખ!

હું રાણકપુર ગયેલો. ત્યાં પૂજારીએ મને જિનાલયના સ્વપ્રશિલ્પી
ધરણાશાની નાનકડી મૂર્તિ બતાવી. થાંભલાની ટોચ પર ગોઠવાયેલી નાની
સી પ્રતિકૃતિ... પણ એ નાની મૂર્તિની સ્થાપનાની પાછળનો ઈતિહાસ મેં
જાણ્યો ત્યારે.... તને તો બધો ખ્યાલ જ છે કે મારી એ વખતે કેવી
હાલત થયેલી ?

પૂજારીએ ઈતિહાસ વર્ણવતાં કહ્યું: મંદિર નિર્માણના અન્તિમ તબક્કામાં હતું. ત્યારે એક દિવસ સ્થપતિની સાથે ધરણા શા પ્રદક્ષિણાપથમાં ધૂમતા હતા. અચાનક શ્રેષ્ઠીએ સ્થપતિને કહ્યું: મારી એક નાની પ્રતિકૃતિ પ્રભુના દરબારમાં હોય તો....! સ્થપતિએ ખુશીથી માથું હલાવ્યું. ધરણા શા ઉમેરે છે: મારી પ્રતિકૃતિ એ રીતે ગોઠવાવી જોઈએ કે લોકોની નજર એના પર ન પડે, ને પ્રભુની દણિ ચોવીશ કલાક એના પર વરસ્યા કરે....

ઈતિહાસ સાંભળ્યા પછી ફરીથી મેં ઊચે જોયું. ખરેખર, એ પ્રતિકૃતિ પર પ્રભુની દણિ પડ્યા જ કરતી'તી.... હું ઢગલો થઈને બેસી ગયો ત્યાં, પૂજારી બીજા કામે ગયો હશે. હું ધૂસકે ધૂસકે રડી પડ્યો'તો....

તને યાદ છે ને બધું?

મેં તને એ વખતે કહેલું કે પ્રભુ! ધરણાશાને તમે આ રીતે દર્શન આપો એની ઈર્ધા હું ન કરી શકું. પણ થોડું તો અમને ય આપો! મીરાં યાદ આવી ગયેલી: 'પ્રભુ! આમ છેટા છેટા ના રહીએ, કોક દિ તો ભક્તોના થોડા થઈએ...''

ધરણાશા ચોવીશ કલાક તમને જોઈ શકે... ને તમે પણ એ ઘારા ભક્તને સતત નીહાળ્યા કરો.. ને મારી વખતે આખું કોણક જુદું! ફરી મીરાંને યાદ કરેલી :

'નયણાં દીધાં પણ દરિસન ન દીધું,
જિયેરે ગગન જઈ બેસણું રે કીધું...''



पश्यन्पि जगत् सर्वं
 नाथ! मां पुत्रः स्थितम् ।
 कषायाराति-वर्णै
 किं न पश्यसि पीडितम् ॥ २९ ॥

કષાયો મને કષ આપે રૂલાવે,
 પ્રભો! દષ્ટિ તારી પડે એ ન ફાવે;
 અહો! સર્વ સંસાર છે સ્પષ્ટ તારે,
 સમીપે રહ્યો છું, મને શું વિસારે?

હે પ્રભો! આ કષાય શત્રુઓ એકઠા મળીને
 મને પીડે છે. આપ સમસ્ત વિશ્વને જોઈ રહ્યા
 છો, આપની આગળ જ હું રહ્યો છું, મને આપ
 કેમ જોતા નથી? આપની દષ્ટિ પડે એટલી જ
 વાર છે. પછી આ શત્રુમાંથી એક ઉભો રહેશે
 નહિ. આપ નજર કરો.

કષાયાભિદુતં ચીક્ષય
માં હિ કારુળિકસ્ય તે।
વિમોચને સમર્થસ્ય
નોપેક્ષા નાથ! યુજ્યતે ॥ ૩૦ ॥

દ્યાના પ્રભુ પુણ્ય ભંડાર પૂરા,
સકલ વિશ્વને તારવા શકત શૂરા;
તથાપિ કખાયો મને કેમ પીલે,
હજુ ઢીલ શાને કરો મધ્ય ચીલે.

હે કરુણાળુ પરમાત્મન્! કખાયોથી પીડાતો હું
છું, આપ તેનાં સકંજામાંથી મને છોડાવવા માટે
સમર્થ છો. છતાં નાથ! આપ ઉપેક્ષા શા માટે
કરો છો, વિલંબ કેમ કરો છો? આ ઠીક થતું
નથી. આપનો હું છું છતાં આપ મને ન બચાવો
એ યોગ્ય નથી.

પૂરા જગતને તમે જોઈ રહ્યા છો, તમારા જ્ઞાનથી.. બધું આપ જોઈ શકો છો તો મારી વેદનાને આપ કેમ નથી જોતા? કેટલી તીવ્રતર વેદના છે મારી? એક તો અદર્શનાની વેદના અને ઉપરથી ઘા પર મીઠાની જેમ આપની આ ઉપેક્ષા.. હું તો સીધું કહીશ કે, આપનું દર્શન ન થવામાં કારણભૂત આપની મારા પરની આ ઉપેક્ષા જ છે.

આપની જો મારા પર અમીદાદિ હોત તો આ વિષયો ને કખાયો મને હેરાન કરી શકત? જરાય નહિ. તમે મને રક્ષણ આપ્યું છે, હું તમારી કૃપાવર્ધાના ક્ષેત્રમાં છું એવો ઘ્યાલ હોય તોય પેલા દુશ્મનો તંબૂ છોડી ભાગી જાય. તમારી કરુણાદૃષ્ટિ મારા પર પડે એટલે બસ. બેડો પાર. !

કરણા એટલા માટે કરજો કે, હું તમારા વિના ઝૂરી રહ્યો છું.
કપાયો અને વિપયોથી પીડાતા હોવાનું દુખ તમારાથી વિખુટા હોવાના /
તમારી કૃપાધારાથી વિખુટા હોવાના સંદર્ભમાં જ મને સાલી રહ્યું છે.

• • •

રામવિજય મહારાજ કરુણા કટાકણી વાતને વિરહવ્યથા સાથે સાંકળતાં મહામહિમ શ્રી ચન્દ્ર પ્રભુ ભગવાનના સ્તવનમાં કહે છે: ‘વિરહ વેદના આકરી, કહી પાઠવું કુણ સાથ ? પંથી તો આવે નહિ, ઈણું મારરો જગનાથ..’

બહુ તીવ્ર છે આ વિરહની વેદના. પણ હું આપને એ શી રોતે
જણાવું?"

એક તો વિરહની આ વેદના. અને બીજુ બાજુ તમને એ જણાવી શકવાનો કોઈ માર્ગ નથી. ‘પંથી તો આવે નહિ.’ કોઈ સંદેશવાહક તો ત્યાં આવતો નથી. અને જે ત્યાં આવે છે એ ત્યાંજ રહી જાય છે. ‘ઈહાંથી તિહાં જઈ કોઈ આવે નહિ..’

શી રીતે જણાવું મારી વેદના, દેવ ?

એક જ રસ્તો છે, સિદ્ધાર્થજી કહી રહ્યા છે તે : ‘પશ્યત્તાપિ જગત् સર્વમ्..’ તમે મારી વેદનાને પ્રીઠો, દેવ! ‘અંતર્યામી સવિ લહો, અમ મનની જે છે વાત હો..’

મારી વેદનાને તમે નહિ પ્રીઠો તો કોણ જોશો ? તમારી કરુણાધનતાને હું તો એકજ સંદર્ભમાં જોઈ શકું કે તમે મારા પર કેટલી કરુણા વરસાવો છો? ઘણા બધા પર તમે કરુણા વરસાવી છે.. પણ એ વાત સાંભળ્યા પછી તો વેદના વધી છે..

સુલસાની જાણીતી પેલી ઘટના તે દિવસે સાંભળેલી ત્યારે કેવી હાલત મારી થયેલી ?

તમે સુલસાને યાદ કરીને ‘ધર્મ-લાભ’ પાડવો! તમે રેવતીને આંગણે સિંહ અણગાર ને મોકલો તમારા માટે ઔષધિપાક લેવા.. હવે કહો મારા નાથ! તમે મને ક્યારે યાદ કરેલો ?

ચાલો, તમે ન આવી શકો તો કાંઈ નહિ. તમારા પ્રતિનિધિને તમે મોકલેલો, સંદેશો લઈને ?

કૃષ્ણ મથુરામાં વ્યસ્ત હતા તો એમણે ઉદ્ધવને વૃન્દાવન મોકલ્યા. પહેલાં તો રથને જોઈને ગોપીઓ રાજુ રાજુ થઈ ગઈ કે ચાલો, કૃષ્ણ આવ્યા! પણ પછી ખબર પડી કે ઉદ્ધવ આવ્યા છે..

ગોપીઓ ઉદ્ધવને કહે છે: ‘ઉધૌ ! હમ આજુ ભયે બડભાગી, જિન આંખિન તુમ શ્યામ વિલોકે, તે અંખિયા હમ લાગી..’ ઉદ્ધવ ! અમે

આજે બડભાગી છીએ. તમે હમણાં જ શ્રીકૃષ્ણને જોઈને આવ્યા છો. અમે તમારી આંખોમાં તેમના પ્રતિબિંબને જોઈને ધન્ય બન્યાં.

તમે આવો કોઈ સંદેશવાહક પણ ન મોકલ્યો...?

ઓહ્! હું ભૂલી ગયો. ગુરુદેવને તમે જ મોકલેલા. ને એમની આંખોમાં તમારી છબી જોઈને તો હું તમારી ભક્તિની ધારામાં મહાલવા માંડેલો.

તમે આચારાંગ સૂત્રમાં ‘તદ્વિકીએ’ બનવાનું આટલા માટે તો મને સૂચવ્યું છે ને ! હું ગુરુની આંખોમાં આંખો પરોવું, ને તમને નીહાળું...

આચારાંગ સૂત્ર વાંચતાં તો હું કેટલી વાર રડ્યો છું.. ઘણીવાર મને લાગ્યું છે કે આ પવિત્ર સૂત્રની રણજણાવતી પંક્તિઓ આપે મારા માટે જ લખી છે. ‘સ્પેસ્યલી ફોર મી.’ પેલું સૂત્ર વાંચતાં તો હું કેટલું રડેલો આપને ઘ્યાલ જ છે ને ? ‘અણાણાએ એગે સોવકૃણા, આણાએ એગે નિરુવકૃણા, એતં તે મા હોતુ...’ તને આવું ન હો ! કો’ક ભલે અનાજ્ઞામાં ઉધમશીલ હોય કે ભલે બીજા કોઈ આજ્ઞાપર્મંમાં નિરુત્સાહી હોય; તને આવું ન હો ! કારણ કે... તું મારો પ્રીતિપાત્ર છે. તું વિશિષ્ટ છે. કેટલા હર્થાશ્રૂ નાનકડી આંખોમાં એ વખતે ઉમટેલા ! પ્રભુ મને / મારી ભક્તિને આ રીતે પ્રમાણિત કરે ? ન ભક્તિની સૂજા... ન કંઈ સમજ. માત્ર આપને જોઉં ને હરખાઈ ઉઠું. આટલી મારી નાનકડી લાયકાત પર પ્રભુની આવડી મોટી પ્રસાદી ! પ્રભુ ! તારા આ ઋણમાંથી મુક્ત કર્યારે બનીશ ?

મારી સજ્જતા... મીરાંની મૂંજવણ મારી મૂંજવણ છે. ‘આણિગમ તો મારગ નવિ સૂજે, પેલી ગમ તો બળી મરીએ; કહો ને ઓધાજી ! કહાં જઈએ?’ ઉદ્ઘવને પૂછે છે મીરાં કે પોતે શું કરે ? પરમાત્માની બાજુ માર્ગ સૂજતો નથી. ને સંસારમાં તો રહેવાય એવું નથી.. બહુ મજાની વાત એ છે કે પરમાત્માની બાજુને મીરાં આ બાજુ કહે છે, સંસારની બાજુને પેલી બાજુ કહે છે.

મારી નાની સી સજજતા.. તારો માર્ગ ગમે છે. ને આ નાનકડી સજજતાની પૃષ્ઠભૂ પર તારું આવું મોટું વરદાન! તું કહે કે ‘એતં તે મા હોતું...’ તને આવું ન હો! પ્રભુ! કેટલી મોટી આ વર્ષા મુજ દરિદ્ર પર તારી.

આ સૂત્ર સાંભળતાં મને કેવી ભાવાનુભૂતિ થયેલી એની વાત કરું? આ સૂત્ર સાંભળ્યું.. આંખોમાંથી હર્ષાશ્રૂની વર્ષા, ગળે રૂમો... શરીરે રોમાંચ... પાછળથી મને લાગેલું કે મેં શબ્દ-સ્પર્શ તમારો એ વખતે અનુભવ્યો હતો. પૂ. પદ્મવિજયમહારાજની પેલી પંક્તિ તે વખતે સાકાર બની ઉઠેલી: ‘નિજ કર પીઠ થપેટીએ..’ તમારો હાથ મારી પીઠ પર ફરતો મેં એ સમયે અનુભવેલો...

અને, તમારા શબ્દ-સ્પર્શની વાત કરું તો માત્ર પીઠ પર જ નહિ, ગાલ પર પણ તમારા હાથની ચમચમતી તમાચ ખાધેલી છે! ‘એત્ય અગુજે અણાણાએ’... જેવું સૂત્ર પરમપાવન આચારાંગનું વાંચ્યું ત્યારે પૂરું અસ્તિત્વ કંપી ઉઠેલું.. ‘ગુમિ-બાધ તો હું તમારી આજ્ઞામાં નહિ’.... આ સાંભળી કેવું ધૂસકે ધૂસકે હું રહેલો? મીરાંની પંક્તિ યાદ આવેલી: ‘રાજા રૂઠે નગરી રાખે, હરિ રૂઠે કહાં જાણા?’ રાજા ગુસ્સે થયેલ હોય તોય કોય નાગરિક પોતાના ઘરે ભોંયરામાં પેલાને છૂપાવી શકે. પણ પ્રભુનો નિગ્રહ તો કેમ સહી શકાય?

મારા એ વખતના આંસૂ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યનું વીતરાગ સ્તોત્ર વાંચતાં લૂધાયેલાં. (તમે જ એ પુસ્તક એ વખતે વાંચવાં સૂચવ્યું એટલે તમે જ એ આંસૂ લૂધયા એમ કહું ને! શરૂઆતમાં મેં આપને પૂછ્યું હતું: ‘અમારી આંખના આંસૂ પ્રભુ! તમે લૂધશો ક્યારે?’ આજે થાય છે કે તમે તો શાન્તવના અમારા પર સતત પાઠવી રહ્યા છો.)

વીતરાગ સ્તોત્રમાં વાંચ્યું : અનાહૂત સહાયસ્ત્વમુ, ત્વમકારણવત્સલઃ...’ અમે કંકોતરી ન પાઠવીએ તોય તમે આવીને અમને સહાય, હુંફ આપ્યા કરો છો. એવી હુંફ જેના વિના જીવન મરુસ્થળમાં ફેરવાઈ જાય. ‘અકારણવત્સલ’ તમે...

ખરેખર નથી સમજતું કે આવી વાત્સલ્યની ઝડી તમે મારા પર વરસાવો.... કઈ રીતે ? કોઈ સમીકરણ અહીં લાગુ નથી પડી શકતું. ને એટલેજ હેમચંદ્રાચાર્ય મહારાજને કહેવું પડયું: વાત્સલ્ય ભરપૂર છે તારું મારા પર, પણ કોઈ કારણ મને દેખાતું નથી. ખરેખર, તારી લીલાનો પાર અમે કેમ પામી શકીએ ?

લીલી કુંજાર જાડીથી, હરિયાળા ઘાસથી સોહુતું મેદાન હોય ને વરસાદ તૂટી પડે: સમજ શકાય. ભીનાશે મેઘને વરસવા માટે મજબૂર કર્યો.. પણ મરુભૂમિમાં સહરાના રણમાં આટલી ઝડી..! કયું ગણિત અહીં કામમાં આવી શકે ? સુરેશ દલાલ યાદ આવે: “પ્રેમને, ભજિતને ગણિત સાથે નહિ, અગણિત સાથે સંબંધ છે. તમે પ્રિય વ્યક્તિ સાથે ચાલો છો ત્યારે મસ્તી જ એટલી હોય છે કે તમે કેટલાં પગલાં એની સાથે ચાલ્યા એ ગણી ન શકાય.” (‘જલક પ્રયાગ.’)

‘અનાહૂત-સહાય: ત્વમ્.’ વાંચતાં કેવી ભાવાનુભૂતિ થયેલી એની વાત કરું? આંસૂ લૂછાઈ ગયા. સેંકડો-હજારો આમંત્રણ-પત્રો પાઠવીએ તોય જેમનું આગમન શક્ય ન બને એવા તમે હું ન બોલાવું તોય હાજર થઈ જાવ !

જો કે મારી તત્કાલીન ભૂમિકામાં એ જરૂરી હતું. હું એવો તો અસહાય અને નરકની યાતનાઓથી ગ્રસ્ત હતો કે તમને પુકારવાની સુધ પણ મને ન હતી. અને તમે આવ્યા.. તમારી કરુણા મને માનવ્યના ને સાધનાના દ્વાર સુધી લઈ આવી.

કેટલી મોટી હુંક મળે છે મને !

તમારી આ કરુણા....

● ● ●

ક્ષારેક વીમાસણમાં પડી જાઉ છું. કપાયાંજિનથી હું બળતો હોઉં ત્યારે તમારા તરફથી શીતળ જળનો છંટકાવ કેમ ન થાય? ‘કપાયારાતિવર્ગણા...’ મારા પર કરુણા વરસાવો !

વાહ ! આ બાજુ મારી પ્રાર્થના ને આ બાજુ તમારો જવાબ.....
 કેટલી ઝડપથી આપ અમને પ્રતિભાવ આપો છો! મુંજવણમાં, પ્રાર્થનાના
 લયમાં મારી પાસે પડેલ સ્તવનાની પુસ્તિકાના પાનાં આમ તેમ ઉથલાવતો
 હતો ને તમારો જવાબ મળી ગયો: ‘વિપય લગન કી અગન બૂજાવત,
 તુમ ગુણ અનુભવ ધારા, ભઈ મગનતા તુમ ગુણ રસ કી, કુણ કંચન
 કુણ દારા ?’

(શીતલ જિન સ્તવન: મહો.યશો વિજયજી.)

ગુણાનુભૂતિ શીતળ જળની તમારા તરફથી થયેલી વર્ષા છે; જે
 અમારા વિષયાંગ્રિ અને કષાયાંગ્રિને બૂજાવી દે છે.

ગુણોની અનુભૂતિને માણવી કઈ રીતે? જ્ઞાનસારે એનો માર્ગ બતાવ્યો.
 ‘આત્માત્મન્યેવ યચ્છુદ્ધ જ્ઞાનાત્યાત્માનમાત્મના..’ સાધક પોતાના ગુણને
 સ્પર્શો. કઈ રીતે સ્પર્શો? ‘આત્મના.’ સ્વાધ્યાય વડે. કેવી ભૂમિકા પરનો
 સ્વાધ્યાય ? ‘આત્મનિ.’ અન્ત: પ્રવેશની ભૂમિકા પરનો.

સ્તોત્રથી લય સુધી જવાનો કમ મને અહીં યાદ આવ્યો. મને લાગ્યું
 કે તમે તો મારા પર વરસી જ રહ્યા છો. એક કરી હું ગુનગુનાવું
 (સ્તોત્ર), એને દોહરાવું (જપ), તેના પર અનુધ્યાન કરું (ધ્યાન) અને
 એ ગુણને સ્પર્શું (લય).

તમે ક્યાં મારાથી દૂર છો, મારા નાથ ? ‘જ્યોત સું જ્યોત મિલત
 જબ ધ્યાવત, હોવત નહિં તબ ન્યારા....’ પંક્તિએ તમારા અભેદ મિલનનો
 કુવો સરસ માર્ગ બતાવી દીધો.

તમે જ્યોતિર્મય... તમારું ધ્યાન મારે કરવું છે. શી રીતે હું કરું ?
 આંશિક રૂપે પણ જ્યોતિર્મય બની હું તમારું ધ્યાન કરી શકું.

તમે અનંત જ્ઞાનમય... તમારા આ ગુણ ને મારે સ્પર્શવો છે. તારી
 કરુણા મને મળે..... કદાચ મારા માટે આ પ્રથમ અનુભવ છે તમારા
 સ્પર્શનો, તમારા ગુણ-સ્પર્શનો.

કવિ ઉશનસ્ યાદ આવે :

‘જે દિન મારી આંખોમાં તારે કારણ પ્રગટ્યો ઘાર,
નામ તિહારે પ્રેમ પ્રભુ! મેં પ્રીછ્યો અપરંપાર
તત્કષ્ણ જાહુ ભયોરી,
ઓર ન છોર ન મજધાર,
તળ તળાવનું તડાક તુટી, પ્રગટ્યું રે પાતાળ,
એ પૂર્વ મેં કદી ન મુજને દીઠો આમ વિશાળ.....

આવો પ્રચંડ અનુભવ.....આજે એ ક્ષણોને યાદ કરવી બહુ ગમે છે. હું શારીરિક વેદનાથી ગ્રસ્ત હતો. વેદનાને ક્યારેક સહેતો'તો ક્યારેક માણાતો'તો, પણ મારે એને માત્ર જાણવી હતી. કિનારે ઊભેલ માણસ સમુક્રનાં મોજાંને જુએ એમ માત્ર જાણવી હતી શરીરની હલચલ મારે. એ ક્ષણ ઊતરી આવી. ગહન ઉદાસીનતા. શરીર સાથેની દૂરી.....વેદનાને માત્ર જોવાનું થયા કર્યું.....વસ્ત્રની જેમ શરીર ખરી પડ્યું, હું માત્ર એને જોવા કરતો હોઉં. માત્ર દ્રષ્ટાભાવ, માત્ર જાણંગભાવ.....એક નાનકડી બારી ખૂલ્લી. મેં તારા ગુણનો સ્પર્શ કર્યો, દેવ! ન્યાલ બની ગયો'તો હું તો.

એ વખતે તો અનુભોક્તા લગભગ રૂભી ગયો હતો.....રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે: મીઠાની પૂતળી દરિયામાં પડી, દરિયાની ઊંડાઈ માપવા.....ગઈ તે ગઈ.....શું બહાર આવે? આ વાંચતાં અત્યારે મને વેદનાની ટીસ ઉપડે છે. તારી સાથે હોવાના સુખમાંથી તેં મને બહાર કેમ કાઢ્યો, પ્રભુ?

મને તમારાથી એક ક્ષણ પણ વિખૂટો ન રાખો, દેવ! તમને નહોતો મળ્યો ત્યાં સુધીની વાત જુદી હતી. આજે.....શું કહું? ‘મિલિયા ગુણ કલિયા પછી રે લાલ, બિછુરત જાયે પ્રાણ રે!’

(શ્રી કુંયુજિન સત્વન: મહો.માન વિજયજી)

તમારી કૃપાધારાનું સતત મારા પર વહેવું જરૂરી છે, નાથ! અને એમાંય વિભાવો મારા પર તૂટી પડે ત્યારે તો તમારું પાકું રક્ષાકવચ મને જોઈએ, એટલે જ ક્યારેક અધૈર્ય છલકાઈ ઉઠે: આખા જગતને દેવ જુઓ છે, તો મને શું નથી જોતા? ‘પુરતઃ સ્થિતમ्..’ હું તો તમારી આગળ ઉભો છું, દેવ! તમને દૃષ્ટિપથમાં સતત રાખીને વિચર્યા કરું છું.....

મને તમે જુઓ છો તો પછી આ કખાયોની કે વિધયોની શી તાકાત? 'નોપેક્ષા નાથ! યુજ્યતે.' દેવ! સમજું છું કે તમે ઉદાસીન ભાવમાં આરૂઢ છો. તમારી એ ઉદાસીનતાને આછી આછી સમજયો પણ છું. પણ તમારી મારા પ્રત્યેની ઉદાસીનતા.....ઉપેક્ષા.....મને લાગે છે કે અહીં કોઈક વચ્ચલો રસ્તો હોવો જોઈએ.

અચ્છા, એ મને શું ખબર પડે કે વચ્ચેલો રસ્તો કેવો હોય? એ
આપે નક્કી કરવાનું.....ને મને પૂછશો તો હું તો કહીશ કે મારા પર
તમે વરસી રહો સતત.....ના, હું જ માત્ર કહું છું તેમ નથી. કલિકાલ
સર્વજ્ઞ હેમચન્દ્ર સૂરી મહારાજે પણ આ જ વાત કહી છે ને! કેટલા
સરસ એમના શબ્દો છે: હું તમારી ભક્તિ કરું, ને એના અનુપાતમાં
તમે મારા પર રીજો; ફરી તમારી કૃપાને પામી પ્રોત્સાહિત થઈ ભક્તિમાર્ગે
એક બે ડગલાં ભરું ને તમે મારા પર એના પ્રમાણમાં જ કૃપા વરસાવો
તો કેમ ચાલે, પ્રભુ? હું ભક્તિ કરી કરીને કેટલી કરવાનો? પૂજ્ય માન
વિજય મહોપાધ્યાય જેવા ભક્તિયોગાચાર્ય હાથ ધોઈ નાખે છે કે, ‘કયું
કર ભક્તિ કરું પ્રભુ, તેરી?’ ત્યારે હું તમારી ભક્તિ શી રીતે કરવાનો?

કલિકાલસર્વજો કહેલ શોર્ટકટ મને પણ ઠીક લાગે છે.....
 ‘મત્ત્રસત્તેસ્ત્વત્ત્રસાદસ્ત્વત્ત્રસાદાદિયં પુનઃ, ઈત્યન્યોન્યાશ્રયં ભિન્ધિ પ્રસીદ
 પરમેશ્વર!’ તમે મારી ભક્તિ સામું ન જુઓ, વરસી જ પડો.

ચાલો, એમ ન કરો તો આવું કરો, શરૂઆત આપ કરો.....હું ભક્તિ કરું ને તેના પ્રમાણમાં આપ કૃપા વરસાવો એમ નહિ, પહેલાં આપ કૃપા વરસાવો. પછી જુઓ હું કેવો ઉછળીને ભક્તિ કરું છું !

એટલે જ કહું છું : ‘નોપેક્ષા નાથ! યુજ્યતે...’ હું કખાયાગ્રિમાં ધૂંધવાતો હોઉં ત્યારેય તું મારી ભક્તિની અપેક્ષા રાખે એ કેમ ચાલે? એ સમયે તો તારે વરસી જ પડવું જોઈએ. ને તારી એ ઠંડી ઠંડી કૃપાધારા મળે ત્યારે.....! કેવો હું રાજીનો રેડ થઈ જાઉં.

હું એમ કહેવા માગું છું કે ‘વિષય લગન કી અગન બૂજાવત, તુમ ગુણ અનુભવ ધારા’ ને એક નવા આયામમાં આપ મારા માટે કેમ ન મૂકો? જ્ઞાનસારે ચીધેલા માર્ગ અન્ત:પ્રવેશની ભૂમિકા પર ખડો થઈ સ્વાધ્યાયમાં રૂબું ત્યારે તો તારી કૃપાધારા મળે જ. ત્યારે તારા ગુણાનો સ્પર્શ થાય જ.....ને એ ક્ષમા ગુણાનો સ્પર્શ થાય એટલે કોધ છૂ! પણ આ તો મારા તરફથી થયેલ શરૂઆત હતી. ચાલો, એમ પણ હું કરીશ. પણ હું કોધમાં ધમધમતો હોઉં, સ્વાધ્યાયવાળી વાત પલ્લે પડે તેમ ન હોય ત્યારે તમે મારા દ્વારે ટકોરો ન મારો ? અંદર પ્રવેશી ન જાવ ?

આવો અનુભવ થાય પણ છે. ક્યારેક કખાયમાં પ્રવેશી ગયો હોઉં ને ગુરુદેવ ચહેરા પર સ્મિત લાવી મીઠા અવાજે મને સંબોધે.....પેલા કીચડમાંથી બહાર લાવે.....ત્યારે પ્રભુ! તારી કરુણાનો ગુરુદેવ દ્વારા સ્પર્શ થતાં કેટલો તો હું ઉછણું છું !

હું એક જ વાત તને પૂછું : તારી કરુણાનો સ્પર્શ જ્યારે જ્યારે થયો-સાક્ષાત્ તારા દ્વારા, તારાં વચ્ચનો દ્વારા કે તારા પ્રતિનિષિ જેવા ગુરુઓ દ્વારા- ત્યારે ત્યારે હું ઉછણ્યો નથી ? ભાવાવેશમાં આવ્યો નથી ?

જો હા, તો આ જ મારી સજ્જતા નથી બની જતી કે મારું ભીતર તારી કરુણાથી એટલું સભર બની રહે કે એમાં પરનો પ્રવેશ અશક્ય બને ?

હું માત્ર તમારા સ્પર્શને નથી ઝંખતો, દેવ! કારણ કે એ તો તમે મને આપ્યો છે. હું તો ઝંખું છું કે મારી ભીતર તમારી કરુણા ધારા એવી ફેલાયેલી હોય કે એમાં બીજા કશાને પ્રવેશવાનો અવકાશ ન મળે.

જરૂર, મારી ખામીઓ મારી જાણ બહાર નથી. તમારું અપરૂપ રૂપ
મારી સામે હોય ને છતાં મારી આંખો બહાર ભટકતી હોય.....ચક્ષુને
બહાર સ્થાપીને હું પરને મારી ભીતર પ્રવેશવા આમંત્રં છું.....ને પછી
ચેતના પરમાં વ્યાપૃત બંની રહે ત્યારે તમે મને વિખૂટો પાડી દીધો એવી
ફરિયાદ કરું..... (હું તમારાથી છુંછો પડયો એમ નહિ કહું !)

પણ તમે જ કહો ને! બીજે હું ફરિયાદ કરું પણ ક્યાં? ભૂલ કરીશ
અથવા થઈ જશે.....પણ આખરે આવીશ તો તારી પાસે જ.

બાળક આઈસકેન્ડી ખાશો, એને શરદી થશો, એ ફરિયાદ કરશો. મા
આઈસકેન્ડી ખાવાની ના પાડશો. બાળક ફરી ખાશો. ફરી મમ્મી પાસે
આવશો. મમ્મી શું કરશો ? એને તિરસ્કારશો ઓછી? એમ હું તમારું કહું
ન કરું ત્યારે જ તો મને તકલીફ થવાની છે.....તમે એ વખતે મને
ઉવેખશો ? ‘નોપેક્ષા નાથ ! પુજ્યતે.....’



विलोकिते महाभाग !
त्वयि संसारतारके ।
आसितुं क्षणभयेकं
संसारे नास्ति मे रतिः ॥ ३१ ॥

महाभाग ! संसारथी तारनारा,
मर्या आप हुष्कर्मने वारनारा;
हવे ना गमे एक क्षण पश्चा रहेवुं,
अही आपने शुं वधारे कहेवुं ?

हे महाभाग ! भगवन् ! संसारथी पार
उतारनारा आपने जोया पछी एक क्षण पश्चा
संसारमां रहेवुं मने गमतुं नथी. छाया मर्या
पछी कोणा ऐवो मूर्ख होय के जेने तीव्र तापमां
गमे !

किन्तु किं करवाणीह-
नाथ! मामेष दारुणः ॥
आन्तरो रिपुसङ्घातः
प्रतिबधाति सत्वरम् ॥ ३२ ॥

પરंतु કરું શું કહો નાથ! મારા,
અરે દુષ્ટ આ શત્રુઓ છે અકારા,
બધું ધર્મ લૂંટી લે રોકી રાખે,
બચાવે મને કોણ અહે આપ પાખે.

પણ હે ગ્રભુ! હું શું કરું ? આ ભયંકર આંતરિક
શત્રુઓનો સમુદ્દર મને એકદમ અટકાવે છે
મને મોક્ષમાર્ગમાં આગળ વધવા દેતો નથી. મને
તેનાથી બચાવો.

વિધાય ભથિ કારુણ્ય-

તદેનં વિનિવારય ।

ઉદ્ઘામલીલયા નાથ !

યેનાગચ્છામિ તેજન્તિકે ॥ ૩૩ ॥

કરો ને કૃપા મમ વિષે ને નિવારો,
સકલ શત્રુને પામીને જેમ આરો;
તમારી લીલાનો નથી પાર સ્વામી,
મને લ્યો સમીપે પરમ ધર્મધામી.

હે નાથ ! મારા પર દ્યા કરો. આ અંદરના
શત્રુને દૂર કરો. આપને એ રમતની વાત છે.
એટલું થાય તો પછી મને આપની પાસે આવતા
જરા પણ વાર નથી. તુરત જ હું આપની પાસે
આવી જાઉ.

દેવ ! તમારાં દર્શન થયાં, આખા જીવનનું કેન્દ્ર બદલાઈ ગયું.
લાગે છે કે બધા વિના ચાલી શકે, તમારા વિના ન ચાલી શકે.

હવે બીજી કશાની અભીપ્સા નથી, જંખના નથી. હૈયું જંખે છે
માત્ર તમને. આંખો ઘાસી ઘાસી છે તમને જોવા.....અલપઝલપ દર્શન-
સુખ આપ્યા પછી હવે અદર્શનની પીડામાં મને કેમ રાખો છો, પ્રભુ?

‘અખ્યિયાં પ્રભુ દરિસન કી ઘાસી.....’ કેવી ઘાસ.....! ચાતક
પંખીની વાત પુસ્તકમાં વાંચી’તી. ચાતક માટે એમ કહેવાય છે કે તેને
ગળા પાસે કાણું હોય છે અને એટલે તે જરણાંનું કે નદીનું પાણી ચાંચ
વાટે પીએ તો તે ગળાના કાણાથી નીકળી જાય.

ઘાસું ઘાસું છે ચાતક. પણ શું કરે એ? ન નદીનું પાણી કામ
આવે, ન જરણાંનું, ન સરવરનું, ન કુંડનું.....એક જ આશા.....વાદળાં
આકાશમાં મંડરાઈ આવે ત્યારે ચાતક ઉંઘું પડી જાય, મોઢાને ખોલી દે
ને ઘટક ઘટક જળબિંદુને પીવા માંડે.....

આ વાંચતાં મારી આંખો સહેજ ભીની થઈ ગઈ. આવી ઘાસ
મારી પાસે ક્યાં છે? ને સહજ જ મેં તમને પ્રાર્થના કરેલી: દેવ! દર્શન
હમણાં ન આપો તો કંઈ નહિ, ઘાસ તો આપો આવી!

સંત ઓગસ્ટિનની જીવનીના પેલા પ્રસંગે મને કેવો તો હયમચાવી
મૂક્યો- ‘તો ! એમનેય થયું કે ઘાસ છે તો પ્રભુ દર્શન કેમ નથી

આપતા?' રીલેની જેમ એમણે કહ્યું હશે: 'Put out my eyes so that can see you.' ('ઠારી દે આ દીપ નયનના, તવ દર્શનને કાજ, જો કાચ નથી આ ખપના...' અનુ. હરીન્દ્ર દવે)

મને પણ આ વાંચતાં શું થયેલું, કહું? રીલેની પંક્તિનો અનુવાદ મેં સૂરદાસની પેલી પંક્તિમાં ખોજેલો: જીન આંખિન મેં નવિ રૂપ વસ્યો, ઉન આંખિન સે અબ દેખિયો ક્યા? આંખોનો શો મતલબ, જો તમે એમાં ન ઉત્તરો!

ચાલો, તમારી પૂરી છબી ઝડપવા મારી આંખો નાની પડે, સમજચા. મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજની પ્રાર્થનામાં સૂર પુરાવી હું કહું કે 'તેરે નયન કી મેરે નયન મેં.....દિઓ છબિ અવતારી!' તો એ પ્રાર્થના તો અફળ નહિ જ જાય ને?

ન આંખોનો કોઈ અર્થ, ન કાયાનો.....મને કહેશો, પ્રભુ? કે મારી આ કાયા....મેરુંડ મારો ટવ્વાર હોય.....મેરુંડ એટલે એન્ટેના. આ એન્ટેના ઊચકાયેલ હોય, હૃદયનો નાનકડો પડદો તને ઉપસાવવા આતુર હોય, પણ તારાં કિરણો જો ભીતર પ્રવેશો જ નહિ તો હું શું કરું?

ઓગસ્ટિનના પેલા પ્રસંગને વાંચતાં મને થયેલું કે મારી વેદના આ જ છે. મીરાં ને ફરીથી ટાંકું તો, 'નયણાં દીધાં પણ દરિસન ન દીધું.....' તીવ્ર વેદના હતી એ દિવસોમાં, ને લાગતું હતું કે ક્યારેક આંખોનાં વાદળાં ઝરઝર ઝરવા મંડી પડશે. ક્યારેક લાગતું કે જોરદાર ઝઘડો તારી સાથે હું માંડી બેસીશ.

લાગે છે કે મારા આ સંભવિત ઝઘડાને ટાળવા જ તેં આ પુસ્તક મારા હાથમાં પકડાવી દીધું હશે. હું ઓગસ્ટિનની જીવનીને જોતો હતો. એકવાર અકળાઈ ગયા ઓગસ્ટિન. એમને થયું કે પ્રભુ કેમ દર્શન નથી આપતા.....?

એટલા અકળાઈ ગયા તેઓ. પછી તો તેમને થયું કે આ કાયાને સમુદ્રમાં ફંગોળી દઉ. જો આ કાયામાં 'એને' ન ઉત્તરવું હોય તો શું

પ્રયોજન આ કાયાનું ? ગયા દરિયાકાંઠે. ને ત્યાં એક બાળકને જોયું. એ રડતું હતું. સંતે પૂછ્યું : બેટા, તું કેમ રહે છે? બાળકે કહ્યું : હું દરિયાકાંઠે આવ્યો. ગમી ગયો મને સમુદ્ર..... કેવા તો એના આરોહ-અવરોહ, મોજાંનું આ સંગીત....થાય છે કે દરિયાને ઘરે લઈ જાઉં. પણ મારી નાનકડી વાટકીમાં દરિયો સમાતો નથી.

સંતે પ્રેમથી સમજાયું કે ભાઈ ! તારું પાત્ર આવ્યું નાનકડું. એમાં દરિયો ક્યાંથી સમાય ? બાળક સમજી ગયું. ને બાળકને સમજાવતા સંત પણ સમજી ગયા કે પોતાની નાની સી ખ્યા..સ પ્રભુને શી રીતે લાવી શકે ?

મને પણ સમજાયું પ્રભુ ! કે મારી ખ્યાસ ઘેરી નથી બની. નથી બની કે તેં નથી આપી ? હવે આપો !

હું અકળાઈશ, વેદનાથી આકન્દ કરીશ, હતાશ થઈશ, પ્રસત્ર થઈશ, પણ કેન્દ્રમાં તમે છો, પ્રભુ! હું તમને છોડીને ક્યાં જાઉં? (ને તમેય મને શી રીતે છોડશો?) સૂરદાસ યાદ આવે : ‘મેરા મન અનત કહાં ઊડ જાવે? જૈસે પંખી જહાજ સે ઊડી, ફિર જહાજ પે આયે...’ વહાણ પર પંખી હોય. અધદરિયે રહેલ એ વહાણમાંથી પંખી ઊડે, પણ ઊડીને જાય ક્યાં? જો ચારે બાજુ માત્ર પાણી જ પાણી હોય.....ક્યાંય બીજું આશ્રયસ્થાન ન મળતાં પંખી ફરી વહાણ પર આવે. એમ હું પણ તમને છોડીને ક્યાં જાઉ? મારું મન બીજે જો શાન્તિ જ ન પામે તો.....

હું તમારી આસપાસ, ચોપાસ ભમ્યા કરું.....વિમાસણ થાય કે ક્યારેક થાકી જઈશ તો નહિ? કેન્દ્ર (તમે) છૂટી તો નહિ જાય? ના, તમારા પર ખૂબ ભરોંસો છે.

પ્રશ્ન થાય કે હું તમારી ચોપાસ ભમું છું એ સત્ય છે કે તમે મારી ભીતર છો એ સચ્ચાઈ છે ? ભક્તિયોગાચાર્યો તમને અન્તર્યામી કહે છે....અચ્છા, તો એવું તો નથી કે મોટા ભક્તોના હદ્યમાં તમે હો ને અમારા હદ્યમાં ન હો.

તમે મારા અન્તસ્તરમાં જ સદા હો, પ્રભુ ! ને તમે જ મારા મનધરના માલિક હો તો વિષયના ચોર કે કખાયના ધાડપાડુઓ શી રીતે અંદર પ્રવેશવાનો વિચાર પણ કરાવાના ?

તમે, મારા સન્દર્ભમાં, અન્તર્યામી જ છો ને, પ્રભુ ?

રાધા ખંડમાં હતી. બારણે ટકોરા પડ્યા. રાધા પૂછે છે : કોણ ? જવાબ મળે છે : કૃષ્ણ. રાધા એટલો તો સરસ જવાબ આપે છે એ વખતે : કૃષ્ણ તો મારી ભીતર જ હોય, બહાર શી રીતે હોઈ શકે ?

શીતલજિન સત્તવનની કરી યાદ આવે : ‘અન્તર્યામી સવિ લહો, અમ મનની જે છે વાત હો; મા આગળ મોસાળના, શા વર્ણવવા અવદાત હો ?’ નાનકડો દીકરો મોસાળમાં, પછી માને પરિચય આપેઃ મા, આ મારા મામા. મા હસે. બીજું કરે પણ શું ? ‘ભઈલા, તારો મામો... પણ મારો તો મારીજાયો ભાઈ છે. સાથે રમેલા, સાથે જમેલા.....’

તમે અન્તર્યામી. ને ભીતરની વાતો વિસ્તારીને હું તમારી આગળ મૂકું. શા માટે? કારણ કે બીજાઓ સાથે વાતો કરવાનો રસ નથી. નથી એનું કાંઈ પ્રયોજન. બોલું તો તારી સાથે બોલું.

● ● ●

‘આસિતું ક્ષણમઘેકમ્....’ તમને જોયા નહોતા, તમારા ગુણગણથી પરિચિત નહોતો ત્યાં સુધી તમારા વિના યુગોના યુગો, આ અંધાર-ઘેરા ખંડમાં કાઢ્યા. તમારા ગુણગણથી આછો પરિચિત આજે બન્યો છું. પણ હવે એક ક્ષણ તમારા વિના અહીં જાય તેમ નથી.

અને ક્યાં સુધી રહેવાનું અહીં તમારા વિના ? ‘વનદવ દાખાં રૂખડાં રે લાલ, પાલહદે વળી વરસાદ રે, તુજ વિરહાનળનો બણ્યો રે લાલ, કાળ અનંત ગમાત રે.....’ [કુંથુજિનસત્તવન : મહો. માનવિજય] દાવાનળમાં વૃક્ષો બળી ગયાં, પણ હુંઠાં વૃક્ષોનેય વરસાદ ફરી ચેતનવંતા કરી મૂકશે. પણ તમારો વિરહ.....જૂરી જૂરીને મરી જઈએ તોય તમે ક્યાં મળો છો ?

તમે સહેજ હુંક આપો તોય વિરહનું અપાર રણ લીલાકુંજાર વનમાં
ફેરવાઈ જાય. ઉશનસ્ત યાદ આવે :

લો, અમને તો ઝૂરવા માટે મળી ગયું તમ નામ.....
અંખમાં આંજુ લીધું તમારું કાજળ પેરે રૂપ,
મુખ પર મૌનનું તાણું, ભીતર ઘડકન કષણ ના ચૂપ,
વિરહના રણને વનરાવન કરશું એટલી હામ....

● ● ●

'સંસારે નાસ્તિ મે રતિઃ.' નથી ગમતો સંસાર. ગમે છે માત્ર તારું
સાનિધ્ય. હું તને કેટલું ચાહું છું એ શી રીતે બતાવું ?

‘તુજને હું ચાહું એ કહેવાનો મારો આંદ,
એ જ વાત કહું અદલાવી બદલાવી શત છંદ.....
એ જ વાત લઈ છુપાઉં હું ઊંડા ભૂતલમાં,
એમ કરી મુખરિત હું શતધા થાઉં કૂલ દલદલમાં,
એ જ વાત વને વને કહેતો પવન વીખેરી ગંધ.....
એ જ વાત તારકને કાને, એ અવ ટમકે,
પંખીકંઠ વિષે એ ટહુકી જરણ ચરણ કલ ઠમકે
નિબિડ નિશીથે એ જ ઘડકતો વિશ્વ હદ્યનો સ્પંદ....
એ જ વાત ફરી ફરી કહેવા તવ સંમુખ તવ કર્ણો,
હું ભવભવની શ્રેણી ભટકું અભિનવ રૂપે વર્ણો,
આપણી બેની આ જ વાત પર ચાલતો સકલ પ્રબંધ....’

[ઉશનસ્ત : ‘વ્યાકુલ વૈષ્ણગવ’]

● ● ●

એક વાત પૂછું, મારા નાથ ? મને તો તમારું સાન્નિધ્ય ઘારું ઘારું લાગે છે. તમને મારું સામીધ્ય અકળાવનારું નથી લાગતું ને ?

હમણાં એક સરસ વાર્તાલાપ વાંચ્યો હતો. બાળકને કોકે પૂછ્યું : તારી ઉંમર કેટલી ? દશ વર્ષ. ફરી પ્રેરણ આવ્યો : તારી મમ્મીની ઉંમર કેટલી ? બાળક : દશ વર્ષ. પૂછિનાર હેરાન થઈ ગયો. મમ્મીનું વય દશ વર્ષ ? બાળક ચતુર લાગતો હતો. મહેમાને ચહેરા પર પ્રેરણાર્થ ભાવ ઉપસાવી હાથનો ઈશારો કરી પૂછ્યું : શ્રી રીતે ? બાળકે કહ્યું : હું જન્મ્યો માટે તો મમ્મી મમ્મી બની ને ! એ પહેલાં એ સ્વી હતી. મા ક્યાં હતી ?

મારી વાત સાંભળનાર તમે છો એટલે આના પર હું ટિંપણી નહિ આપું. પણ પ્રેરણ તો દોહરાવીશ જ : મારું સામીધ્ય તને અકળાવનારું તો નથી લાગતું ને ?

● ● ●

મારી વાત તો સ્પષ્ટ છે : ‘સંસારે નાસ્તિ મે રતિઃ....’ સંસારમાં તમે નથી. ને તમારા વિના મને ગમે નહિ.....

તમને પામવા શું કરવું જોઈએ એનો ઘ્યાલ નથી. મીરાં તો કહે છે કે એણીએ તમને ત્રાજવે તોળીને લીધા છે.... ‘લિયો રી તરાજુ તોલ !’ પોતાની જાતને ખોઈને એણીએ તમને મેળવ્યા છે. મારી આટલી હિન્મત નથી. ‘હું’- માં શું છે એનો તાર્કિક અભિગમ મારી પાસે છે, પણ અનુભૂત્યાત્મક અભિગમમાં હું પાછળ છું. હું તો આટલી જ વિનતિ કરું કે તમે મારા અન્તસ્તરમાં એવા પ્રવેશી જાવ કે હું હું ન રહું.

સુરેશ દલાલ યાદ આવે : “નરસિંહનો હાથ મશાલ થઈને સણગી ઊઠચો એવી ભક્તિ અહીંની આસક્તિમાંથી છૂટું તો પ્રગટે. જેરનો પિયાલો પી જઈને અમરતાના ઓડકાર ખાઈએ તો મીરાં થવાય. હદ્ય કાયમ માટે ઘવાય તો મીરાં થવાય. રાણાના રાજપાટ છોડીએ અને રાજપાટ

સ્વીકારીએ તો મીરાં થવાય. ‘હું’ પદ વિનાનું પદ એટલે મીરાં. (‘મારી ગ્રાર્થનાની ધરતી’)

પણ મારું ‘હું પદ’ જાય શી રીતે ? બસ, તમે એને છીનવી લ્યો ત્યારે જ ! ક્યારે મારા ‘હું’ પદને છીનવશો ?

હું તો મારા ધૂવપદને રટ્યા જ કરીશા : ‘સંસારે નાસ્તિ મે રતિઃ...’ તમારા વિના મને ગમતું નથી.

ક્યારેક તો મારી કેવી હાલત થાય છે તે આપ જાણો છો ને ? મા વિના અકળાતો, મૂંજાતો નાના બાળ માને મેળવવા ઘરમાંથી ભાગી છૂટે ને તે વખતે સ્વજનો તેને રોકી દે, પકડી લે.... કેવું એ રડતું હોય બાળક એ વખતે? ‘નહિ, મારે મા પાસે જવું છે. ઘરે નહિ.....’ મા વિનાના ઘરને આખરે ઘર કહેવાય પણ કેમ ?

હું તમને મળવા એમ જ ભાગી છૂટું. ને ત્યારે..... પેલામાં સ્વજનો બાળકને રોકતા હતા. મારી વાતમાં આન્તરિક શત્રુવર્ગ એ રૂકાવટ કરે છે. ‘આન્તરો રિપુસંધાતઃ’.

તારા મંદિરે બેઠો હોઉં. અપલક નેણો તને નીહાળતો, નીહાળતો... નિરવધિ સુખની એ ક્ષાણો... પણ શું વાત કરું, પ્રભુ ! બત્રીશ ભોજન છોડીને એંઠવાડ તરફ જનારી મારી આ ઈન્દ્રિયો... પર-રૂપ મારી આંખોને તારામાંથી ચ્યુત કરી નાખે.... પછી ઘ્યાલ આવે.... માથું પટકું. હાય ! આ શું થઈ ગયું ? બસ, પ્રભુ ! મારી લાયકાત ગણો તો એટલી કે એ વખતે ધૂસકે ધૂસકે રડી પડાય છે. એકવાર તો મેં તને કહેલું (યાદ છે ન ?) કે પ્રભુ ! આંખો આપી તો જોવાની કળા મને કેમ ન શીખવાડી ? હવે આવતા જન્મે તો દેવ ! મને એવી જ આંખ આપજે, જે માત્ર તને-તને જ - નીહાળ્યા કરે.....

● ● ●

શ્રામણની પગથારે તેં મને મૂક્યો. મારા સૌભાગ્યની આ અવધિ હતી. પણ ત્યાંથ શું થયું, પ્રભુ ? મારા સાહિત્યની પ્રત્યેની ઈર્ષા મને હતી. મારાથી ભણવામાં કોઈ આગળ નીકળ્યું. હું ઈર્ષાથી છલકાઈ ઊઠ્યો.

કેટલો મોટો આ મારો અપરાધ હતો ? સામે રહેલ તારો શુભ્ર વેષ જેમને મળેલો એ મહાત્મા પરનો મારો તિરસ્કાર એ શું.....? હું પ્રૂજી ઊદ્ધું છું, દેવ ! તારા વેષ પ્રત્યે તિરસ્કાર... મને હોઈ શકે ? પણ મને આવ્યો હતો.....

તારી પાસે મારે આવવું છે. પણ આ આન્તર શત્રુસમૂહ મને રોકે છે. અત્યારે સૌથી વધુ મને જરૂર છે તારી કરુણાની.... તું જ તો કહે છે કે અસહાયને હું ઊચું છું... આ કીચડ, આ કાદવ, પ્રભુ ! મારું સામર્થ્ય ચૂકી જાય એમ છે. જોઈને જ મારા છક્કા છૂટી જાય છે. તારી કરુણા ભવસાગરને ખાબોચિયામાં પલટી નાખે છે એ મને ખબર છે. તમે કરુણા કરો ! ‘વિધાય મધ્ય કારુણ્યમ્....’ મારા પર કરુણા કરીનેબીજાઓ પર તો તું વહાવે જ છે કરુણા. જરા મારા પર વહાવ તો ! મીરાંની જેમ મને ય ગાવાનો અવસર મળે : ‘ભવસાગર અબ સૂખ ગયો હૈ, ફિકર નહિ મોહિ તરનન કી....’

● ● ●

તારી કરુણાની ધારા જીલું છું ત્યારે કેવો રોમાંચક અનુભવ થાય છે ! બધું જ - બીજું બધું જ ઢળી પડે છે. રમેશ પારેખ કહે છે તેમ,

‘પટ દઈને અમે પટી જઈએ,
શરીરના ધરણી મટી જઈએ,
ઢળી પડે મન જ જ્યમ ઝાંથી ખરી પડે પીલુડાં પાકલ....
નહિ મીરાં ને નહિ કોઈ સંચા,
નહીં નામ કે નહિ વહીવંચા,
આપોંનું ના રાઘું રહેતું હવે જીવમાં ટાંકલ.....’

અનુભવ આ મજાનો તેં આપ્યો : તારો ખૂબ ખૂબ ઝણણી છું. પણ જોડે જ પૂછીશ : આ અનુભવનું સાતત્ય તમે કેમ ન આપ્યું, દેવ ?

સાતત્ય... એ સાતત્ય મને તમારા જોડે સમ્બદ્ધ બનાવશે. 'થેનાગચ્છામિ તેજિકે....' ની મારી પ્રાર્થના સફળ બનશે. તારી પાસે આવવું છે. શી રીતે આવું?

હમણાં જ મીરાંની આ રોમહર્ષક ઘટના વાંચેલી : સમી સાંજનો સમય. મીરાં ગુરુના આશ્રમે ગયેલી. દરવાજો બંધ છે. મીરાંએ ટકોરા માર્યાં. અંદરથી ગુરુ પૂછે છે : કોણ ? મીરાં કહે : હું મીરાં. પ્રભુના ચરણોની દાસી... દ્વાર ખૂલ્યાં. મીરાં અંદર ગઈ. ગુરુના ચરણોમાં વંદના સમર્પિત કરી.

ને ત્યારે ગુરુએ પૂછ્યું : મીરાં ! આ બેઉ સાથે શી રીતે હોઈ શકે કે તું મીરાં પણ હોય, અને પરમના સમુદ્રનું બુંદ પણ હોય ? યા તો તારું વ્યક્તિત્વ અકબંધ હોય મીરાં તરીકેનું. યા તો તું અસ્તિત્વના સમુદ્રનું બિન્દુ બની ગઈ હોય. પણ તું બેઉ સાથે શી રીતે હોય ? તારે પસંદગી એકની કરવી જોઈએ... મીરાં એ તરત જ નક્કી કર્યું કે મીરાં કેન્દ્રમાંથી આ ક્ષણે જ વિદ્યાય લઈ રહી છે... કેન્દ્રમાં હશે પ્રભુ, પ્રભુની આજ્ઞા... પોતે ક્યાંક ખૂણો ખાંચરે પડેલ હશે. પાછળના ભજનોમાં મીરાં લખે છે : 'મેં તો રાવ રી દાસી....' મીરાં ગઈ. પ્રભુ-ચરણોની દાસી ત્યાં પ્રગટ થઈ છે.

મીરાં પરમના સમુદ્રમાં બુંદ બની ઓગળી ગઈ....આ કથા વાંચતા મારી હાલત કેવી થયેલી, ખબર છે ? હું છુસકે છુસકે રહેલો. મારું જીવન બુંદ કેટલીય વાર - અગણિત જન્મોમાં સંસારની મરુભૂમિ પર પડ્યું.... શોષાઈ ગયું એ, ચૂસાઈ ગયું એ, પણ આ જીવતરના બુંદને તો પ્રભુ ! તમે સ્વીકારો જ. સંતકબીરે કહ્યું હતું તેમ, 'બુંદ સમાના સમુંદ મેં....'

હું બુંદ, તમે સમંદર. તમારા વિનાના મારા હોવાપણાનો શો અર્થ હોઈ શકે ? બુંદપણાની આ ભક્તિ મારા મૈત્રીભાવને પણ ગાઢ બનાવશે.

આખરે એક બિન્હુનો બીજો બિન્હુ જોતેનો સંબંધ પણ ઓતપ્રોતતાનો જ હશે ને !

ઘ્યાલ છે કે તમારામાં સમાવું, તમને સમર્પિત થવું બહું અધરું છે. પણ એ સિવાય બીજો માર્ગ પણ હવે કયો મારે માટે છે ? તમારા વિના રહી શકવાનો તો સવાલ નથી. ને તમારામાં કેમ ઓગળી જવું, વિલીન થવું એ સૂજતું નથી.

ફરી મીરાં યાદ આવે : ‘સદા સેવા કરતી હું, સુભિરન ધ્યાનમેં ચિત્ત ધરતી હું; ભક્તિ મારગ દાસી કો દિખલાવો, મીરાં કો પ્રભુ સાંચી દાસી બનાઓ !’

મારાં તો હાજીં ગગડી જાય.... ચોવીસ કલાક સેવાના ભાવમાં ઓતપ્રોત રહેનારી મીરાં, સંતોની સેવા માટે શરીરને તોડી-ફોડી નાખનારી મીરાં, તમારા સ્મરણ અને ધ્યાનમાં સતત લાગી રહેલી મીરાં..... એષીને પણ ભક્તિમાર્ગ દર્શાવવા તમને વિનતિ કરવી પડે ! ‘મીરાં કો પ્રભુ સાંચી દાસી બનાઓ !’ હું ધ્રૂજી ગયો. હું તો માનતો હતો કે હું તારો ભક્ત છું. હું તારો દાસ છું.... હવે લાગે છે કે એકો એકથી શરૂઆત કરવી પડશે.

ક્યાંથી કરું શરૂઆત, પ્રભુ ?

મંજિલ મારી નક્કી છે : ‘ધેનાગચ્છામિ....’ તારી પાસે આવવાનું જ છે મારે. તમે સામે કહેશો : ‘તે માર્ગ ચાલવું નથી તારે’ ! મારો જવાબ શું હશે,’ તમે જાણો છો : તું ચલાવ.... ! ‘પંગુ લંઘયતે ગિરિમુ’ કહું છે તારા માટે ભક્તોએ. હું ચાલતો નથી માટે પંગુ. તું ચલાવી દે મને..... બીજાઓને તું ચલાવે, પર્વત ઓળંગાવે ને મારી વાત આવે એટલે.... ના, એ નહિ ચાલે. તારા વિના મને એક ક્ષણ પણ ગમતું નથી. ‘આસિતું ક્ષણમઘેકમુ....’ આ મારી લાયકાત પર તું મને તારી દે, ભગવાન !

* * *

તવાયજ્ઞો ભવો ધીર !
ભવોજ્ઞારોપિ તે વશ : ।
એવં વ્યવસ્થિતે કિંવા ।
સ્થીરયતે પરમેશ્વર ! ॥ ૩૪ ॥

અરે ધીરના ધીર સંસાર તારે,
વશે છે, તવાધીન સંસાર પારે;
વ્યવસ્થા બધી એ પ્રમાણે છતાં યે,
પ્રભો? કેમ નિઃસ્પંદ, શું કેં ન થાય.

હે ધીર! આ સંસાર આપને અધીન છે અને
સંસારનો પાર પણ આપને વશ છે, આ પ્રમાણે
વ્યવસ્થિત છે છતાં પણ આપ ચૂપ કેમ રહ્યા
છો? હે પરમેશ્વર! કાંઈક તો હીલચાલ કરો.

तदीयतां भवोत्तारो ।
 मा विलम्बो विधीयताम् ।
 नाथ ! निर्गतिकोलापं ।
 न शृण्वन्ति भवादशः ॥ ३५ ॥

मने पार संसारनो आप आपो,
 हવे ढील धारो नहि कर्म कापो;
 सुषो शु नहि नाथ ! निर्भागी वाणी,
 विलापो करुं करुणाभ्य जाणी.

हे नाथ ! मने संसारनो पार पमाडो, हवे विलंब
 न करो. हे करुणानिधान ! शु आप आ
 अनन्यगति-अशरण आत्मानी प्रार्थना-आरजु
 नहि सांभणो ! आप जेवा नहि सांभणे तो
 कोडा सांभणे ? माटे हवे वार न लगाडो ने
 सामे पार करी धो.

‘તવાયતો....’ પંક્તિને સામે રાખીને રચાયેલ ગીતને હું સંભળતો હતો: ‘મૈ હું સંસાર કે હાથો મેં....’ ધેરી નિરાશામાં હું દૂબી ગયો. હું સંસારના હાથમાં અગણિત સમયથી. પણ મારે તો તારા સાન્નિધ્યમાં આવવું છે. મને સંસારમાંથી મુક્તિ શી રીતે મળે ? ને ત્યાં જ આગળ ગીત સંભળાયું : ‘સંસાર તુમહારે હાથો મેં....’ ઓહ ! હવે શો વાંધો ! જો પૂરો સંસાર જ તમારા હાથમાં છે. તો મને શી ચિંતા !

એ જ ગીતની આ કરીએ પણ મનને સ્તબ્ધ કરેલું : ‘હૈ જીત તુમહારે હાથો મેં, ઔર હાર તુમહારે હાથો મેં....’ વિજય જ્યારે મળેલો ત્યારે તેં જ આ કષણો આપેલ છે એવી શ્રદ્ધા હોવાના કારણે અહંકાર નહિ પ્રસ્કૃટિત થયો. દેવ ! આ કેવી અસાધારણ તારી કૃપા હતી ! મેં ઈચ્છયું એમ થયું, પણ એ ઠીક હતું માટે થયું. ક્યારેક મેં ઈચ્છયું એમ ન થયું. તારી કૃપાધારા એ સમયે પણ મારા પર ભરપૂર ન વરસી હોત તો હું નિરાશાના અંધારી ખીણમાં ભરાઈ ગયો હોત.....

આવી નિરાશાની એક ઘડીએ મને ભગવતી કુન્તીની સ્મૃતિ થઈ આવેલી. મહાભારતમાં આવતી એણીની વિઘ્યાત સ્તવનાના શબ્દો મારા કાનમાં ગુંજુ ઉઠેલા : ‘વિપદો નઃ સન્તુ શશ્તત....’ અમને હંમેશા વિપત્તિઓ મળે : જો વિપત્તિઓની કષણોમાં અમને તમારું સ્મરણ ઘેરું થઈ ઉઠતું હોય તો દેવ ! એ વિપત્તિની કષણો અમારા માટે વરદાન જેવી છે...

શું મજાની વ્યાખ્યા એ સમયે ભગવતી કુન્તી આપે છે : તેનું સ્મરણ તે જ સંપત્તિ.... તેનું વિસ્મરણ તે જ વિપત્તિ.... 'વિપદ્ વિસ્મરણં વિશ્લોः....'

પરંતુ આ તો મારા જીવનની એ અવસ્થાની મેં વાત કરી, જ્યારે ભગવતાનો આંશિક પ્રવેશ થયેલો. થોડોક બધું પ્રવેશ ભગવતાનો થયો ત્યારે....? મારા નાથ ! ત્યારે તો કેવું ચિત્ર બદલાઈ ચૂક્યું હતું ! પ્રભુ ! તમે કેવો જાદૂઈ પ્રભાવ પાથરો કે વિજય અને પરાજયની સમૂહણી વ્યાખ્યાઓ જ બદલાઈ ગઈ હતી. તમારી સાથે હોવું તે વિજય હતો, તમારાથી વિખૂટા પડવું તે હતો પરાજય.

તમારી સાથે જ સતત હોવું.... તે દિવસે સંત હરિદાસની વાત સાંભળ્યા પછી હું તમારી પાસે કેટલું રડ્યો હતો તે તમને યાદ છે ને ? વાર્તાનો પ્રારંભ તો આશ્રયને અહોભાવ સાથે સાંભળેલ. પણ એનો અંતમાં આવતાં તો.... હું ભાંગી જ પડ્યો હતો..... હા, શરૂઆતમાં તો કથાકારને હું પીતો જ હતો : એક ધ્યાને, અહોભાવથી. મને બધું યાદ આવે છે. એમણે કેવી રીતે શરૂઆત કરેલી....

તાનસેન એક પદ ધૂંટયું. અકબર બાદશાહે કહ્યું : ધણા બધા સૂર-સમાટોને સાંભળ્યા પણ આ આનંદ, આ ઉંડાણ.... લા-જવાબ છે. તાનસેન કહેલું : નામવર ! આપે જો મારા ગુરુ હરિદાસને સાંભળ્યા હોત તો આપનો અભિપ્રાય બદલાયેલો હોત.... એમના આરોહ-અવરોહ ને એમના ઉંડાણ પાસે આ તો કશું નથી.

અકબરને થયું કે એણે હરિદાસને સાંભળવા જ જોઈએ. પૂછ્યું : ક્યાં છે તારા ગુરુ ? બોલાવી લાવ એમને સમ્માન સાથે. મારે એમને સાંભળવા છે.

તાનસેન : નામવર ! તેમને સાંભળવા આપણે જવું પડશે. તેઓ ક્યાંય જતા નથી ને ભગવાન સિવાય કોઈની સમક્ષ ગાતા નથી. જમુનાના કંઠે ઝૂપડીમાં તેઓ રહે છે. આપણે મધ્યરાત્રીએ ત્યાં જવું પડે. ત્યાં ગયા પછી ય ધૂપાઈને બેસી જવાનું. આપણા સદ્ગ્રામમાં હોય તો આપણને સાંભળવા મળે.

ગયા બેઉ. રથને થોડે દૂર ઉભો રખાવી પગપાળા ઝુંપડીની પાછળ જઈ બેસી ગયા. એકાદ કલાક પછી તેમની સાધના ફળી. હરિદાસજીએ ‘અખિયાં દરિસન કી હે ઘાસી....’ પદ ઉપાડયું. ઘૂંઠયું.... ઘાસ સૂરમાં ઢળવા માંડી.... ભક્તની ઘા...સ.... ભક્તનું દઈ.....

અકબર સત્ય બની ગયા. ગીત પૂરું થયું. અકબર અને તાનસેન રથ પાસે ગયા. રથમાં બેઠા. હજુ સત્ય છે અકબર : આવું સંગીત ! એ ચુપ્પીને શબ્દોમાં ઢળતાં અકબરે કહ્યું : તાનસેન ! તારા ગળામાં આ દઈ કેમ નહિ?

તાનસેન : હું આપને રીજવવા ગાઉં છું. મારા ગુરુ માત્ર જગત્તિયન્તાને રીજવવા ગાય છે....

કથાકારે આ શબ્દો કહ્યા ને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો’તો. યાદ છે ભગવાન ! દોડીને હું સીધો તારે દરબાર આવેલ ને મેં કહેલું કે પ્રભુ ! મારા કંઠમાંય આવું દઈ મૂકી ધો ને !

મને ઘ્યાલ છે તેં જવાબ નહોતો આપ્યો. પણ તારો જવાબ શું છે એનો મને સ્પષ્ટ પ્રતિભાસ મળી ગયેલો. ને મેં એ વખતે તેનોય જવાબ તને આપ્યો’તો ખબર છે ? મેં કહેલું કે હરિદાસ જેવી ભક્તિ મારામાં હોય ને તું મારા ગળામાં દઈ મૂકે તો એમાં તારી કઈ વિશેષતા છે ? એ તો ભક્તની ભક્તિની વિશેષતા છે... મારી પાસે કશું ન હોય અને છતાં તું મને આવું દઈ આપે....

તું તો આપે જ છે, પ્રભુ ! સતત તું આપતો રહ્યો છે. તારે દ્વારે આવ્યો હોઉં ને તેં મને કૃપાધારાથી ન નવડાવ્યો હોય એવું ક્યારે બન્યું છે ? તેં એટલું તો અદ્ભૂત મને આપું છે....

‘સૌની આંખોથી છાની મુજને તેં આપી જે ભેટ,
પિયુ ! હે ! ક્યાં સંતારી રાયું, જાળવી જીવની પેઠ.....

....ચરણ ત્યારથી ભૂલી ગયા છે નિજ સ્વાભાવિક ચાલ,

અંગ અંગ પર ઊળી નીકળ્યું છે તવ બોલકણું વહાલ;
લોકથી રક્ષી ક્યમ લૈ જાવું એ કાળની પારે ઠેઠ.....'

[ઉશનસ્ક.]

• • •

'તવાયતો ભવો ધીર !' તમારા જ હાથમાં બધું છે. તો વિલંબ શા માટે, દેવ ? 'મા વિલંબો વિધીયતામ્.' ક્યાં સુધી હું ધીરજ ધરું ? 'નાથ ! નિર્ગતિકોલ્લાપં, ન શૃંગરન્તિ ભવાદ્ઘશા : ?' આપ મારા જેવા સામાન્ય મનુષ્યની વિનતિ પર ધ્યાન નહિ આપો ?

ભદ્રેશ્વરની તીર્થયાત્રા સમયે કટારિયા તીર્થમાં ઘટેલી ઘટના યાદ આવે છે આપને ? છ'રિપાલિત સંઘની સર્વેક્ષણ ટૂકડીએ ૧૩ કિ.મી. છાપેલું પ્રવાસનોંધમાં. નીકળ્યું ૧૭. થાકીને હુ....સ થઈ ગયેલા. પણ જ્યાં તમને જોયા... બધો થાક છૂ ! 'થાક્યા મિલ્યા સુખપાલ (પાલભી)' પંક્તિ જીવંત રીતે તે સમયે અનુભવી.

સ્તવનમાં 'સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર !' બોલતાં આંખોમાંથી આંસૂ ઝર્યા કરે. એ વખતે થયેલું કે પ્રભુ ! આજ તો અમારો વિનતિ પર ધ્યાન આપો ! ક્યાંય સુધી આંસૂ ઝર્યા કરેલા.

દર્શન પછી તીર્થસમિતિએ સંઘપતિઓનું બહુમાન કર્યું ત્યારે મને સંક્ષિમ પ્રવચન આપવાનું કહેવામાં આવ્યું. આંખો ભીની. શરીર રોમાંચિત. શું બોલું ?

ખરેખર ઘ્યાલ પણ નહોતો કે શું બોલું છું. પાછળથી મારા ગુરુબંધુ પાસેથી મેં જાણ્યું કે હું શું બોલેલો... 'વિનતડી અવધાર...' પંક્તિએ હદ્યનો કબજો લઈ લીધેલો. મેં કહેલું કે, આજે તો પ્રભુએ આપણી વિનતિ સ્વીકારવી જ પડશે.... (આપ બધું જાણો છો, સ્વામી ! પણ આપની જોડે બોલવાનો જે આનંદ છે, કેફ છે; એ જ તો મારા જીવનનું ચાલક બળ છે ન !)

મેં એ વખતે હળવા ટોનમાં ઉમેરેલું કે જમાનો પેપરવેઈટનો છે. પેપરવેઈટ ન મૂકીએ તે અરજિનું કાગળિયું હવામાં ઉડી જાય.... આજે આપણે સમૂહમાં વિનતિ કરી છે, કષ્ટો વેઠીને એનાં દર્શન કાજે આવ્યા છીએ; આજે આપણી વિનતિ પર પેપરવેઈટ મૂકાય છે. હવે સ્વીકાર્યે જ એમને છૂટકો !

• • •

‘નાથ ! નિર્ગતિકોલ્લાપં....’ ‘નાથ’ બોલું છું ને પૂ. ભાણવિજય મહારાજની ચૈત્યવન્દના યાદ આવે : ‘સકલ ભક્ત તુમે ધણી, જો હોવો અમ નાથ !’ ધણીવાર ‘જો’નો પ્રશ્નસૂચક લયમાં મેં અનુવાદ કર્યો છે : ‘સકળ ભક્તોના નાથ છો જ, પણ મારા નાથ તમે ખરા ?’ મને ઘ્યાલ છે તેમ વાતને ટાળી નાખવામાં બહુ ચતુર છો. પણ હું કંઈ કમ નથી. તમારો દાસ છું ને ! બોલો, તમે મારા નાથ ખરા ને ?

પૂ. ભાણવિજય મહારાજની બીજી સંવના યાદ આવે : ‘લલચાવશો દિન કેટલા રે, ઈમ મુજને દિલાસો દેઈને; હા ના મુખથી ભાખીએ રે, બેસી શું રહ્યા મૌન લેઈને....’ જો કે ભાણવિજય મહારાજને હા કે ના કોઈ પણ જવાબ ચાલે તેમ છે. મારે નહિ હો ! મારે જવાબ હામાં જ જોઈએ.

આપ હા પાડો એની કેટલી આતુરતાથી હું રાહ જોઈ રહ્યો છું, નાથ ! ચાલો, મારાથી અનાયાસ અહીં ‘નાથ’ લખાઈ ગયું, (મેં ક્યાં લખ્યું છે, તમે જ લખાવો છો ને બધું !) એટલે તમે હા પાડી દીધી.

હવે...મારી સજજતા કંઈ ઓછી નથી હો ! તમે આટલી મોટી કૃપા મારા પર કરી તો હું એને જીલવામાં પાછો તો નહિ જ પડું ને ! ના, ના. થોડી ભૂલ થઈ ગઈ.

હું શી રીતે જીલું તારી કૃપાધારાને ? તું જીલાવે છે... પેલી ઘટના યાદ આવી. એક માણસ પાસે પુસ્તકો ઘણાં. સારાં પુસ્તકો. પણ છુંડાં પડેલાં. કબાટ નહિ... મિત્રે કહ્યું : આટલાં સરસ પુસ્તકો તો કબાટમાં

જોઈએ. પેલો કહે : જેમની પાસેથી પુસ્તકો માંગી લાવ્યો છું તેમની પાસે કબાટ માગવાની હિમત હજુ નથી આવી !

પણ હું હિમતવાળો છું ! કૃપા પણ તું આપે. ને એને જીલવાની ચાદર પણ તારે આપવાની... બધું તારી પાસેથી લેવાનો....

હા, તો હું શું કહેતો હતો ? તારી કૃપા કેવી રીતે જીલાશે ? ભવોભવ હું છું તાહરો, નહિ મેલું હવે સાથ... સયલ સંગ છંડી કરી, ચરિત્ર લેઈશું. પાય તુમારા સેવીને શિવરમણી વરશું..."

જરૂર બધું છોડવું પડશે. તારા સાન્નિધ્યમાં આવવું હોય તો બધું છોડવું જ પડે. બહું જ... બહું જ... તમને મેળવવા બધું છોડવું જ રહ્યું.

અત્યાર સુધી થોડું છોડયું, ક્યારેક ઘણું છોડયું; પછી બાકીનું થોડું ન છોડયું, બચાવ્યું; એટલે પેલા આગળ છોડેલાનો કોઈ અર્થ ન રહ્યો. ઉશનસ્ના શબ્દો હૈયેય સ્પર્શી ગયેલા : ‘ભાઈ, બચ્યું એટલું એળે, અહીં તો લુંટવ્યું એટલી લહાણ !’

બહું છૂટી જશે તો શું થશે એવા એક કાલ્યનિક ભયે મેં કેટકેટલું ગૂમાવ્યું છે, સ્વામી ? મને ખ્યાલ છે કે મારા આ આધારોને છિનવવા તેં ઓછી કરુણા નથી કરી... કેટલી બધી પ્રતિકૂલ પરિસ્થિતિઓ મને આપવામાં આવેલી, જેમાં હું નિરાધાર બની ખરા આધાર રૂપ તને પામી શકું. પણ હું ચૂકી ગયો.

જ્યાનના સમ્રાટ્ની વાત હમણાં વાંચી ત્યારે મને ખ્યાલ આવ્યો કે તું અમારા આધારોને છિનવવા કેટલી કરુણા કરે છે ! જ્યાનનો સમ્રાટ્ ગુરુ પાસે ગયો. ગુરુના ચરણોમાં ઝૂક્યો. ત્યારે ગુરુએ હસીને પૂછ્યું : તું બહારથી જ ઝૂક્યો કે ભીતરથી પણ ઝૂક્યો ?

સમ્રાટે કહ્યું : ગુરુદેવ ! આપને જ ખ્યાલ આવે કે હું શી રીતે ઝૂક્યો છું. હું તો અબોધ મનુષ્ય. મને શો ખ્યાલ આવે ?

ગુરુ તો ચહેરો પારખવાની, ફેરિસ રીડિંગની કળાના સ્વામી હતા. પરંતુ બીજાઓને એની ખાતરી કરાવવા ગુરુએ કહ્યું : તું તારી આ રાજધાનીમાં મુખ્ય મુખ્ય સરકો પર ફરી આવ, ખુલ્લે પગે. હાથમાં જોડાં લેજે. ને એનાથી કપાળ ફૂટતો જજે....

સમાટ.... જે ક્યારેય રથ વિના રાજમાર્ગ પર ફરેલ નહિ. ખુલ્લા પગે ચાલવાનું ને જુતાથી કપાળને ફૂટતાં, ફૂટતાં... સમાટ ફરી આવ્યો તે રીતે. અને આવીને કહ્યું : ગુરુદેવ બહુ મોટી કૃપા કરી આપે. ‘હું’ થોડું પણ પાતળું ન પડે ત્યાં સુધી જૂકવાનું શી રીતે બની શકે ? આપે મારા ‘હું’ને થોડુંક ઓગાળી મહતી કૃપા કરી.

ભર્તૃહરિને કેવા ગુરુ તેં આપેલા ! જે રાણી પિંગલાના ચારિત્રદોષથી વિરક્ત બનેલ ભર્તૃહરિ.... તે જ પિંગલાને ત્યાં ગુરુ એને જવાનું સૂચવે છે : “મૈયા પિંગલા ! કહીને વત્સ ! તું લિક્ષા માગી આવ ત્યાંથી....”

સ્મૃતિની પછી આજે ખૂલ્લી રહી છે. ગોપીચંદને કેવા ગુરુ તેં આપેલા! ગોપીચંદ કહે છે : ગુરુદેવ ! મને દીક્ષા આપો ! ને ગુરુ કહે છે : ઉકરડા પર જઈ ત્યાંના ચીંથરામાંથી લંગોટી બનાવી, પહેરી, લિક્ષા માગી આવ ગામમાંથી. પછી વિચારું તને દીક્ષા આપવાનું. એક સમાટ.. પણ ગુરુ તો અહમ્મનું ઓપરેશન કર્યા વિના કેમ તેને અધિકારી માનશે?

અમારી ચાદરો છિનવી લેવાની કેવી તારી કરુણા ! પણ ભગવાન ! કૃપાનો થોડો વધુ ડોઝ જોઈશે તેમ નથી લાગતું ? ભર્તૃહરિ ને ગોપીચંદની વાત જુદી હતી. મારી વાત જુદી છે. તું મારો એક આધાર છિનવી લઈશ તો હું બીજો આધાર પકડી લઈશ. રૂપનો આધાર ગયો તો નામનો....

જો કે આ માટે તેં કઠોર ગુરુનેય (ગુરુને કઠોર કેમ કહેવાય ? હા, પણ નાળિયેર જેવા તો ખરા..... અંદરથી મીઠા, મીઠા...) આપ્યા. પણ હું નઠોર હતો એનું શું ?

● ● ●

‘સયલ સંગ છીડી કરી’....ના, હું સંગ છોડી શકું તેમ નથી. તું છોડાવ ! તારા રંગમાં મને એવો રંગી દે કે... બીજો રંગ મને ન લાગે. બીજાનો સંગ મને ન ગમે.

તારા રંગમાં મને એવો રંગી દે કે તું કહે તે અને તું કહે તેવી રીતે હું બધાં કાર્યો કરું. ઈચ્છા જેવું કંઈ મારી પાસે ન રહે. આમ પણ ઈચ્છાઓએ મને હેરાન - પરેશાન જ કર્યા કર્યો છે. પણ હું એમની પકડમાંથી મુક્ત બની શકતો નથી. તું મને મુક્ત કર !

દિનકર જોષી યાદ આવે. ‘ઝશાવાસ્યમિદં સર્વમ्’ ની વ્યાખ્યા કરતાં તેઓ લખે છે : અહીં ઈદમું અને સર્વ એ શબ્દો વપરાયા છે. ઈદમું એટલે આ. આપણો જ્યારે કોઈ પદાર્થ સામે આંગળી ચીંઘીને ‘આ’ છે એમ કહીએ છીએ ત્યારે ફલિત એ થાય કે એ બધું ‘આ’ જ છે, કશું જ ‘હું’ નથી. ‘હું’ ભાવ (અહંભાવ) અદૃશ્ય થાય અને ‘આ’ ભાવ (ઈદંભાવ) વ્યાપી થાય એ પરમાત્માનો પ્રથમ પરિચય છે. [‘પ્રાતઃ વંદના’]

પરમાત્મન ! મારે તો તારા રંગો રંગાઈ જવું છે, પણ આ અહંભાવ છૂટતો નથી. લઈ લે, ભગવન !

● ● ●

‘નાથ ! નિર્ગતિકોલ્લાપં ન શ્રૂણવન્તિ....’ શું આપ મારા જેવા નિઃસ્વ, અકિયન મનુષ્યનાં આ શબ્દ-પુષ્પોને નહિ સ્વીકારો ? મારી પાસે બીજું કશું જ નથી, ભગવાન ! સિવાય કે આ શબ્દો.... શું આપ એ નહિ સ્વીકારો ?

મારી હાલત પેલા ભક્ત જેવી છે, જે એક સંત પાસે ગયેલ. સંતના ચરણોમાં હજાર રૂપિયા એણે મૂક્યા. સંત ધનને શું કરે ? એમણે કહ્યું : ભાઈ ! અહીં ધનની આવશ્યકતા નથી....

ભક્ત ગળગળો થઈ ગયો : મારી પાસે બીજું કશું જ નથી, જે હું આપના ચરણોમાં ધરી શકું. મને નિરાશ ન કરશો. હું નિર્ધન છું. મારી

પાસે નથી સમર્પિતતા, નથી વેયાવચ્ચ કરવાની શક્તિ..... માત્ર આ, માત્ર આ જ મારી પાસે છે.

• • •

મારી પાસે તો છે માત્ર કચરો. ને કચરો પણ તમને આપવા હું તૈયાર નથી. ખ્યાલ છે કે કચરાના બદલામાં તમે સુવર્ણ આપવાના છો....

શું કરું, કહો તો ! મારી આ વથા બીજે ક્યાં જઈને ઠાલવું ?

યા તો તમે કૂર બની મારી ઈચ્છા અને અહમુને આંચકી લ્યો. યા તો પ્યારથી મને સમજાવો કે મારે આ તત્ત્વોને છોડી દેવા જોઈએ.

મા બાળકને આ સિવાય ત્રીજી કઈ રીતે ટ્રીટ કરશે ? યા તો આઇસકેન્ડી બાળકના હાથમાંથી ફેંકી દેશો. યા તો દુલારથી સમજાવશે.... ને બાળક નહી માને તોય શું મા એ બાળક પરના સ્નેહને થોડોય ઓછો કરી શકશે ?

મને ય ઘ્યાલ છે તારી મારા પર સતત કરુણા વરસી રહી છે, પણ...

‘પણ’ ની ભાવાનુભૂતિમાં હોઉં ત્યારે પૂ.વીર વિજય મહારાજ જેવા ભક્તિયોગાચાર્યાની રચનાઓ યાદ આવે. ‘નાથ! નિર્ગતિકોલ્લાપં ન શૃંગણ્ણ ભવાદશાઃ...’ ની પ્રતિધાયા જેવી મજાની એમની શબ્દ પ્રસાદી છે. ‘કયું ન હો સુનાઈ સ્વામી, ઐસા ગુન્ઝા ક્યા કિયા? અને બધાયની વાત તમે ન સાંભળતા હોત તોય વાંધો નહોતો, પણ બધાની વિનતિ સંભળાય ને મારી વાત આવે ત્યાં જ.....‘ઓરોં કી સૂનાઈ જાયે, મેરી બારી નહિ આવે; તુમ બિન કોન મેરા, મુજે કયું ભૂલા દિયા? ભક્ત જનોં કો તાર દિયા, તારને કા કામ કિયા, બિન ભક્તિ વાલે મોં પે પક્ષપાત કયું કિયા? રાય રંક એક જાનો, મેરા તેરા નહિ જાનો; તરન તારન ઐસા બિરુદ્ધ ધારન કર્યો કિયા ?’

તમે તારક છો તો મને તારો ! નહિતર તમારું તારક બિરુદ્ધ ભયમાં છે! સૂરદાસે એકદમ જુદા લયમાં આ વાત ઊભારી છે: ‘મૈં પતિતન મેં

ટિકો ! પ્રભુ ! પતિતોની દુનિયામાં હું અગ્રણી. મારો સિક્કો વાગતો'તો
પતિતોની દુનિયામાં. ને ત્યાં મેં તારું પતિતોદ્વારક બિરુદ્ધ સાંભળ્યુ ને હું
વિચારમાં પડી ગયો કે મારાથી ચઢિયાતો કોણ પતિત નીકળ્યો કે જેને
ઉદ્ધરીને તમે આ પદ મેળવ્યું ! લય જુદ્દો છે. વાત એક જ છે: હું પતિત
છું, મને તારો ! મારી વાત સાંભળો !

* * *



પૂજયપાદ કલિકાલ સર્વજ્ઞ
હેમચન્દ્રસૂરિ મહારાજાની પ્રાસાદિક રચના
વીતરાગ સ્તોત્ર
(૨૦મો પ્રકાશ) ૫૨
સંવેદના

पादपीठलुठन्मूळिन्
भयि पादरजस्तव ।
चिरं निवसतां पुण्य-
परमाणुकणोपभम् ॥ १ ॥

भद्रदृशौ त्वन्मुखासन्ते
हर्षबाध्यजलोर्भिभिः ।
अप्रेक्ष्य-प्रेक्षणोदभूतं
क्षणात् क्षालयतां भलम् ॥ २ ॥

त्वत्पुरोलुठनै भूयान्-
भद्रभालस्य तपस्विनः ।
कृतासेव्यप्रणामस्य
प्रायश्चितं किणावलिः ॥ ३ ॥

દેવાધિદેવ ! હું આપના સમવસરણમાં બેઠો હોઉં, પાદપીઠ પર લંબાયેલા આપના ચરણો પર મારું શિર ઝૂકેલું હોય અને આપની ચરણધૂલિ જર્યા કરે મારા શિર પર.

'ચિરમ...' અનંતકાળ સુધી હું આમ બેઠો રહું. આપના ચરણને સ્પર્શર્યા કરું.

કેટલી તો શીતળતા! ચન્દન સાં શીતલ ચરણ. સમવસરણનું અપાર્થિવ વાતાવરણ. પૂજ્યપાદ માન વિજ્યાળ મહારાજ કદાચ આ ક્ષણોનું જ જીવંત વર્ણન આપી રહ્યા છે : 'ટાઢુક રહે તુજ સંગમાં રે લાલ, આકુળતા મીટી જાય રે, તુજ સંગે સુભિયો સદા રે લાલ.....'

તમારા સંગે સુખ જ સુખ. તમારા વિના દુખ જ દુખ. એટલે આ અભિલાષા સતત રહ્યા કરે છે : 'મધ્ય પાદરજસ્તવ.....'

તમારી ચરણરજ મારા શિર પર જર્યા કરો. અનવરત ખર્યા કરો.

ચરણ રજ.....

સોનાના કમળો પર ચરણ મૂકીને જ વિહરનારા, કદીય ધરતી પર પગ ન મૂકનારા આપના ચરણદ્વયમાં રજ હોય ક્યાંથી? આ પ્રશ્ન મને થતો નથી.

અમુક શબ્દો હૈયાના ઊંડાણમાં વહેતા ભાવોને વાચા આપી શકતા હોય છે. ચરણરજ એવો જ સશક્ત શબ્દ છે. જે મારી ભીતર વહી રહેલી ભાવધારાને વ્યક્ત કરે છે.

એનો અર્થ આટલો જ છે: તમારું સાત્ત્બિધ મને ખૂબ ગમે છે, દેવ! મને તમારાથી વેગળો ન રાખશો. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ આ વાતને આ રીતે રજૂ કરે છે : ‘વેગળો મત હુજે દેવ! મુજ મન થકી, કમળના વન થકી જિમ પરાગો...’ તમારા વિનાનું મારું અસ્તિત્વ પરાગ વિહોણા કમળ જેવું હશે. એને કમળ કહેશેય કોણા ?

કૂલ ચિમળાઈ જાય, મૂરળાઈ જાય, કોઈના પગ તળે રોંદાઈ જાય. પુષ્પ આ બધું સહી શકે છે. નથી સહી શકતું એ સુગંધ વિનાનું પોતાનું અસ્તિત્વ.

હું તમારા વિના નહિ રહી શકું, દેવ!

એટલે જ આપની સ્મૃતિ વડે સદા મારા હદ્યને હું ભરી રાખું છું.

જો કે, તમારા ચિત્તમાંય મારું નાનકડું સ્થાન હોય તો એ મારા માટે ખૂબ જ સંતોષદાયક બની રહે પણ જ્યારે કલિકાલ સર્વજાશ્રી ‘તવ ચેતસિ વર્તેહમિતિ વાર્તાપિ દુર્લભા’ કહીને એને દુર્લભ તરીકે લેખાવે છે ત્યારે મનેય એ કપરું ચઢાણ લાગે છે.

એ કપરું ચઢાણ ‘મચ્યિતે વર્તસે ચેત્ ત્વમ્...’ કરીની લાકડી વડે ચઢી શકાશે.

શાનવિમલસૂરિ મહારાજે આ સંસ્કૃત પંક્તિઓને હદ્યંગમ ગૂર્જરભાષામાં ઉતારી છે: ‘તાહરા ચિત્તમાં દાસ બુદ્ધે સદા, હું રહું એહવી વાત દૂરે, પણ મુજ ચિત્તમાં તુછી જો નીત વસે...’ ‘અલમન્યેન કેનચિત્’.

મેં મારા મનઘરમાં આપને રાખ્યા છે. આપનેજ.

‘ચિરં નિવસતામ्....’ તારાં ચરણોની સેવા જનમ-જનમ મળ્યાં કરો.

ચરણોની સેવા નિરંતર કરવા માટે જોઈશે તમારી આજાનું પાલન.
શ્રામણ્ય.

પૂજ્ય માનવિજ્યજી મહારાજ જ્યારે એને-ચરણ સેવાના રસને અપૂર્વ
ને અદ્ભુત તરીકે વર્ણવી રહ્યા છે ત્યારે એને આસ્વાદવાનું મન કોને ન
થાય? તેઓશ્રી કહે છે: ‘અજિત જિનેશ્વર ચરણની સેવા, હેવાએ હું
હળિયો; કહીએ આણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મળિયો....’
આણચાખ્યો... અનંત જન્મોમાં કયાંય ન ચાખવા મળ્યો હોય તેવો આ
ચરણ સેવાનો રસ... બીજા બધા રસો જેની આગળ ફિક્કા થઈ જાય
એવો આ ચરણ સેવાનો ર....સ.

પ્રીતિ અનુષ્ઠાન કે ભક્તિ અનુષ્ઠાન અથવા વચન અનુષ્ઠાનમાં જોડાઉં
છું ત્યારે એવો તો આજાપાલનનો રસ ચાખવા મળે છે કે હું જૂમી ઊંઠું
છું.

આવા અનુપમ રસની લ્હાણ કરવા બદલ તારો ખૂબ ખૂબ આભારી
હું છું, દેવ!



દેવ ! તમને હું જોઈ રહું. તમારા મુખ કમળને નીરખ્યા કરું. વહ્યા
કરે હર્ષના આંસુ આંખમાંથી. અને એ અશ્રૂસલિલા ભાગીરથીના ખળખળ
વહેતા પ્રવાહમાં પાપોની ગંદકી ધોવાઈ જાય...

ન જોવા યોગ્ય ઘણું બધું ઘણી બધી વાર આંખો ફાડીને જોયું...
પણ આપને ન જોયા.. એનાં પ્રાયશ્ચિત્ત રૂપે વહી રહી છે આ આંસૂની
ધારા. તમને જોઉં છું ને આંખો ભીની ભીની થઈ જાય છે. હૈયું ભરાઈ
જાય છે. ‘આખરે તમે મને દર્શન આપવા આવ્યા ખરા.’

કેટલીવાર મેં વિનતિ કરેલી : ‘દીજે દરિસન વાર ઘણી ન લગાવીએ’.
પણ તમે મારી અરજી પર ક્યાં ધ્યાન આપતાં જ હતા? તમે ઢીલ કર્યે
જ ગયા, હું દર્શન માટે જૂરતો ગયો. મારી ધ્યાસ. જૂરાપો..

મારી આ ઘાસ: દર્શનની. કઈ રીતે છીપાવું એ ઘાસને? ‘પાની પીકર ઘાસ છીપાવું, નૈનન કો કેસે સમજાવું? યુગ બીતે ના આઈ મિલનકી પૂરન- માસી રે... દર્શન ધો... મોરી અભિયાં ઘાસી રે..’

બહારની તરસને તો પાણી પીને છીપાવું, પણ આ દર્શનની તરસનું શું કરું? ‘નૈનન કો કેસે સમજાવું?’ મારી આ વહેતી આંખોને શી રીતે પટાવું? એ તો હઠ લઈને બેઠી છે: મારે દર્શન જોઈએ.

‘દર્શન ધો ! મોરી અભિયાં ઘાસી રે !’

અને એ ઘાસને શમાવવા દર્શનસુખ કદીક આપ્યું, પણ એ ટીપાંથી મારી તૃધા શેં છીપે? આજે તમે મને દર્શનસુખ આપ્યું..

‘મદ્દૂશૌ ત્વનુખાસક્તે...’ કહીને પૂજ્ય હેમચન્દ્રાચાર્ય મહારાજ ભક્તની આંખોને ભગવાનનું દર્શન સતત મળ્યા કરો એમ કહી રહ્યા છે.

તમને નીરખ્યા જ કરું.. અને હર્ષાશ્રૂ વહ્યા જ કરે..

આ સ્થિતિમાં પલટો ન થવા દેતા, દેવ !



માત્ર આંખો જ હર્ષ પ્રગટ કરે છે એમ નથી. હર્ષોલ્લાસના આ દિવ્ય સંગીતમાં બધા અંગો સૂર પૂરાવી રહ્યા છે. આપનું દર્શન થતાં ઉપજેલા આનંદને બધા જ અંગો-અરે, ઉપાંગો પણ- પોતપોતાની રીતે અભિવ્યક્ત કરી રહ્યા છે.

“હું તમારી સામે આળોટી રહ્યો હોઉં,” હેમચન્દ્રાચાર્ય ભક્તના ભાવોન્મેષને શબ્દ દેહ આપી રહ્યા છે, “અને એ ભૂલુઠન વડે મારા કપાળમાં પડેલ ધા અસેવ્યને કરેલ પ્રણામનું પ્રાયશ્ક્રિત કર્યા કરો.” કેવો ભાવોન્મેષ છે આ !

તમને જૂકી જૂકીને નમું... તમને જોતાં જ ધરતી પર લેટી પડું.
ધૂંટણિયે પડી રહું. મસ્તક ધૂળમાં રગડોળાઈ રહ્યું હોય.. હર્ષાશ્રૂથી
ભીનીભીની ધૂળમાં.

કિણાવલિ/ઘા શબ્દ બહુ સૂચક છે. ભક્ત આ કિયાને કેટલીવાર
દોહરાવવા માગે છે તેનો સંકેત એ શબ્દ આપી જાય છે. કપાળ રક્તરંજિત
ન થાય ત્યાં સુધી ભૂમિસ્પર્શ કર્યા કરવો છે, કર્યા કરવો છે.

આંખો જ ભીની ભીની બને એમ નહિ કપાળ પણ ભીનું ભીનું
બને. આંખ આંસૂ વડે. કપાળ લોહી વડે.

● ● ●

‘તપસ્વિનઃ’. કપાળને તપસ્વિની ઉપમા આપી.

પ્રણામ કરવા યોગ્ય માત્ર તમે જ. જેમને શિર જૂકાવવું જોઈએ એવા
માત્ર આપ જ. આજ આપને ચરણે હું શિર જૂકાવું છું ત્યારે એની આ કિયા
તપશ્ચર્યા બની છે.

અત્યાર સુધીનું જૂકવું કષ્ટકિયા હતું. આજનું જૂકવું તપશ્ચર્યા છે.



मम त्वददर्शनोदभूता-
श्विरं रोभाञ्चकण्टकाः ।
नुदन्तां चिरकालोत्था-
मसददर्शन वासनाम् ॥ ४ ॥

त्वद्वक्त्रकान्तिज्योत्सासु-
निपीतासु सुधास्विव ।
मदीयैलोचनाभ्योजैः
प्राप्यतां निनिमेषता ॥ ५ ॥

त्वदास्थलासिनी नेत्रे,
त्वदुपास्तिकरौ करौ ।
त्वदगुणश्रोतृणी श्रोत्रे,
भूयास्तां सर्वदा मम ॥ ६ ॥

તમારા દર્શન કરું છું, નાથ! અને પૂરું શરીર રોમાંચિત થઈ ઉઠે છે.

તમને જોઈને થતો આ રોમાંચ. પૂરું શરીર કોટિ કોટિ રોમાંચ રૂપી આ ધજો ફરકાવી જાણો કે દર્શનના આનંદ મહોત્સવમાં ભાગ લઈ રહ્યું છે.

પરમાત્માને 'નજર માંડીને' જોયાનું આ ફળ. પરમાત્મકૃપાનો આ મેહ વરસ્યો ત્યારે બધી છત્રીઓ (બીજા બધા રસો) ફગાવી ખુલ્લે ડિલે (અને દિલે) પેલા મેહમાં નાહ્યા. ખૂબ ખૂબ નાહ્યા અને વરસેલો મેઘ ધરતીને હરિયાળી ઘાસના મેદાનોથી ભરી દે, તેમ પૂરું શરીર રોમાંચોથી ભરાઈ ઉઠ્યું

● ● ●

બારે મેઘ ખાંગા થઈને વરસી પડે ને ચોકની પાણીની સપાટી ઊચી ને ઊંચી વધતી જાય.. સામી બાજુ પાણીની નીકાસ માટે નાનકડી ખાળ છે, જે આ ધસમસતા પ્રવાહને બહાર શેરીઓમાં લઈ જવા સંપૂર્ણ રીતે અક્ષમ છે.

તારી કૃપાનો મેહ જયારે અનરાધાર તૂટી પડે છે ત્યારે મારી શરીરની હાલત કંઈક આવી જ થાય છે. એટલું તો સુખ... આંખોની અશુભિન્હુઓ વહાવવાની તાકાત બહુ અપૂરતી લાગે છે આ વખતે.

त्यारे आ रोमराण मारी मददे आवे છે. એક એક રुंवाँु हર्षनी
भीतर वधती जती सपाटीना समाचार लઈने बહार आવे છે. ‘હुं
चातક तुमे મेह’ नी ઉકित बोलकी थઈ ઊठे છે આ વખતે.

આ કૃપाधाराना આटलા મોટा તારા અનુગ્રહની સામે હું શું આપીશ?

શું આપું ?

મારી પાસે છે શું ?

જે છે તે તમે લઈ લીધું છે. ‘ચિત્તહું અમારું ચોરી લીધું !

● ● ●

આ રોમાંચ. પ્રવીણ દેસાઈ યાદ આવે: ‘તારી ધારાને મેં જીલી
જ્યારે જ્યારે, મારે રોમે રોમે ફૂલ ખીલ્યા ત્યારે’. રુંવાડે રુંવાડે ઊઠેલ
આ ફૂલ, આ પ્રસંગતા તારું જ વરદાન છે, પ્રભુ !



‘મદદશૌ ત્વનુખાસકે...’ થી શરૂ કરેલ દર્શનયાત્રામાં એક પડાવ
આગળ વધવું છે.

કો’ક કો’ક વાર કૃપા કરીને તમે દર્શન આપો એમાં હવે મને ધરવ
ન થાય. મારે તો સાતત્ય જોઈએ દર્શનસુખમાં.

‘પ્રાપ્યતાં નિર્નિમેષતા.’ અપલક નયણે તમને નીરખ્યા જ કરું, નીરખ્યા
જ કરું. વચ્ચે વચ્ચે આંખ પલકારો મારે એય મને ગમે નહિ.

આંખને કહું છું : ‘દેખણ દે સખી! દેખણ દે, ચન્દ્રપ્રભુ મુખ ચંદ..’
મને જોવા દે આ પરમાત્માનું વિશ્વમોહન રૂપ. ધરાઈ ધરાઈને જોવા દે.’

‘મુખ દીઠે સુખ ઉપજે, દરિસણે અતિ હી આણંદ....’ લાગે કે
શબ્દો ઘણા પાછળ રહી ગયા છે. હું આનંદલોકમાં પ્રવેશી ચૂક્યો છું.

‘त्वद्वक्त्रकान्तिज्योत्सनासु निपीतासु सुधास्विव....’ तમने जोया
अने अमृतना घूंट पीधा होय एम कोठे टाढक वળी. जनम-जनमनी
ખास छीपाई.

હવे अनिमेष नयने तमने नीरभ्या જ કરું આટलી જ અભિલાષા
રહ्यા કરે છે. અર્દશનની પ્રતીક્ષાભરી લાંબી રાત પછી સૂર્ય સમું તમારું
દર્શન થયું છે ત્યારે મારી આંખોને અનિમેષતાનું વરદાન મળો! ‘પ્રાયતાં
નિર્નિમેષતા....’

હા, એય તમારે આપવી પડશો. દર્શન આપ્યું (‘કરકે કૃપા પ્રભુ
દરિસન દીનો’) તો પછી અનિમેષતા આપશો જ ને !

આપશોને ?

હાથ પસારી બેઠો છું.

એવું કંઈક કરી આપો કે મારી આંખો બીજે ક્યાંય જાય નહિ.
તમારા મુખદર્શન સિવાય બીજે ક્યાંય એને જંપ વળે નહિ.

● ● ●

મુશ્કેલી સાતત્યની છે.

દર્શન તો કરું છું તમારું. એ થોડી સેકન્ડો સ્વર્ગીય સમય બની
રહે છે મારે માટે. પણ, તમારા દર્શનને બદલે બીજામાં હું જ્યારે ખોવાઈ
જાઉં છું ત્યારે—

પરરૂપ દર્શનની કિયા દુખદાયિની છે એ સમજવા છતાં મારી આંખો
જ્યાં ભટકે છે, હું શું કરું ભગવન્ !

તારી પાસે આવીને સ્તવનામાં બોલું છું ‘કામરાગે અણનાથ્યા સાંઠ
પરે ધસ્યો, સ્નેહરાગની રાચે ભવપિંજર વસ્યો, દષ્ટિ રાગ રુચિ કાચ
પાચ સમક્ષિત ગણું....’ આ બોલતી વખતે મારી આંખોમાંથી ધોખબંધ
વહેતા આંસૂઓને શું આપ નથી જોતા ?

આ કામરાગે મને ક્યાંયનો ન રાખ્યો, પ્રભુ ! વિજાતીય રૂપ જોતાં જ વૃત્તિઓ બદલાઈ જાય છે. આંખો એ બાજુ ફળી જાય છે. અને પછી ઈન્દ્રિયોની શૃંખલા.....

ઉપાય એક જ છે. ને એ આપના હાથમાં છે. દર્શનસુખ આચ્યું, હવે સાતત્ય આપી દો. મારું મન જો ચોવીશે કલાક આપના ગુડાગાનમાં જ રક્ત હોય તો તાકાત છે બીજા તત્ત્વોની કે અંદર પ્રવેશી શકે.

આંખો અનિમેષ બનો! મન તમારામાં લીન બનો !



મારું પૂરું અસ્તિત્વ તારામય બની રહો, પ્રભુ ! હું તારામાં પૂરો સમાઉં નહિ (કે તું મને તારામાં સમાવે નહિ....) ત્યાં સુધી મારું બધું જ તારામય બની રહે.

તમને સ્પર્શું કે જોઉં એટલું જ નહિ, તમને શ્વસું. ‘એક શ્વાસમાંહિ સો વાર સમરું તમને...’ એ મારા માટે ન હોય તો ય સાંસ,સાંસ પર એકવાર તો તમારું સુમિરન હો જ !

‘આચારાંગ સૂત્ર’ ખોલીને બેસું છું. ને.....ક્યારેક શું થાય છે તે કહું ? શબ્દ-પરમાત્માને મારી સામે જોતાં એવો તો ભાવાવેશ છલકાય છે...‘નયનાં વહે દોઉં નીર..’ પાપણે બાંધેલ પાણિયારું સતત ચૂયા કરતું હોય. વાંચી ન શકાય.

સૂરદાસ યાદ આવે : ‘વિલોકે ભીંજે.’ મજાનો સંદર્ભ ભક્ત સૂરદાસે પકડ્યો છે. ભક્ત પાસે પ્રભુનો સંદેશ આવે ત્યારે ભક્તની કેવી હાલત થાય? પ્રજમાં શ્રીકૃષ્ણનો પત્ર આવે છે, છતાં કોઈ ગોપી તેને વાંચી શકતી નથી.

‘કોઉં પ્રજ વાચત નહિ પાંતી.... નેન સજલ, કાગદ અતિ કોમલ, કર અંગુરી અતિ તાતી, પરસે જરૈ, વિલોકે ભીંજે, દુહુ ભાંતિ દુખ છાતી....’

ગ્રજમાં કોઈ પત્ર વાંચ્યતું નથી... આંખ સજળ, પત્ર કોમળ, ને હાથની આંગળીઓ વિરહવેદનાથી ગરમ...ડર લાગે કે સ્પર્શવાથી પત્ર બળી જશે.... ચલો, થોડી ક્ષણો ધરાઈને જોવા મળે તોથ્ય પરિતોષ થાય. પણ નજીક લાવીને જોવામાં ડર રહે છે: ભીજાઈ જશે તો !

‘આચારાંગ’ ગોખતાં મનનો ઘોડો સમવસરણ-પ્રદેશમાં પહોંચી જાય... શબ્દ પરમાત્માથી રૂપ પરમાત્મા સુધીની આ દોડ...કેટલી તો તૃભિદાયક! પ્રભુ! આપના શબ્દો મારા પર વરસી રહ્યા છે અત્યારે... ને હું ભીજાઈ રહ્યો છું.

● ● ●

‘ત્વદાસ્યલાસિની નેત્રે...’ આંખો તમારા મુખ પર જ સતત મંડાયેલ હોય. ‘મારા નયણાં લંપટ જોવે ક્ષણ ક્ષણ તુજ જો...’ જો કે માત્ર બે આંખોથી જ પ્રભુને જોવામાં અતૃભિ રહ્યા કરવાની. સૂરદાસે કહું છે કે ભગવાન પાસે કંઈક માંગવાનું હોય ત્યારે એક જ ચીજ માંગવાની: ‘લોચન રોમ રોમ પ્રતિ માંગૌ...’ કેટલી મનોહર કલ્પના છે ! રોમે રોમે લોચન. ! જોયા જ કરું તમને. બે આંખો... ને એથ ઉઘાડ-મીંચ થતી આંખો.... ‘કહા કરૌ છબિરાશિ શ્યામઘન, લોચન દે પુનિ ઠાઉં, તે પર યે નિમિષ ‘સુર’ પુનિ, યહ દુખ કાહિ સુનાઉં..’ પરમાત્મા કાન્તિપુંજ, બે લોચનમાં શી રીતે સમાય? ને એમાં આ પલકારા... જો કે મેં તો ‘પ્રાયતાં નિર્નિમેષતા...’ પહેલા જ માંગી લીધી છે..

‘નેત્રે.’ આંખો આપને જ જોયા કરે. ને કેવી ઠંડક મળે છે! પૂ.માનવિજ્ય મહારાજ કહે છે. ‘તુજ મુખ સન્મુખ નીરખતાં, મુજ લોચન અમી ઠરંતાં... તેહની શીતલતાં વ્યાપે, કિમ રહેવાયે કહો તાપે...!’ કેટલી ઠંડક! ‘મુજ લોચન અમી ઠરંતા...’

પહેલાં મને પ્રશ્ન થયેલો કે ‘અમી છલકંતા’ કે ‘અમી વરસંતા’ને બદલે ‘અમી ઠરંતા’ લોચનની વાત સતવનાકારે અહીં કયા સન્દર્ભમાં લખી છે? પણ એક ભાવાનુભૂતિ તમે મને આપીને એનો સંદર્ભ સમજાવ્યો. પ્રભુ! તમારો કેટલો તો હું ઝાણી છું.

આવું બનેલું : બે-ચાર દિવસથી મારી ભક્તિ જામતી નહોતી. કેટલો તો હું રડેલો... વિહાર-યાત્રા ચાલુ હતી... સમજાતું નહોતું કે આવું કેમ થાય છે. તે દિવસે તો લડવાના મૂડમાં સવારથી જ હતો. આજે જો દર્શન-સુખ ન મળે તો બસ, કિંડા !

વિહાર કરીને સામે ગામ ગયો. દહેરાસરે સીધો જ.... ભોંયરામાં તમે....! શ્યામસુંદર રૂપ, વિશાળકાય મૂર્તિ....પ્રસત્તવદન.... જોતાં જ મારા વિરહાશ્રૂ ઠરી ગયા. હું અવાક્ / સત્ય..... તમને જોતો જ રહ્યો.... ચૈત્યવંદન કરવાનું પણ પા કલાક પછી થયું. એ દિવસે ‘મુજ લોચન અમી ઠરંતાં’ નો અર્થ સમજાયો હતો. વિરહાશ્રૂને જ તમે અમીની (અમૃતબિંદુની) પ્રતિષ્ઠા આપેલી... ઠરી ગયેલ વિરહાશ્રૂ... કયારેક નાના બાળકની આંખો આવી જોવા મળે. રડતું હોય મમ્મી વિના, આંખમાંથી અશ્રૂધારા નીકળતી હોય. ને મમ્મી એને ઊચકી લે. જોઈ લો, ખુશ ખુશ.... પણ આંખમાં આંસૂ દેખાય. ચહેરો હસુ-હસુ....

● ● ●

‘લોચન અમી....’ ‘સ્નાતસ્યા’ સૂત્રના પ્રથમ શ્લોકમાં બાલચન્દ્ર મુનિએ સરસ કલ્પના આપી છે. મેરુ પર્વત પર પ્રભુનો અભિષેક થયા પછી ઈન્દ્રાણી પ્રભુના પરમ પાવન શરીરને કૌરેય વલથી લૂછી રહ્યા છે અને ત્યારે એક રોમહર્ષક ઘટના ઘટે છે. ઈન્દ્રાણીની આંખો પ્રભુના રૂપને જોવાથી હર્ષાશ્રૂથી સભર બને છે. સજણ આંખો... પણ ઈન્દ્રાણી આ આંખોની ભીનાશને પ્રભુના શરીર પર પ્રતિબિનિષ્ટ કરે છે. શરીર પ્રભુનું ભીનું-ભીનું લાગ્યા કરે....ને તેઓ લૂછ્યા જ કરે.

● ● ●

‘ત્વદુપાસ્તિકરૌ કરૌ....’ હાથ તમારી સેવામાં ઓતપ્રોત રહે. ગલાન મુનિઓની વેયાવચ્ચ કરું અને પરમપાવન ‘આચારાંગસૂત્ર’ની રણજણાવતી પંક્તિ યાદ આવે : ‘જો ગિલાણં પડિવજજઈ સો મે પડિવજજઈ.....’ ગલાનની સેવા તે મારી સેવા.

એક વાર મને ઘ્યાલ છે કે બિત્ત સંદર્ભમાં સહેજ આરક્ત નેત્રે
તમે મને આ વાક્ય કહેલું. ઉપાશ્રયે જ્વાન મુનિની સેવામાં વેઠ વાળી,
તમારે ત્યાં આવેલ. સ્તવનાઓ રટતો હતો. ને આભાસ થયો, જાણો કે
તમે કહેતા હતા : રાગોડાં તાડો શા માટે અવાજ કરે છે ? ત્યાં જઈને
પેલાની સેવા કર, મારી સેવા એમાં આવી જશે.... હું તરતજ ઉપાશ્રયે
આવી ગયો. ત્યારથી વેચાવચ્ચમાં જે રસ આવે છે....

તમે કેટલું બધું અમને આપ્યા કરો છો, પ્રભુ ?

● ● ●

‘ત્વદ્ગુણશ્રોતૃણી શ્રોત્રે.....’ તારા ગુણોને સતત સાંભળ્યા કરું. તમારા
શબ્દોને તો સમવસરણમાં સાંભળેલા. આજે પણ એની યાંદ આવે છે ને
મન તરબતર થઈ જાય છે. મનની એ ભૂમિકા પર તારા ગુણોને સાંભળું
છું..... ‘ભૂયાસ્તાં સર્વદા મમ....’ પણ મારી મહેચ્છા એ છે કે સદા
સર્વદા હું તમારા ગુણોને સાંભળ્યા કરું.

હમણાં જ ‘દશવૈકાલિક’ સૂત્રનું ‘સજ્જાયમ્મિ રતો સયા’ પદ ધૂંટચું હતું.
ને ત્યારે થયું હતું કે સ્વાધ્યાયમાં હંમેશા રત તો રહેવાય જ, પણ સર્વદા રત
રહી શકાય ? ચોવીશ કલાકનો સ્વાધ્યાય... શી રીતે એ શક્ય બને? કારણ
કે કિયાઓ પણ કરવાની છે. વેચાવચ્ચ પણ કરવાની છે. ને ભક્તિમાર્ગ તો
કેન્દ્રબિન્દુ છે; તેમાંથી તો પૂરા દિવસ માટેની તાજગી મેળવવાની છે. તો
સદા તો સ્વાધ્યાય હોઈ શકે, સર્વદા સ્વાધ્યાય હોઈ શકે ?

આપે જ એનો જવાબ આપેલો કે સ્વાધ્યાયનો અર્થ સ્વનું અનુભાવન,
સ્વનું સ્પર્શન કરવાનો ને એ સંદર્ભમાં ચોવીસ કલાકનો સ્વાધ્યાય શક્ય
છે. કિયા કરતાં ભાવવિભોર બનીને, ‘લોગસ્સ’ જેવાં સૂત્રને ઉચ્ચારતાં
જિનગુણને સ્પર્શને નિજ ગુણને સ્પર્શવાનું બને.

પ્રેરણ થયો કે ઊંઘી જઈશ ત્યારે સ્વગુણાનુભૂતિ શી રીતે થશે ?
આપે સમજાવેલું કે તારું શરીર ઊંઘી શકે, તારે ક્યાં ઊંઘવાનું છે ? ને

તું ઊંઘીશ તો ‘અતરંત પમજજાએ ભૂમિં’ કોણ કરશે ? સાધુનું કોન્સ્યસ સ્તર સૂતેલું હોય ત્યારેય અનું અન્કોન્સ્યસ સ્તર અપ્રમત્ત રહી શકે છે. એ માટે પહેલાં જાગૃતિના પૂરા ગાળાને ભરી દેવો જોઈએ....

‘તદ્ગુણશ્રોતૃષી....’ તમારા ગુણોને સતત સાંભળ્યા કરું. સંત તુલસીદાસ યાદ આવે : ‘જિન કે શ્રવન સમુદ્ર સમાના, કથા તુમહારી સુભગ સરિ નાના; ભરહિ નિરંતર હોહિ ન પૂરે, તિનકે હિય તુમ કહું ગૃહ સૂરે....’ ભક્તોના કાન સમુદ્ર જેવા હોય છે, તેમાં પ્રભુની કથા રૂપી નદીઓ ગમે તેટલી પેસે તે ભરાય જ નહિ, ભક્તને એથી તૃપ્તિ ક્યારેય ન થાય....



कुण्ठापि यदि सोत्कण्ठा।
 त्वदगुणग्रहणं प्रति ।
 भैषजा भारती तर्हि
 स्वस्त्ये तस्यै किमन्यया ॥ ७ ॥

तव प्रेष्योऽस्मि दासोऽस्मि,
 सेवकोऽस्म्यस्मि किङ्करः।
 ओमिति प्रतिपद्यस्व,
 नाथ ! नातः परं ब्रुवे ॥ ८ ॥

श्री हेमचन्द्रप्रभवाद्
 वीतरागस्तवादितः ।
 कुभारपालभूपालः
 प्राज्ञोतु फलभीष्मितम् ॥ ९ ॥

મને ખ્યાલ છે કે બોલવામાં મારી ઘણી બધી ભૂલો થઈ રહી છે. મારી વાળી તરડાઈ રહી છે.. તુટક-ધૂટક થઈ રહી છે. એનું કારણ મારી આન્તર સૃષ્ટિ છે. જ્યારે આપ એકદમ નજીક લાગો છો ત્યારે આનંદના અતિરેકમાં હું ભાન ભૂલી જાઉં છું.. મને ખ્યાલ નથી હોતો, હું શું બોલું છું. ક્યારેક આટલી બધી અરજી, પ્રાર્થના, કાકલૂદી નિષ્ફળ જતી લાગે ત્યારે નિરાશાની ખીણમાં પહોંચી જાઉં.. માત્ર રડચા કરું, આંસૂ સાર્યા કરું.

બેશક, એ આંસૂ આપની કૃપાધારાએ જ લૂછ્યા હોય છે. એટલે જ પાછો આશ્વસ્ત બની જાઉં કે નાથની દૃષ્ટિ મારા પર છે તો ખરીજ.

મારી વાળી કુંઠિત છે, પણ તારા પ્રતિ એ ઉલ્કંઠિત છે, ને એટલે હું આનંદમય છું. મારે ક્યાં દુનિયાને મારી અસ્ખલિત વાગ્ધારા બતાવવી છે? દુનિયાનું પ્રમાણપત્ર લેવામાં અગણિત જન્મો મેં બગાડ્યાં, હવે તો જોઈએ માત્ર તારું જ સાર્ટિફિકેટ. તમે મને પ્રમાણિત કરો છો ને પ્રભુ ?

પૂછ્યું'તું હનુમાને રામચન્દ્રજીને : દુનિયા મને ભક્ત તરીકે સંબોધિત કરે છે, પણ મને એમાં કોઈ રસ નથી. તમે ભક્તના લક્ષણો આપો તો આન્તર નિરીક્ષણ કરી શકું. રામચન્દ્રજીએ કહેલું : 'કરત ભક્તિ મમ પુલક શરીરા, ગદ્ગદ ગિરા નથન બહે નીરા..' પ્રભુની ભક્તિ કરતાં

શરીર રોમાંચિત થઈ ઉઠે, ગળે ઝૂમો ભરાઈ આવે ને આંખે શ્રાવણ-
ભાદરવો વહે....

યાદ આવે ચૈતન્યદેવ : ‘નયનં ગલદશ્રૂધારયા, વદનં ગદ્ગદરુદ્ધયા
ગિરા; પુલકૈ નિંચિતં વપુઃ કદા તવ નામગ્રહણે ભવિષ્યતિ..’ તારું નામ
લઉં છું ભગવાન! ત્યારે ક્યારેક તો આવી હાલત થાય છે, ક્યારેક નથી
થતી... હું ભક્ત ખરો કે નહિ, ભગવાન?

યાદ રાખજે, ભક્ત હોઉં યા અભક્ત હોઉં, તારો જ છું.. ‘ભલો
ભૂંડો પણ દાસ છું તારો...’ ને તારો દાસ અવ્યવસ્થિત હશે તો શરમાવાનું
કોને થશે ?

● ● ●

‘કુંઠાપિ..’ વાણી મારી ભલે ખચકાતી, અટકાતી, લંગડાતી હોય;
પણ એ તારા ભણી જ વહી રહી છે એનો મને પૂરો આનંદ છે, દેવ!
‘કિમન્યયા?’ અસ્ખલિત વાણી પણ સંસારગામિની કે સંસારનું વર્ણન
કરનારી હોય એના કરતાં લાખ દરજજે મારી આ વાણી સારી છે....

મારા શબ્દોના પુષ્પો તારા ભણી સતત વહ્યા કરો! બીજું કંઈ નહિ
તો માત્ર તારું નામ જ રટ્યા કરીશ હું તો. મારે એવી રીતે તારું નામ
રટવું છે કે કવિ કહે છે તેમ, ‘હૈયાના એક એક સ્પંદન પર તારું નામ
લખાજો!’

□

મારા પરની તારી આ અહેતુકી કૃપા.... તેં મને ભીજવ્યા જ કર્યો,
ભીજવ્યા જ કર્યો.... થાય છે કે હું તારી ભક્તિ શી રીતે કરું? ઋણમુક્તિનો
તો કોઈ સવાલ જ નથી, પણ આછી સી ભક્તિ તારી થાય તોય મનને
પરિતોષ મળે. શ્રી દલપતભાઈની સ્તવના યાદ આવે: ‘પ્રભુ! તેં મને જે
આપ્યું છે તેનો બદલો હું શેં વાળું; બસ તારી ભક્તિ કરી કરીને મારા
મનડાને વાળું....’

જો કે અહીં પૂ. માન વિજય મહારાજ યાદ આવી જાય: ‘કૃષું કર ભક્તિ કરું પ્રભુ તેરી?’ અને હામ છૂટી જાય. જો આટલા મોટા ગજાના ભક્તિયોગાચાર્ય કહેતા હોય કે પ્રભુની ભક્તિ હું શી રીતે કરું? તો પછી હું તો શી રીતે કરી શકું જ?

ચાલો ભક્ત નહિ તો દાસ તરીકે તો મને સ્વીકારો! ‘તવ પ્રેર્થોસ્મિ..’ પ્રેર્થ.. તમારો સંદેશવાહક. તમે અંબડને એ સંત્માન આપ્યું હતું: સુલસાને ધર્મલાભ એના દ્વારા તમે પાઠવેલો... આવું કોઈ કામ ચીંધશો તોય હું બડભાગી બની જઈશ. ‘દાસોસ્મિ..’ હું છું તારો દાસ. તારે દ્વારે ચોવીસ કલાક બેઠો રહું. એ બહાનેય તમારી નજર મારા પર પડે ને! હું મારા કાનને એ વખતે માત્ર તમારા મુખ તરફ કેન્દ્રિત રાખીશ. સ્વામી બોલાવે ને મને ઘ્યાલ ન આવે એવું ન થઈ જાય. હું અપ્રમત્ત રહું..

ને તમે બોલાવો, તમારી સેવામાં, તો હાજર થઈ જાઉં. જેવી આવડે તેવી સેવા કરું. ‘સેવકોસ્મિ..’ ઈચ્છા તો એવી હોય કે અર્ધો-અર્ધો કલાકે તમારી પાસે આવીને પૂછ્યા કરું : સાહેબ, કંઈ કામકાજ? ‘અસ્મિ કિંકરઃ’...

ઘ્યાલ એટલો જ નથી આવતો કે આપને શું ગમશે? આપ મને પ્રેર્થ/સંદેશવાહક તરીકે કામ આપો, દાસનું, ચોકિયાત જેવું બેસી રહેવાનું કામ મને ભળાવો કે મને આપની સેવામાં રાખો યા કિકરત્વ આપો.... મીરાંની જેમ હું તો કહીશ: ‘મને ચાકર રાખો જી!’ ‘ઓમિતિ પ્રતિપદ્યસ્વ...’ આપ હા કહીને સ્વીકારો એટલે મારું કાર્ય પરિપૂર્ણ બને.



કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજા દ્વારા રચાયેલ આ વીતરાગ-સ્તવના દ્વારા કુમારપાળ રાજાને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાવ !

ભક્તનું ઈચ્છિત બીજું શું હોઈ શકે? ભક્તને જોઈએ છે પરમાત્મા સાથેનો શાશ્વત સંયોગ. શાશ્વતીમાં પરિણમતું મિલન.. જેને ભક્તિયોગાચાર્યો નદી-સમુદ્ર સંયોગ કહે છે.

કુમારપાળ રાજાએ પોતે રચેલી ‘આત્મનિન્દા દ્વાત્રિંશિકા’ માં પોતાની મહેચ્છાને મજાના શબ્દોમાં ગુંથી છે: ‘કદા ત્વદાશાકરણામતાવસ્ત્યકૃત્વા મમત્વાદિ ભવૈકકન્દમુ; આત્મેકસારોનિરપેક્ષવૃત્તિઃ’... તમારી આજાના પાલનના નિરવધિ આનંદમાં ઝૂમીને હું એવો નિરપેક્ષ ક્યારે બનીશ કે મોક્ષને વિષે પણ હું નિરુત્સુક/નિરીહ હોઈશ !

અને હું તમને પૂછું પ્રભુ ! કે કુમારપાળ જેવી નિરપેક્ષતા મને ક્યારે આપશો? ક્યા...રે...?



પ.પૂ આચાર્ય ભગવંતશ્રી યશોવિજયસૂરિ મહારાજ દ્વારા લખાયેલ પુસ્તકો

- સાધના : અસ્તિત્વ ભણીની યાત્રા
- ‘દરિસન તરસીએ’..... ભા. ૧-૨.
(ભાગવતી સાધનાની સસ્ત્ર વ્યાખ્યા)
- ‘બિઘૂરત જાયે પ્રાણ’.....
(મહાન સિદ્ધર્થ કૃત જિનસ્તવના પર સંવેદના)
- ‘સો હી ભાવ નિર્ગંધ’.....
(સમાધિ શતક, કરી : ૧ થી ૩૦ ઉપર વિવેચના)
- આપ હી આપ બુગાય’....
(સમાધિ શતક, કરી : ૩૧ થી ૫૧ ઉપર વિવેચના)
- ‘આતમજ્ઞાની શ્રમણ કહાયે’.....
(ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫મા સભિકખુ અધ્યયન ઉપર સંવેદના)
- ‘મેર અવગુણ ચિત ન ધરો’.....
(કુમારપાળ ભૂપાળ કૃત ‘આત્મનિન્દા દ્વાત્રિંશિકા’ પર સંવેદના)
- ‘અધિલ જિનેસર પ્રિતમ માહરો રે’.....
(શ્રી આનંદધનજી મહારાજની સત્તવનાઓ પર સંવેદના) [સત્તવન ૧-૫]
- પ્રભુનો પ્ર્યારો સ્વર્ણ
(પરમ પાવન શ્રી દશવૈકાલીક સૂત્ર (૧-૪) પરની વાચનાઓ.)
- આત્માનુભૂતિ
(યોગ પ્રદીપ, શાનસાર, આદિ ગ્રન્થો તથા પૂ. ચિદાનંદજી મહારાજનાં પદોમાં મળતાં સાધના સૂત્રો પર વિશ્લેષણ)
- અસ્તિત્વનું પરોટ
(હદ્યપ્રદીપ ઘટત્રિંશિકા પર સ્વાધ્યાય)
- અનુભૂતિનું આકાશ
(પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી દેવચન્દ્રજી મહારાજ કૃત અષ્ટ પ્રવચન માતાની સર્જાય પર અનુપ્રેક્ષા

● ● ●

હવે પછીની : વિચારાધીન કૃતિઓ

- પ્રભુના હસ્તાક્ષર

પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજની સ્તવનાઓમાં પેશ થયેલી ભક્તિ અને સાધનાની પ્રસ્તુતિ ભાવક માટે અનુભૂતિમાં ફેરવાઈ શકે તેમ છે. અનુભૂતિપુરુષની આંગળી પકડીને થયેલ એક પ્રવાસ : મજાની સ્તવનાઓની આરપાર.

- પ્રભુ નિરમલ દરિસાન કીજિયે

પૂ. મહો. દેવચન્દ્રજી મહારાજ, પૂ. જ્ઞાનવિમલસૂરિ મહારાજ, પૂ. મહો. યશોવિજય મહારાજ અને પૂ.પં. પદ્મવિજય મહારાજની નવપદ પૂજાઓમાં વર્ણવાયેલ સાધના પદ્ધતિઓનું આછું સું આકલન.

- સમુદ્દ સમાના બુંદ મેં

અનુભૂતિનો સમુદ્ર નાનકડા શબ્દગુચ્છોમાં સમેટાયેલો જોવા મળે સાધનામનીધી પૂ.પં. શ્રી ભર્દંકરવિજયજી મહારાજનાં સાધનાસૂત્રોમાં, મંત્રપદો જેવાં એ સાધનાસૂત્રોની યાત્રા.

- મેરે પ્રભુ સું પ્રગટ્યો પૂરન રાગ

જેમનાં નયનોમાં અંકિત થયેલ પ્રભુરૂપને જોવા ભક્તો તલપતા'તા તે પૂજ્યપાદ ભક્તિયોગાચાર્ય કલાપૂર્ણસૂરિ મહારાજાએ આપેલ ભક્તિસૂત્રો અને સાધનાસૂત્રોનો સ્વાધ્યાય.

- તુમ મિટો તો મિલના હોય.

પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજની સવાસો ગાથાના સ્તવનની 'જેહ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે', જેવી સશક્ત સાધના પંક્તિઓની તથા સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં આવેલ સાધના સૂત્રોની વિભાવના.

- આનંદઘન બિન પ્રાણ ન રહે છિન.

પૂજ્યપાદ ભક્તિયોગાચાર્ય આનંદઘનજી મહારાજની સ્તવનાઓ અને પદોમાં વહેતી ભક્ત અને સાધનાની જુગલબંધીમાં ભીજાયેલી થોડીક કાણો.



'નિષ્ઠુરત
જાયે પ્રાણ.....'

KIRIT GRAPHICS-25352602